

૩૩

યતુ મૂકી આશાતના કરવી નહિ.



ॐ અહંકમ:

તતી સાચાદેવ શ્રીમુખતિનાથાય નમ:

# શ્રી મુખાંગુણ મહત્વ વિચાર

સંપાદક અને વિવેચક

સુનિશ્ચી ચ. પક્ષસાગરજી (સત્યાનંદ)



-: પ્રકાશક :-

પાતાણી નાનચંદ પરમાણુંદ

તળાજી (સૌરાષ્ટ્ર)



પ્રથમ આવૃત્તિ

વિર સંપત ૨૪૮૮

પ્રત : ૧૦૦૦

વિ. સં. ૨૦૧૮

મૂલ્ય : પઠન-પાઠન.

આ પુસ્તકને રખડતું મૂકી આશાતના કરવી નહિ.

ॐ અહંનમઃ

તાત્ત્વજ્ઞતીર્થાધિપતી સાચાદેવ શ્રી સુમતિનાથાય નમઃ

## શ્રી મુનિગુણ મહાત્મ વિચાર



સંપાદક અને વિવેચક  
મુનિશ્રી ચંપકસાગરજી (સત્યાનંદ)



-: પ્રકાશક:-

પાતાળી નાનચંદ પરમાણુંદ  
તળાજા (સૌરાષ્ટ્ર)



પ્રથમ આવૃત્તિ

પ્રતિ: ૧૦૦૦

વીર સંવત ૨૪૮૮

વિ. સ. ૨૦૧૮

મૂલ્ય: પઠન-પાઠન.

પ્રાતિસ્થાન  
પાતાણું નાનચંદ પરમાણુંદ  
તળાજ (સૌરાષ્ટ્ર)

સર્વ હક વિવેચકને આધિન છે.

:: સુદ્રક ::

શ્રી અરણ્ય પ્રીન્ટિંગ પ્રેસ :  
પ્રો :- ડાયાલાલ એન્ડ ફ્રેન્ચ ની કું.  
ખારેં, બાવુનગર ■ ■ ■

ॐ् अहंम्

॥ आत्मविज्ञानाष्टकम् ॥

ब्यापारव्यवहारौच, विभावगुणसंभवौ ।

विवाहादिसुकार्याणि, संसारवृद्धिहेतवे ॥ १ ॥

सम्यक्त्वविज्ञानचारित्रो, स्थिरता यदि संभवेत् ।

रागद्वेषमहामोहा, नष्टोजीवोशिवङ्कुरः ॥ २ ॥

अहिंसासयमं तप, श्वात्मविज्ञानकारणम् ।

परमानन्दो महानन्दो, शुद्धस्वरूपसिद्धिदम् ॥ ३ ॥

मनसि जातसङ्कल्पा, विकल्पश्रेणिसंभवाः ।

हर्षशोकौ कथंभूतौ, ? ज्ञेया तेषां हि संपदा ॥ ४ ॥

सच्चिदानन्द संविज्ञो, धीतरागो विभुर्महान् ।

निर्विकल्प समाधिस्थो, ह्यात्मा सिद्धः स्वभावजः ॥ ५ ॥

मिथ्यात्वमविरतिं पुनः, क्रोधमानमदादिकम् ।

संसारकारणं ज्ञात्वा. त्यक्त्वा शमंसमाचरेत् ॥ ६ ॥

उपयोगो हि धर्मः प्रोक्तो, योगस्तं कथितंबुधैः ।

ज्ञेयं द्रव्यानां विज्ञानं, पर्यायगुणसंभवम् ॥ ७ ॥

एकचित्तो भवेद्ध्याता, ध्येयन्तु निर्वृतिर्गुणः ।

ध्यानन्तु गुणलक्ष्यञ्च, चम्पकाविधः सुखी सदा ॥ ८ ॥



“ॐ ह्रीं श्री मदाचार्य आनन्दसागरसूरीश्वरजी गुरुभ्यो नमः”

॥ पुष्पाञ्जलिः ॥

यस्य कृपापरागुर्वार्ता, तस्य ज्ञानं गृहाङ्गणे ।

ज्ञानकोषो गुरोर्बात्वा, नमस्कारा भवन्तु मे ॥ १ ॥

परम पुज्य आगमोदारक श्री मदाचार्यानन्द सागरसूरीश्वरस्य पटालङ्कार गच्छाधिपति शान्तमूर्ति श्री मदाचार्य माणेकथ-सागर सूरीश्वरजी मदीय गुरोः श्रीमद मानसागरजी गणिवरस्य गुह बन्धुः संप्रति जैनदर्शने बहु श्रुतः । श्रीमतां भवतां मया सम्यकृतयाऽखंडिताङ्गां नाराधिता तथापि पुज्यानां चरणार्विन्दे भक्ति बत्सलोभूत्वा “मुनिगुणमहत्व विचार” पुस्तिका हपा पुष्पाञ्जलिं समर्पयामि तां करुणापरो भगवान् स्वीकुरुत इति अभ्यर्थना । ॐ शान्तिः शान्तिः शान्तिः

श्री तलाजा } लि. भवदीय चम्पक सागर.  
२०१७ संवत्सरे.

\*

ॐ ह्रीं श्री परमात्मने नमः

ॐ श्री मानसागरजी गणिगुरुभ्यो नमः

द्वि शब्दौ

संप्रति-वर्तमानकाले तपस्वी ऋषिमुनि धर्मे गृहिधर्मे राष्ट्रमध्ये चान्येपि मंडलेऽश्रमे छात्रालये केनचित् संस्थायां प्रायेण बहुलतया दामिकानां पाखण्डानां साम्राज्यं खलु वर्तते । तेनाऽहं कारमूर्तिरूपावश्यक्यश्चे किं लेखनं किं नलेखनमिति मूढधीजातोऽस्मि । तथा पि धृष्टतावष्टभ्य कथमपि लेखने साहस्रकृतः ।

પુ. આગમોદ્વારક આ. દેવશ્રી આનંદસાગરસ્કુરીધરજી  
 મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી માનસાગરજી  
 ગણુવર્યના શિષ્ય  
 મુનિરાજશ્રી ચંપકસાગરજી મહારાજ (સત્યાનનદ)



જીમ —

સ. ૧૬૩૭ નેંબ માસ.  
અગવરી (આરવાડ)

દીક્ષા —

સ. ૨૦૦૫ અપાઠ શુદ્ધ ૮  
સાખરમતી (ગુજરાત)



अरे विधातः । भवता किं कृतं, यत्सुशज्ज्यं त्यक्त्वा  
स्वच्छं दराजयं दत्तम् । हा हे ! भारतदेवताः क्षणताः येनार्थं देशोऽनार्थं  
तुलनां गतः तेन स्वच्छन्दं राजयेनास्माकं सृतम् । यत्र बहीदान-  
शालाऽभवत् । यत्राशक्त सशक्त भूयांसो प्राणय आश्रेयमलमेहन् ।  
तत् स्थाने बहोः हिंसाया यन्त्रालय । वर्त्तन्ते । यत्रमौति धर्म-  
स्थानेऽनीतिधर्मो मनुष्यादीनां रुढीभूतः । नीतिमयधर्मो रसातल-  
गतः किं बूमः कस्याद्ग्रे पुत्करामो येन द्रव्यान्नेन मुनीनामपि  
मनेऽमलिनी जातं वाक् प्रवचकी जाता, कायस्थितिः प्रायः  
निर्वीर्या क्रियाशैधिलयं करी जाता किं कृत्वा प्रभुस्मरणे वा  
स्वाध्याये मनोलीनो भवति ?

हे भारत देवते ! जागृत जागृत । यतः

“ राज्ञि धर्मिष्ठे धर्मिष्ठा, पापे पाप समे समा ।  
राजनमनुवर्त्तन्ते, यथाराजा तथा प्रजा ॥ १ ॥  
सुत्यजं रसलाम्पद्यं, सुत्यजं देहभूषणम् ।  
सुत्यजाः कामभेगाद्या, दुस्त्यजं दम्भ सेवनम् ॥ २ ॥  
स्वदोष निन्हवो लोक, पुजा स्याद् गौहवं तथा ।  
इयतैवकदर्थ्यन्ते, दम्भेन बत बालिशाः ॥ ३ ॥ ”

अतः दम्भो हि दूर्दम्य एव । यदि निर्दम्भे यदा प्रवृत्ति  
स्यात्तद्दोऽराधकेषु अग्रिमः स भवेत् । तस्मात्कलिकाले निर्दम्भी  
भवनं महादुष्कहं तथापि गुणेषु कथाश्चित् प्रवृत्तिकरणे निर्वीर्यो  
मास्मः । मया मुनिगुण महत्वं विचार नामा पुस्तिकायां यत्  
किञ्चि ह्लिखितं तत् सर्वं पुर्वं मुनीनां कथनानुसारेण यच्च-  
र्वितस्य चर्वणं कृनं तेनाल्प प्रयासेन ग्रसने सुगमता भवेत् ।  
अपिच यस्य कस्य पुस्तकस्य वाक्यं वा वाक्यार्थं मया गृहितं-  
ते सर्वे मयि प्रसेदुः तेनाहं स्तेन दोष भाग न भवामि । इयं

पुस्तिकाऽदर्शं तुल्या ज्ञेया यथाऽदर्शं मुखं विलोक्य दोषान्.  
 दूरिकरणे गुणान् प्रादुष्कं रणेऽदर्शी कारणहपः स्यात् तथा इयं  
 पुस्तिकापि कारणहपा ज्ञेया । नहिकस्यापि संप्रदायस्यऽम  
 स्थितस्य व्यक्तेः निंदाकरणेऽयं प्रयासो वा कृतः किन्तु वर्तमान-  
 काले मुनीनामाचारो षकुश कुशील पब वर्तते सरागचारित्रत्वात्  
 तेन यथाशक्ति धर्मेयतनीयं कस्यापिदेषो न निरीक्षणीयं गुण  
 ग्रहण पब महान् लाभोऽस्ति । यतः “प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरित-  
 आत्मनः किं नु भे पशुभिः तुल्यं, किं नु सत् पुरुषैरपि ॥ १ ॥”  
 अस्याकृतेः प्रेसकोपी पं. शाह नानचंद्र परमानन्देन तथा  
 श्री अहोदय मुद्रणालये मुद्रणकृते तथा सद् द्रव्यं सहाय श्री  
 तडाजा श्री संघेन तथान्वेषि महानुभावेन सहायकृतः तेषामुप-  
 कारो न विस्मरामः । इमां पुस्तिकां पठित्वा यदि कुत्रिपि  
 स्वल्पना दृश्यते तर्हि संशोधन कृते मां निवेदनीयम् । यो  
 मोक्षार्थी सः मयि प्रसेदुः क्षतिं क्षमेयुरिति सुज्ञेषु प्रार्थना ॥

लिः चम्पकसागर (सत्यानन्द.)

२०१७ संवत्सरे.

॥ शांतिः शांतिः शांतिः ॥

\*

लक्षु शुरु भूलदेखके, सज्जन लेना सुद्यार;  
 परके अवगुन देखते, नहि कटे संसार.



શ્રી અહોમુ

શ્રી તાલુ દ્વજ મંડળુ સુમતિનાથ જિન સ્તવન.

( રાગ-દાન ઉલટ ભરી દીજુએ-એ દેશી. )

તાલુ દ્વજ મંડણુ પ્રભુ, પંચમ જિનવર હેવેશે,  
સાચો સાહેબ તને કહે, હું કિમ માનું એમરે.

તાલીં ૧

મુજમત સિથર સ્વામી થાયો, માનું સાચુ કહેણુ રે,  
અનુભવ વિના હું કિમ કહું, આવડું અધિકું વેણુ રે.

તાલીં ૨

કહે લોક ભટકે સદા, વિષાદ્રો જીવ અજ્ઞાન રે,  
જ્ઞાનીવિના શુણુ કોણુ જુયો,

અશ્રદ્ધાએ કિમ ભૂલું ભાન રે. તાલીં ૩

શ્રદ્ધાએ વિરતિ આ દરી, શ્રદ્ધાએ ભણ્યો જ્ઞાનરે,  
શ્રદ્ધાએ તુજ કહ્યા તપુ તપુ, શ્રદ્ધાએ ધર્દાં હું ધ્યાન રે.

તાલીં ૪

મોક્ષ મારગ મળો હુંકડા, કોણુ રજલે સાચાર રે,  
સંવત બે હજાર સોળિમાં, તાલુદ્વજ બેટયો સાર રે.

તાલીં ૫

ચૌત્ર શુદ્ધી એકદિશ્યે, દીઠો ગિરિ દૈવ-વિમાન રે,  
અન્તરે હૃષી થયો અતિધણો,

જુહા એ કિમ કહું માને રે. તાલીં ૬

કર્મ ચોમાસું તુજ ચરણુમાં,

વરસ બેહજાર સત્ત-દશા રે,

ચંપક સાગરે સુમતિ શુદ્ધયા,

થાય સુમતિએ મનવશ રે. તાલીં ૭

ॐ અહો નમઃ

તાલ ધવજ શ્રી શાંતિનાથ જિન સ્તવ

રાગ :- જિંદાબાદ જિંદાબાદ (મુગલે આજમ).

ભર સાગરસે પાર ઉતારો, નૈયા કુષે ના,  
મેરી નૈયા કુષે ના, મેરી નૈયા કુષે ના.  
કર કલ્યાણુ કર કલ્યાણુ, એ જિનવર મેરા... કર કલ્યાણુ. (૧)  
શાંત સુધારસ દર્શિન તેરા, નથન કમળ જયું ચંદા,  
આનન્દ અમીરસ ભર ભર પીતા, ભાવ કરો રે બંદા.  
તાલ ધવજમે તુંહિ બીરાજે,

મનોહર મુર્તિ તરી... કર કલ્યાણુ (૨)

શાંતિ જિનેખર સાહેખમેરો, શાંતિ નામ સુખકાર,  
‘પ્રાણુષ-’માયા બીજ સહિતજે, જપતે નર અરુનાર.  
અજ્ઞાન અંધેરા ફર્છોણા જઘ,  
હોદ્ધિગી નૈયા પાર.... કર કલ્યાણુ (૩)

સંસાર-તાપ ન સહેતા મુજસે, કર કરણું મહારાજ,  
માન-સરોવર તરંગ શ્રેષ્ઠી સમ, ભાવ વરસા હો આજ.  
સમતા લાદર પ્રભુ ગણું પાકર,


જીવન હો આયાદ.... કર કલ્યાણુ (૪)

અંપક સાયર પ્રભુ પાકર, હૃદયમેં ધરું મેં ધ્યાન,  
પાવન હોણા હૃદય ઉમારા, જૈસા ગુરુગમ જ્ઞાન.  
ભાવ સાગરમે ‘તરણી વાણી,

મુર્તિ ‘મહાત્મા’ ‘મહાન.... કર કલ્યાણુ (૫)

૧ પ્રાણુષ=ॐ કાર. ૨ માયા બીજ=લોદી. ૩ તરણી=નાજ. ૪ મહાત્મા=મહિમા. ૫ મહાનુ=ધંદૂ.

પૂજયપાદ શાંતમૂર્તિ સન્નિમત્ર શ્રી કર્પૂરવિજયજી મહારાજ  
 સાહેબના પદ શિષ્ય પરં વરાણી શ્રી પુષુયવિજયજી  
 મહારાજ સાહેબના શિષ્યરત્ન પરં તપસ્વી બાળઅધ્યાત્મારી  
 પંન્યાસજ મહારાજ શ્રી મનોહરવિજયજી મહારાજ



જન્મ: ૧૯૫૧ આસો શુક્ર ૧૧ ગુરુવાર, માલીયા (સૌરાષ્ટ્ર)  
 દીક્ષા: ૧૯૭૬ માગશર શુક્ર ૩ ગુરુવાર, અદ્રેસર (કર્ણા)  
 વડીદીક્ષા: ૧૯૭૮ મહા શુક્ર ૧૦ અંગળવાર, રાંધનપુર (ગુજરાત)  
 ગાણી તથા પંન્યાસપદ: ૨૦૧૦ માગ શુક્ર ૩ ખુદ, જુનાડીસા



ॐ हौं श्री शंखेश्वर पार्श्वनाथायनमः  
नामोनमः श्री प्रभु आनंदसागरसूरिभ्यः

# श्री मुनिगुण महत्व विचार



परमात्म पद चित धरी, श्री गुड प्राणभी पाय;  
मुनिगुण महत्व विचारवा, उधम कर्त सदायः  
सनातक निर्वैथ मुनिवरा, पुलाक वृक्ष फूलील;  
ये पांचे वांदनिक कहिए, कलिकाले सुशील;  
दर्शन रहित पास्तथादिका, व्यवहार विझुषा ते;  
पूजा वांदवा अयोग्य ते, कहिए शास्त्रे नेह.

धर्मी वर्खते अहंप्रश्रुति भाव जुवे। कैने वांदवा अने  
कैने न वांदवाना विचार वर्मणमां यातो महा व्यामोहमां  
पड़ी जै विनय गुण जे धर्मंतुं भूण छे, तेने भूती जाय  
छे. अने मुनियोना होयो जेवामां जे पोतानी इतिसमाजम  
मानी ऐठेवा मानवि मुनि वर्गना बहु माननो अवसर  
गुमावी ऐसे छे. भाटे नोये आपेला “गुड शिष्यना संवा-  
द्धी” वांदन अवांदनना विचारमां विवेकवाणा थवुं ज्ञेये;  
शिष्य-गुडल जैन दर्शनमां संयमिये। केटवा प्रकारना  
कह्या छे?

गुडल-जैन दर्शनमां संयमिये। जे प्रकारना कह्या छे.

शिष्य-ते क्या क्या?

ગુરૂજી-જૈન સંયમિઓ અને જૈનેતર સંયમિઓ.

શિષ્ય-જૈનેતર સંયમિઓ કૃયા કર્યા?

ગુરૂજી-ખૌદ્ધ ધર્મી સાધુઓ, હિંદુધર્મી સાધુઓ, મુસ્લિમ  
કુરીદા તથા કાયસ્થાદિકો.

શિષ્ય-તો તેઓને વંદન નમસ્કાર કરાય?

ગુરૂજી-ન કરાય.

શિષ્ય-શા કારણુંથી ન કરાય ગુરૂજી?

ગુરૂજી તેઓ જીવાળાહિ લેહોના સંપૂર્ણ જાતા નથી,  
તેમજ સંપૂર્ણ જીવદ્યાના પાલક પણ નથી.

શિષ્ય-તેઓ પણ ગુરૂજી! માઝને તો ચાહે છે. અને ધૃત્યર-  
અદ્વાને લજે છે.

ગુરૂજી-ભાવના ભાવે સારી હોય પણ જાનક્યાનું સર્વયગ  
આચરણ ન હોવાથી અવંદનીય છે.

શિષ્ય-જૈન દર્શાનમાં સંયમિયોના કેટલા લેદ છે?

ગુરૂજી-જૈન દર્શાનમાં સંયમિયોના પાંચ લેદ છે

શિષ્ય-કૃયા કર્યા?

ગુરૂજી-સનાતક-નિર્ધિથ-પુલાક-બકુશ અને કુશીલ.

શિષ્ય-એ શખદાર્થનો એધ કરવા કૃપા કરશો.

ગુરૂજી-(૧) જેમણે ચાર ધાર્તિ કર્મનો ક્ષય કરી કેવળજાન  
પ્રાપ્ત કર્યો છે. તે કેવળી લગવાન સનાતક  
કરેવાય.

(૨) જેમણે ગ્રથી લેહી સર્વયગુદ્ધર્ણન ક્ષાયક અથવા  
ઔપશમિક અથવા ક્ષાયોપશમિક પ્રાપ્ત કર્યાને

પ્રમત્તા યા અપ્રેમત્તા ગુણુ સ્થાનકે રહેલા તે  
નિર્ણયો કહેવાય.

- (૩) જેમને પુલાકનામા લખિધ પ્રાપ્ત થઈ હોય  
જેથી ચક્કવર્તીની સેનાને ચૂણું કરવાની શક્તિ  
હોય તેવા પુલાક લખિધવંત મુનિરાજ પુલાક  
સંયમી કહેવાય.
- (૪) જેમને ખીજના બંદ જેવું સાતિયારી ચારિત્ર  
હોય, અથવા બડુષ એટલે તુષ-ફોતરા તેના  
જેવું ચારિત્ર હોય, અથવા અથશક્તિએ, ઉચ્ચ  
ભાવનાએ જે અંશો ચારિત્ર ગુણુને અહણું કર્યો  
હોય, એવા સંવિજા પાક્ષિક બડુષ સંયમી  
કહેવાય.
- (૫) જેમનું ચારિત્ર કેહેલા ધાન્ય જેવું કૃત્તિસત  
હોય તે કુશીલ સંયમી કહેવાય. તેમના ત્રણ  
લેદ છે તે આ પ્રમાણે જાનકુશીલ-કિયાકુશીલ  
અને પ્રતકુશીલ.
- (૧) જેઓ અવિધિએ જાન લાણે ભણું તે  
જાનકુશીલ.
- (૨) જેઓ શૂન્યભાવે કિયાકરે અથવા અવિધિએ  
કિયા કરે તે કિયાકુશીલ અથવા કષાયકુશીલ  
પણ લીધેલ છે. તેમાં પ્રત્યાપ્યાની અપ્રત્યા-  
પ્યાની કષાયના ઉદ્યવાલા લેવા જોઇએ.
- (૩) જેઓ મૂળ ગુણમાં દોષ લગાડે તે મૂળગુણ  
પ્રત કુશીલ અને જેઓ ઉત્તરગુણ દોષ સેવે  
તે ઉત્તરગુણ પ્રત કુશીલ. એ પણ ભાવ-

શુદ્ધિવાલા હોય, હોણે દિલમાં ડંખતા  
હોય અને સત્યપ્રકાર હોય તો વંદનાય  
બહુમાનનીય અને કૈન શાસન દીપક છે.

અડો પૂજય શ્રી મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજ્ઞયજી  
મહારાજે રચેલ સવાસે ગાથાના સ્તવનની સાતમી ટાળ  
વિચારવા ચોગ્ય હોવાથી નીચે આપી છે.

“ જે મુનિ વેષ શકે નવિ છંડિ, ચરણ કરણ શુણ હીણાલ;  
તે પણ ભારગમાંહે દાખ્યા, મુનિ શુણ પદ્મે લીણાલ.  
મૃષાવાદ લવકારણ જાણી, ભારગ શુદ્ધ પ્રકૃષ્ટિ,  
વંહ નવિ વંદાવે મુનિને, આપ થધ નિજ ઇપેલ. (૭૬૦)

**અર્થ:-** જેએ ચરણકરણના એકસે ચાલીશ બેદે હીણા હોય,  
મુનિણુણે નહિત લોય લજનાદિકથા મુનિ વેષ છોડી શકતા ન હોય,  
તેએને પણ મુનિ ભારગના પક્ષકાર હોવાથા મુનિ ભારગમાં ગણ્યા  
છે. નગી ઉત્સ્વ-મૃષાવાદ લવસમુદ્રમાં બટકાવનાર્દ હોવાથી શુદ્ધ  
ભારગની દેશના દેતા હોય છે. વગી સદાચારી મુનિયોને વંદન કરે પણ  
તેમની પાસે વંદન કરાવે નહિ. પણ પોતાનાથી હીણ ગુણી વા  
સમગુણીનું વંદન કે તો આદ નથી કારણ કે જ્ઞાનના પ્રાપ્તિમાં  
વિનયના જરૂર છે:

“ જે મુનિ રાગે પૂરા સૂરા, જે જે જયણા પાલેલ;  
તે તેજથી શુલ ભાવ લાણીને, કર્મ આપણા ટાળેલ.  
આપ હુનિતા જે મુનિ ભાણે, માન સાંકડે લોકેલ;  
એ દુર્ધર વત એહનું દાખ્યું, જે નવિ કૂલે ફોકેલ.

**અર્થ:-** જે મુનિ ગુણના રાગથી રંગયા હોય, એટલે સામાન્ય-  
પણે નહી પણ શરવીરની પેઢે નિર્દ્દેશયણે રાગી હોય. અને યથા-  
શકી પોતાથી જેટલી બને તેટલી જયણા પાલતા હોય. તેથી શુભ  
ભાવના પરીણું મેળણે કર્મઝ્ય કર્યારો સારે કરે છે.

“ પ્રથમ સાંધુ ખીજે વર આવક, ત્રીજે સંવેગ પાખીણ; એ નષ્ટે શિવ મારગ કરીએ, લુહાં છે પ્રવચન સાખીણ. શેષ નષ્ટે ભર મારગ કરીએ, કુમત કદાશેહ ભરીયાણ; ગુહી ધતિલિંગ કુલિંગ લખીએ, સફળ હોણા દરીયાણ.

**અર્થ:-** પહેલો શુદ્ધ મુનિ મારગને આચરનારા મુનિ, ખીજે શુદ્ધ અદ્ધારાન દેશવિરતિ કામહેવ જેવો આવક તથા અવિરતિ સમ્યગુદૃષ્ટિ અણીક જેવો આવક, ત્રીજે કુત્સિત ચારિત્રી સદ્ભાવનાવાળો સંવિર-પાકિક મુનિ એ ત્રણે મોક્ષ મારગને અનુસરનારા છે. ખીજે નષ્ટ જે કે ગૃહિલિંગી-આલણ્યાદિ અને કુલિંગી જોગી ભરડાદિ અને ધતિલિંગી પાસત્થા નિન્હનાદિ કે જેતો વેષ મુનિનો હોય અને આચરણા-પ્રરૂપણા મુનિ મારગથી વિરુદ્ધ હોય એ ત્રણે સંભાર આગરમાં હુઅનારા છે. એમ શ્રી જિનની વાણી છે. પ્રશ્ન ત્રીજે-સંવિરપાકિક, ખીજ નંબરના આવકને વંદનીય હોય. ?

ઉત્તર-જવાબ જધન્ય આવકને વંદનીય છે. અને વિવેકની ખાતર ઉત્તમ આવકને પણ વંદનીય છે. જેવો દેશકાળ જુઓ શ્રેષ્ઠીક તથા કુમારપાળનું દ્રષ્ટાંત એમના વિનય ગુણ્યથી મુનિઓ પણ મારગમાં આવ્યા છે.

“ જે વ્યવહાર મુનિ મારગમાં, શુષ્ઠાખાણાને લેખેણ; અનુહુમે ગુણુશેખિનું ચદ્રનું, તેજન જિનવર હેખેણ; જેપણ દ્રવ્ય કિયા પ્રતિપાલે, તે પણ સન્મુખ ભાવેણ; શુક્લઅભીજની ચંદ્રકળા જેમ, પૂર્વ ભાવમાં પાવેણ.

**અર્થ:-** જે વ્યવહાર મેક્ષ મારગમાં, શુષ્ઠાનો શેખુએ અઢાવે છે તે વ્યવહાર દ્વારા કિયાદિક ભાવકિયાના અંલાંઅનરૂપ હોય છે.

દુધાંતઃ-નેમ બીજનો ચંદ્રમા પૂર્ણિમાએ પૂછું ભાવને પામે છે. તેમ વ્યવહારથી દ્રવ્યક્રિયાને કરતો તે ભાવ ક્રિયાને પામે છે.

“ તે કારણું લજ્જાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણીલું; ધન્ય તેણું કૃત પૂણ્યકૃતાગ્રથ, મહાનિશીથે વાણીલું. એ વ્યવહાર નથે મન ધારો, નિશ્ચય નથે મત દાખ્યુંલું; ગ્રથમ અંગમાં વિતિમિચ્છાએ, ભાવચરણ નવિલાખ્યુંલું.

**અર્થ:**-ઉપરોક્ત તે કારણથી જે પુરુષ વા સ્વી લજ્જાથી પણ શીલ-અલચર્યાનું પાલન કરે છે. તે ધન્ય છે. કૃત પૂણ્ય છે. તથા કૃત કૃત્ય છે એમ મહાનિશીથ સૂત્રમાં વ્યવહાર નયની અપેક્ષાએ જણાઓયું છે, પણ આચારાંગ સૂત્રમાં વિતિગિચ્છા અધ્યયનમાં નિશ્ચય નયથી મનની સમાધિકારક ભાવ ચારિત્ર કર્યાનું નથી પણ લ.વ ચારિત્રનું કારણું તો છે જ. આ ભાવને ધ્યાનમાં લેતા લજ્જાથી શિયળ પાળતી વિધવા બહેનોની દ્વા ખાનાગાઓની દ્વા આવે છે, કે -બિચારા અજ્ઞાનને આધિન થએલા ઓડતું ચોડ બોલી બાબી મારે છે, પણ સમજતા નથી કે તેઓ કુલ લજ્જાને નેવે મૂકી પુર્ણલગ્ન ઉનારી શિયળબ્રષ્ટ થએલી અથ રા શિયળબ્રષ્ટ થએલા કરતાં લજ્જાથી શિયળ પાળનારાઓની સંપ્રથા વધારે હશે. માટે સ્વપ્નના ડલ્યાણુંની ખાતર નેમ તેમ બોલીને બાબી મારશો નહિ. તેથી હે શિષ્ય ! ધર્મનું મૂળ વંદનએ વિનય ગુણ છે, માટે યોઽય સ્થાને નાત્રતા પૂર્વંક વિનય ગુણને છોડવો નહિ.

**શિષ્ય-**હે ભગવન् શાસ્ત્રમાં તો આ પ્રમાણે બતાવેલ છે.

“ સમર્ણ વંદિજ્જ મેહાવી, સંયમ સુસમાહિયં ।  
એચસમિય તિગુત્તિ, અસંજમ દુગુંછાં ॥ ”

**આર્થ:**-નિશિષ્ટ યુક્તિવાળાએ સગ્રહ સમાધિવંત અને સતર પ્રારે સંજમનો પાલક તથા પાંચ સમિતિ-ત્રણુ ગુપ્તિએ યુક્ત હોય વળી અસંજમને વખોડનારો હોય એવા મુનિને વાંદવા જોઈએ.

**ગુરૂઝ:**-તમારી વાત બરાબર છે, પણ હૃષ્ટાળમાં તુચ્છ ધ્યાન્ય જેમ પેટનો ખાડો પુરવા માટે ઉપયોગી હોય તેમ ઉત્તમ સાધુઓના અલાવે મધ્યમ જધન્ય ચારિત્રી પણ શાસન રક્ષક અને શુલ ભાવનાવાળા હોવાથી બદુશા-કુશીલ પણ વંદનીય છે.

**શિષ્ય:**-તો પછી હે પૂજ્ય શાસ્ત્રમાં અવંદનીયનો પાઠ કેમ મૂક્યો છે.

“પાસત્થાઈ વંદમાળસ્સ, નેવકિત્તીન નિજરા હોઈ ।

કાયકિલેસ એમેબ, કુણી તહ કમમ વંધ ચ ॥ ૧ ॥

**આર્થ:**-જે પાસત્થાદિક પાંચ પ્રારના મુનિઓને વંદન કરવાથી આત્મિં કે નિર્જરા કાંઈ થાય નહિ પણ કાય ક્રૈશ અને કર્મઅધન થાય તો અગિથા દાઝવા કરતાં દૂર રહેતું શું ખોટું ?

**ગુરૂઝ:**-તમારું કહેતું વ્યાજભી છે. શ્રદ્ધા-સદ્ગલાવ વિનાના એ પાંચે અવંદનીય છે, એમાં ખોટું નથી.

**શિષ્ય:**-ભગવન् ! તેમનું નૈપથ્ય વેષભૂષા સરખી હોવાથી શી ખખર પડે ?

**ગુરૂઝ:**-પ્રાયઃ તેમના ફૂર્યો પ્રસિદ્ધ જ હોય છે. છતાં દંલી દંલ રચના કરે જેમકે કોઈ કુલટા સ્વ-પતિ પર પ્રેમ અને હાવભાવ હેખાડે પણ પ્રેમ તો પરપ્રેમીથી જ કરતી હોય છતાં મુગ્ધપતિ તેણુંની સાથે બ્યવહારેચિત વતો છે, એમાં પતિનું સ્વદ્ય બગડે છે. પણ પતનીનું તો અસંયમને લઇ ને આલોક તથા

પરલોક બંને બગડે છે. તેમજ વંદકનું સ્વહૃપત્ર બગડે છે. પણ એવા અસંયમી વંદાવનારનું તે ઈહલોક તથા પરલોક બંને બગડે છે. વળી તેણે સમ્યક્તવને વમેલું હોવાથી તત્ત્વથી દુષ્ટેદો છે, તથા તેઓ અગીતાર્થી હોય ઉત્સર્ગી અપવાદના અભિષ્ટ હોય કેવળ દ્રોધલીંગી મિથ્યાપ્રિફ્પક હોય છે. મારે વિચક્ષણ પુરુષ તેઓને કળી-જણી જાય છે. રશિયન સરકાર જેમ યુનેન્માં વારંવાર વીટોનો ઉપયોગ કરે છે તેમ એ પણ વારંવાર અપવાદ સેવ્યા કરે છે. વળી પાપના પશ્ચાતાપથી વિમુખ હોય છે.

**શિષ્યઃ**-તો પછી હે પ્રભો ! એ પાંચે સંયમાલાસેનું વિસ્તારથી વર્ણન કરી એમનું આચરણ તથા પ્રિય પણ્ણા કેવી હોય તેનો બોધ કરવા કૃપા કરશો.

**ગુરૂઙુઃ**-ત્યારે સાંભળ સાવધાન થઈને પાસથી એસન્નો કુશીલો સંસત્તો તથા જહાંછંદો એ પાંચે શ્રમણાલાસે છે. તેના દેશથી સર્વથી વિગેર અનેક લેદો છે. તે નીચે મુજબ જાણુ.—

(૧) પાસથી-જાન દર્શાનની પાસે રહેનારે અથવા ૮ મછ ય વિષય ૪ કષાય ય નિદ્રા ૪ વિકથા એ પાંચે પ્રમાણાને સેવનારે. હોવાથી સેવાકૃપ પાસથી બંધાએદો પાર્શ્વસ્થ (પાસથી) જાણવો તેના એ લેદ છે તે અતાવાય છે.

૧-૧ દેશ પાર્શ્વસ્થ-જે ઉત્સર્ગીથી શાયાતરનો પિંડ શહેષુ કરે વળી સામે લાવેદો પિંડ શહેષુ કરે, વળી શાજપિંડ શહેષુ કરે તથા દેશ નગર-આમ-

કુલ-વસતિ આદિને વેષે મમતવસાવ રાખે તેમજ  
મોહથી અપાત્ર શિંયો બનાવે અને તેમાં મમતા  
રાખી તેમના હોષાને પોષે તે દેશપાંચુંસ્થ.

૧-૨ સર્વ પાંચુંસ્થ-જ્ઞાન દર્શાન ચારિત્રના ગુણોથી  
સર્વથી છેટા રહે. વળી આળવિકા આતઃજ વેષને  
રાખતો હોય, અને વેષને ભજવાતો હોય, જરૂરા  
અચિત્ત દ્વારા વ્યવહારથી વિમુખ હોય, ગૃહસ્થોનો  
અતિ પરીચય કરી ગૃહસ્થોની વાતમાં ભળી જતો  
હોય તે સર્વ પાંચુંસ્થ. કણું છે કે:—

“નહિ નૌકારસી નહિ પોરસી, નહિ ભણુવાનો ખપ;  
લીધા જોળી ઘૂતરાને, આવી ઉલા ટપ.”  
ઇતિપાંચુંસ્થ વિગેર.

૨ અવસર્ન-જે મુનિ દર્શાવિધ ચક્કવાળ સમાચારી  
પાળવામાં આળસુ હોય, તથા આવશ્યકાદિક કિયામાં  
પ્રમાણી હોય તે મુનિ અવસર્નો, એના બે લેન છે  
દેશથી. અને સર્વથી તે અતાવાય છે,

૨-૧ દેશ અવસર્ન:-ખડાવશ્યક સૂત્રપૌરસી અર્થ પોરસી  
પર્દિલેહણ્ણા-ભિક્ષા દ્યાન-નિરોધકી-આવશ્યકી દિવા  
નિદ્રા વિગેરે દર્શ-વિધ સાધુ સમાચારી તથા એધ-  
પદ સમાચારીનું ઓછું વધતું આચરણ કરે, ઉત્સાહ-  
હિન થઈ રાજ્યેઠની જેમ કિયા કરે, શુરૂભિક્ષાએ  
સામે થાય, મિથ્યાકૃત્યનો મિન્ધામિ હુક્કડ હે નહિ  
વિગેરે વિગેરે દેશ અવસર્ન.

૨-૨ સર્વ અવસર્ન;-શૈવકાળમાં ઉત્સર્ગથી પાટપાટલા  
વાપરે તથા સ્થાપના પિંડ શ્રહણ કરે. સહાકાળ  
સંથારે પાથરી રાખે, લેન તરીકે આવેજ હોંબત

આહાર લે તથા વાપરે, વળી ગર્દલ ઉપર લાઢેલા બોજની જેમ ચારિત્ર વહન કરે તે સર્વ અવસર કહેવાય. કહુ છે કે-

“ શરીર ઝુંદાયેં તીન શુષ્ણ, શરીરકી મીટ જાવે ખાજ, ખાનેકું રોટી મીલે, લોક કહે મહારાજ. ”

૩-કુશીલ-જેનો આચાર વિચાર કુત્સિત હોય તે કુશીલ તેના વ્રણુ-પ્રકાર છે તે આ પ્રમાણે-જ્ઞાનકુશીલ-દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ તે વિસ્તારથી બતાવાય છે.

૩-૧ જ્ઞાનકુશીલ-આઠ પ્રકારે જ્ઞાનાચાર રહિત ભણે લણ્ણાવે. તથા ઐહીક સુખની આતર ભણે-ભણ્ણાવે વિગેરે

૩-૨ દર્શન કુશીલ:-આઠ પ્રકારે દર્શનાચારને ભણે નહિ તેમ પણે નહિ, નહિ પાળવાનો પરિચય કરે તથા અનંતાનુભધી કષાયવાળો હોય વિગેરે,

૩-૩ ચારિત્રકુશીલ-આઠ પ્રકારના ચારિત્રાચારને પાલે નહિ. નહિ પાળનારાઓનો પરિચય કરે, જોષ જુઓ, નિમિત્ત કહે, લૌઠિક કર્મ કરે. યંત્ર-મંત્ર-તંત્ર-ભૂતિકર્મ-ભલીપિંડ આઠ પોતે કરે. બીજાને આહેશ આપી કરાવે, વળી દાનાહિક દુર્ભાગ્ય સૌભાગ્ય કરનારી જડીબુદ્ધી બતાવે તથા રોહિણી પ્રજાપિત-આઠ વિઘાઓનો રવાર્થ માટે ઉપયોગ કરે,, પોતાની જતિ કુલ પૂર્વ આદિ કહીને આલુલિક મેળવે, વખ પાત્ર ડાંડારિક ઉપકરણો બહુમૂલા રાખે વળી કેશ, નખ શરીરાદિને સુશોભિત કરે-વિભૂષિત કરે.

વળી શિષ્યાદિ પરિઅહને વિષે મમત્વ ભાવ રાખે.  
વિના કારણે અપવાહ માર્ગ સેવે-ઇત્યાદિક ચારિત્ર  
કુશીલ જાણુવો.

**શિષ્યઃ**-ગુરુદેવ ! આપિ વર્ત્માનની વર્તણુકની વાતો તો કંઈ  
નહિ કે-જેઓ ડાળીમાં બેસી વિદાર જાતા કરે,  
ઘરીયાળ રાખે, છાપા-ટપાલના થોડું જામે. છાપાએ  
કાઢે તથા કઢાવે; નનાભી પરિકાએ છપાવે, કોટો લડે  
તેમ લડાવે, તાર કોલ કરાવે. તેમજ પાઠલા  
પરીઅહ શિષ્ય પરીઅહ ભક્તાપરીઅહ, હપાશ્રય પરીઅહ  
રાખે, મમતા ભાવે પુસ્તક સંગ્રહે અલદ્ધ્ય ઔષ-  
ધોનું સેવન કરે, કિગેરે ચારિત્રકુશીલમાં ન આવે ?

**ગુરુદાશિષ્યઃ**-આવી કેટલીક બીના ઉપર કહેવાય ગઈ કેટલીક  
ન કહેવાણી હોય તો પણ આવી જાય છે.

**શિષ્યઃ**-તો પછી લગવન् ! પ્રથમ વર્ષાવેલ વંદનીક કુશી-  
લમાં અને આ કુશીલમાં તર્ફાવત શું છે ?

**ગુરુદાશિષ્યઃ**-તું સમજ્યો નહિ, આ પાર્વિસ્થાદિનું વર્ષાન ચાલે  
છે. એમાં શર્દી વિમુખોનું સ્થાન છે. આ દર્શન-  
કુશીલ છે તેથી એ અવંદનીય છે.

કહ્યું છે કે—

“ દંસણ ભણો ભણો, દંસણભણુસ્સ નત્થિ નિવ્વાણ ।  
સિજ્જાંતિ ચરણ રહિઆ, દંસણ રહિઆ નવ સિજ્જાંતિ ॥

જે દર્શનથી ભ્રષ્ટ છે તેજ ભ્રષ્ટ છે, દર્શનથી  
ભ્રષ્ટને મોક્ષ નથી. જે દ્રોય બારિત્ર રહિત હોય  
પણ ભાવચારિત્રથી મોક્ષે જાય છે પણ દર્શન હીણ  
કેદ કાળે મોક્ષે જાય નહી માટે પ્રથમ વર્ષાવેલ  
કુશીલ સાક્ષેપથી વંદનીય છે, તેમાં દોષ નથી.

**શિષ્યઃ** - તો તો શુદ્ધેવ ! બહુ શિથિતાચારનો પ્રચાર થશે  
અને સુનિમારગ અધારામાં રહેશે.

**ગુરુઃ** - એ બનવું સંભવ નથી કારણું કે મોક્ષાર્થી જીવો  
જેમ બને તેમ સુંદર ચારિત્ર પાત્રવાતી ધર્મચા-  
વાળા હોય છે, તેથી એવા મહાત્માઓને શિથિ-  
તાચાર પ્રિય ન હોય એ જ ટીક છે. બીજું હાત-  
તો મોટા લાગે આવકડુલમાંથી જ જીક્ષિતો હોય  
છે, તેથી મોક્ષ માર્ગના અનુરાગી થઈને જ જીક્ષા  
લે છે. તેથી ઓછો હોપ સંભવે, અક જગોએ  
જૈનેતરમાં પણ કહ્યું છે કે —

“ જ્ઞાનનહીં ધ્યાનનહીં મનનહીં માલામે;  
મોહકીયા ઉડાવે ખાવો, બેઠો ધર્મશાળામે. ”

**૪ સંસ્કૃતઃ** ગંગાજી ગયે ગંગાદાસ. જમનાજી ગયે જમના-  
દ સવાળી બુક્તિને અનુસરી જેવો સાથ મળે  
તેવો બની જય અર્થાત કોઈ વૈરાગી મળે  
તો વૈરાગી બની જય અને કોઈ બાધ રાગી મળે  
બાધ રાગી બની જય અથવા ઉત્સર્ગ અને  
અપવાહને લેગા લરડે એટલે ભાષે-કહે. તેના  
પણ એ લેન છે દેશથી ન સવાથી.

**૪-૧** દેશ સંસ્કૃત-સંક્રિતાદ્વિતીય, પ્રાણુતિપાતાદિ પાંચ  
આશ્રવોને સેવનારો તથા ઋદ્ધિગારવ-રસગારવ.-શાતા  
ગારવ એ ગારવ ત્રીકમાં લેમજ સ્વી-ધરખારને વિષે  
અત્યંત આસક્ત હુદ્ધયાન ધ્યાયી, મત્સરી-સુપાલાષી  
પરપરીવાદિ વિગેરે.

**૪-૨** સર્વસંસ્કૃત-જ્યારે કોઈ ધર્મ રાગી સુનિ મળે તો  
ધર્મરાગ જેવો હેખાવ કરે અને પાશ્વસ્થાદિ મળે તો

તેના જેવો થઈ જય અર્થात् તેના અપલક્ષણમાં સહાયક બને વિગેર એવાઓની ગૃહસ્થી પર એવી છાપ પડે કે જેથી લેખકનું જેડી કાઢે:-

“ ગુરોશાહ આયા વહેારવાને, મુંટો વાગ્યો ધમ;  
શાવિકાની છાતી ફાઈ, જેને આવ્યા જમ.”

એવા મુનિયો ગૃહસ્થીને જય આહિ બતાવી દ્રવ્યાદિ પ્રામ કરતા હોય છે, તેથી પરિચય કરવા વાયક કે વાંદવા વાયક હોતા નથી.

૫ યથાછંદ :—સ્વેચ્છાચારી આગમની તથા આગમધારી ગીતાર્થની આજા નહિ માનનારો, ઉત્સૂત્ર-પ્રકૃપક, અન્ય વિંગીઓમાં લળી જનારો, આચાર્ય—ઉપાધ્યાય સ્થવિર પ્રવર્તકાદિની નિંદા કરનારો, બહુશુતની ડેકડી ઉડાડનારો જેમકે દીઠા હીઠા બહુ શ્રુત, એતો બાઉશુત છે,—બાઉ એટલે લાડવા ઉડાઉ છે. અથવા તો ગીતાર્થ નહિ, પણ ઘેરાર્થ છે. ગાડર પ્રવાહે ચાલનારા આજ તો સુધારકનો યુગ છે. આજે રૂઢીચૂસ્તોનું કામ નથી. પ્રલુભ મહાવીરે એકાંત વિધિ પણ બતાવ્યો નથી, ને એકાંત વિષેધ પણ બતાવ્યો નથી. પરંતુ દ્રોય-ક્ષેત્ર-કાળ-ભાવ જાળીને વત્તાવું જોઇએ. એનું નામ સંધ સ્થવિર અને એનું નામ ગીતાર્થ. કેવળ જુનવાણીનું ગર્જાપૂછ ઝાલી રહીએ તો આજે જીવતું પણ મૂર્કેલ છે. ઈત્યાદિક અનેક પ્રકારની વાક્યાતુરાધ્યથી લોકોને

ભરમાં નાંખી શ્રદ્ધાથી ચ્યૂત કરે તેના અનેક  
પ્રકારો છે. વિસ્તારથી અન્યાત્રાથી જાણવા.  
તેથી હે શિષ્યા ઉપરેઠુતા અવંદનીય પ્રત્યનાનું  
સ્વરૂપ જાણી-વિચારી, વાંદવા ચોંય જ્ઞાન-  
દર્શાન-ચારિત્રરૂપ રત્નોનો ધારક થને “ગુરુ  
શુદ્ધેહિંવદ્વિજ્ઞા” ઈતિ શાભુ ઽં શાન્ત  
શાન્તિ શાન્તિઃ ॥

**શિષ્ય :**-તહુતવાણી-ભગવન् ! મારા પર કૃપા કરી મને  
બોધ કર્યો એ હું કહી ન ભૂલું.

પાસ્તથાદિક પાંચ શ્રમણોનું સ્વરૂપ વખવામાં પૂર્ય  
મલિલિબન્ધુલ મહારાજે રવેલ બહુમાસી ન્યાખ્યાનનો  
સુધારા વધારા સ્ત્રીઓ ઉપરેચે કર્યો છે. એમાં કાંઈ શાસ્ત્ર  
વિરુદ્ધ મારાથી ને કાંઈ વખાણું હોય તેનો મન-વચન-  
કાયાથી ન્રિવિધે ન્રિવિધે મિન્ધામિ હુઃકુર્મુ દઉં છું :

આધાર ગાથા પાસ્તથો ઓસજ્ઞો, હોર કુસીલો તહેવ સંસ્ક્રતો. ।  
અહંકારં દોવિયપદ, અવંદળિજ્ઞા જિણમયંમિ. ॥

કુશુરને લોહ શિલાની ઉપમા

જહ લોહસિલાઅપ્ય-પિબોલપ, તહવિલમ્મ પુરિસંવિ ।

ઈ સારં ભોય ગુરુ, પરમપ્રાણ ચ બોલેદ ॥

નેમ લોહાની શિલા પોતે કુશે ને તેના આશ્રિતને પણ  
કુખાડે, તેમ ઈંહા આરંભ જ્ઞમારંભ યુક્તા ગુરુ પોતે કુશે  
ને આશ્રિત ભક્તાને પણ કુખાડે એ ઉપર પણ એક લાખા  
નોડકલું છે.

“ ગુરુલુ શુરુલુ ઘ્રાલે સર્જુ, શુરુને ધર પોતાને વહુ;

ગુરુને ધર ટંદાને ઢાર, આપ વલાખું આપજ ચોર. ”

એ રીતે કુશુરની અનેક જગ્યાએ હાસ્ય સહ નિંદા કરી છે.

અહીં શ્રીમહુ મહેપાદ્યાયજી શ્રી યશોવિજયજી કૃત  
સવાસે ગાથાના સ્તવનની દાળ પહેલી વિચારવા કેવી  
હોવાથી લીધી છે.

દાળ પહેલી

સ્વામિ સીમંધર વિનતિ, સાંસણો માહરી હેવ રે,  
તાહરી આખ હું શિર ધરં, આદરં તાહરી સેવ રે.

સ્વામિ. ૧

અર્થ :—હે મહાપ્રભો ! દેવાધિહેવ ! શ્રી સીમંધર સ્વામિ ! મારી  
એક અરજ સાંસણો. તમારી આજા હું મરતકે ધારણુ કરં છું.  
અને નિશાદિન આપની સેવાને ચાહું છું. (૧)

“કુચુદની વાસના પાસમાં, હરિષુ પરે જે પડ્યા લોક રે,  
તેણે શરણ તુજ વિષ નહીં, રલવલે બાપડા ઝોક રે.

સ્વામિ. ૨

અર્થ :—કુચુદના પરિયથા તેમની વાણીઃપ પાશમાં મૃગની  
પરે લોકો કુપડાથા છે. તેમને આપના વિના હે પ્રભો ! શરણ  
ખોજુંનથી અન્યારા ધર્મને ન અમને તાં લગી ધર્મ અને ધન  
અને ગુમાવી કીડાની માઝક ઝોગટ રણવળી રહ્યા છે. (૨)

ઝાલ દર્શાન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે,  
હુંટે તેણું જન દ્યાતા, કિંદ્ઠા કરે લોક પ્રાકાર રે.

સ્વામિ. ૩

અર્થ :—જાન દર્શાન ચારિત્રઃપ ગુણત્રિક વિના ગુણત્રિકના બહાને  
લોકોને વિવિધ પ્રકારની કિયાઓ કરાવે. અને ગુણત્રિકલોકોને અર્પણુ કરે.  
સ્વાર્થ સાધુઓ અન્યારા બોળા—ભલા લોકોને ધોળે દણડે લૂટે છે. (૩)

જેણ નવિ લાવ તર્યાં નિરશુષી, તારથે કેણી પરે તેણ રે,  
એમ અણલ્યા પડે ઝંદમાં, પાપ બંધે રહ્યા જેણ રે.

સ્વામિ. ૪

અર્થ :—ને નિર્ણયી આત્માએ પોતે ભવતર્યા નથી, તો અભિયારા ખાલાએને શી રીતે તારવાવાળા થશે. એમ ધર્મને નહિ જાણુનારા અજાણું જીવો પાપઅંધન રૂપ કરું દરમાં પડયા સંસાર સાગરમાં રઝલ્યા કરે છે (૪)

કામકુંભાદિક અધિકલું, ધર્મનું ડો નવિ મૂલ રે;  
દાક્કે કુશુર્દ તે ડાખવે, શું થસું એહે જગ શુલ રે.  
સ્વામિ. ૫

અર્થ :—કામકુંભ, ચિંતામણી રલ અને કામધેતુ પાર્શ્વમણુ આદિથા પણ આત્મધર્મનું મૂલ્ય અનેકગણું છે. છતાંએ કુગુરુએ દામની સાથે જેતું કામ છે તેઓ અભુક દવ્ય આપવાથી તમારું પાપ પૂર્ણ જરૂર, અથવા તમને અભુક પૂર્ણ થશે. આવો જુડો ઉપરેશ દધ ધર્મનું લીલામ કરી દોક્કે વેચે છે તે શું જગતમાં શૂલ રૂપ નથી? અર્થાત શૂલરૂપ જ છે માટે કુગુરુએથાથી સાવધાન રહેવું એ જ વિવેક છે. (૫)  
અર્થની દેશના ને દિયે, બોલવે ધર્મના શંખ રે,  
પરમ પદનો પ્રગટ ચોર તે, તેજથી ઠેમ વહે પંથ રે.

સ્વામિ. ૬

અર્થ :—કુગુરુએ પોતાનો સ્વાર્થ સાધવા ખાતર દિલ રાગી ભક્તા ખનાવી ગુરૂપૂજનની ઉભામણી બોલાવી પરિમિહને પોપવાનો ઉપરેશ આપે છે. વળી આગમ અંથોનો અર્થ પોતાનો સ્વાર્થ પોપાય એવો સમજની આગમ અંથને દોપે છે. અથવા તે સંબંધી વાત જ ઉચ્ચારતા તથી. એવા પરમાર્થ માર્ગના ચોરાથા શું પંથ ચાલશે? એવા કુગુરુએ જૈન દર્શનના રક્ષકો નથી પણ ઘોળા-દિવસના ધાડપાડુએ સુમજવા. (૬)

વિષય રસમાં અહી માચિકા, નાચિયા કુશુર્દપદ પૂર રે,  
ખૂમંદમે ધમાધમ ચલી, જાન મારગ રહ્યો ફર રે.

સ્વામિ. ૭

**અર્થ:**— બાળ લક્ષો પણ પાંચે છન્દિયોના વિષય રસમાં રાચી રહ્યા છે. અને કુગુરુઓના બાબુ આડારથી અંનાઈ જાઈ જડી ઝુંદી અંત્ર તંત્રાદિ ચમત્કાર જોઈ તેમના સામૈયા હાઠમાટથા કરી જેન-શાસનથા પ્રભાવનાના અહાને ધૂમધામ મચાવી રહ્યા છે. સાચાગુરુ શ્રાવકની ભક્તિને રોકતા નથી તેમ આડકતરી રીતે પ્રેરણા પણુ કરતા નથી. ઇંક્ષણા કરાવી આહેશ પૂર્વક જલસા પાણી કરાવવા. અમુકજ બેન્ડ લાવો, અમુકજ ગવૈયાને ખોલાવો. વિગેર અનેક આહેશ કરી પોતે દુએ છે ને બાળભક્તોને પણ ઝુાડે છે. સાલ્લકાર જણાને છે નિયમિત લખ્યાવું બાણ્યાવું રાન ધ્યાનમાં તલ્લીન થવું એ તો ફર રહ્યુ, કેવળ કિયા કંડમાં રાચ્યા માચ્યા રહે છે.

“કલષકારી કદાચહ લર્યા, થાપતા આપણા ખોલ રે;

જિન વચન અન્યથા દાખવે, આજતો વાજતે ઢાલરે;

સ્વામિ. ૮૦

**અર્થ:** હે વિભો; આજે અદ્યગીતાર્થતા હોવા છતાં મોટા મોટા ગીતાર્થપણુના વિશેષણો લગાડી ગૃહસ્થને ર્ધંતુલીય સમજની પોતાનો પોતાનો વાડો છ કરવા ખાતર માંહેમાંહે લડાઈની હોળી સળગાવી કદાચહરિપ રાહુથા ગુંચાએલા મુક્કોલર લક્ષોમાં પોતાની પ્રશ્નુતા મનાવતા અને પોતાના વચનો થાપતા જરાએ શરમાતા નથી વળી અનંતરાની જિનેશ્વર દેવો એમ ઝરમાને છે, વિગેર જિન નામના ઓઠા નીચે પોતાના મતનો ઢોલ બેંદના અવાજની સાથે પ્રચાર કરી રહ્યા છે. ૮

“કોઇ નિજ ઢોષને જોપવા, રેપવા કેદ મત કંદરે;

ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે;

સ્વામિ. ૯.

**અર્થ :**—કેટલાક કુગુરંઘો બિચારા સત્ય કહીશું તો દોડો આપણું ભાનશો નહિ તેથી આગમના અર્થને ભરડીને પોતાનો સિદ્ધાંત મનાવવા મતિમંદો સત્યસિદ્ધાંતથી વેગળા રહે છે. વળી પોતાના દુર્ઘાણો કેમ અપ્રગટ રહે તેના માટે અહેનિશ ચિંતા કરતા રહે છે. ૮.

“ અહુમુખે એલ એમ સાંભળી, નવિધરે લોક વિશ્વાસ રે;  
દૂંઢતા ધર્મને તે થયા, ભમર જેમ કમલની વાસ રે;  
સ્વામિ. ૧૦.

**અર્થ :**—પણા મુખે જુદો જુદો ઉપદેશ સાંભળી અવિશ્વાસુથ એલા ભક્તજનો કમળને જેમ ભમરો શોધતો કરે તેમ બિચારા ધર્મને શોધતા કરે છે. ૧૦.

સંવત ૨૦૧૬ ના લાદરવા વદ ઉને ગુરવાર

મં. કોળીયાક (સૌરાષ્ટ્ર)

લી. મુનિરાજશ્રી ચંપક સાગરજી મહારાજ.

શ્રોતૃ પાઠકસ્ય શુભ ભવતુ;  
કૃતિ મુનિશુખ મહત્વ વિચાર. ॥



# ભાગ બીજો

સાધુ જ્વનના ૮૪ (ચોર્યાર્થી) આભૂષણો

ગાથા છંદ

૧ ૨ ૩ ૪ ૫ ૬

ઉરગ ગિરી જલણ સાગર, નભતલ તળગણસમોય જોહોર ॥

૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨

ભમર માય ધરણી જલરૂહ, રવિ એવણ સમયવો સમજો ॥ ૧ ॥

**અર્થ :** -સર્થ-ગિરી-અધિ-સમુદ્ર-આકાશ-વૃક્ષ-ભમર-મૃગ-પૃથ્વી  
કખેળ-સૂર્ય અને વાયુ એ બાર અંગના બાર આભૂષણોના સાત સાત  
પેટા બેદ વડે ચોર્યાર્થી આભૂષણો થાય છે. તે નીચે મુજબ :—

(૧) સુકુટ સ્થાને સર્પના સાત બેદ સમજવા.

(૧) “નેમ ઉંદર ખોડે ને લોચિંગ લોગવે” એ કહેણી  
અનુસાર સાધુ મુનિરાજ બીજાએ-ગૃહસ્થાશ્રમીએ  
પોતાના માટે બનાવેલા મકાનમાં રહે, પણ પોતાના  
માટે મકાન બનાવે નહિ, બીજા પાસે બનાવરાવે નહિ,  
અને મકાન બનાવનારને પ્રશાસે નહીં, તે પણ સ્ત્રી-  
પશુ-પંડ કે કરી રહુત હોવું નોઈએ. સ્વાધ્યાયને  
અનુકુલ હોવું નોઈએ.

(૨) નેમ અગધન કુળના સર્પો વમેલું વિષ પાછું ચુસતા  
નથી, તેમ સાધુ મહારાજ પણ છાંડેલા કામ લોગને  
પાછા છાંછે નહિ.

- (૩) જેમ સર્વ ભીલમાં પેસતાં પોતાના વહુ સ્વભાવને છોડે છે તેમ સાથું મહારાજ પણ પૂર્વને વહુતા સ્વભાવ છોડી મોક્ષ ઇપ ભીલ ઇપ મારગમાં સ્વભાવે ચાલે છે.
- (૪) જેમ સર્વ ભીલમાં પેસતાં સ્વશરીને બીજે કયાંય રૂપર્થી કરતો નથી તેમ મુનિરાજ પણ આહાર પાણી કરતા સ્વાધનો રૂપર્થી ઉઠતા નથી.
- (૫) જેમ સર્વ કાળ પરિપક્વે કાંચળી ત્યાગી ચાલ્યો જય છે. પુનઃકાંચળીને સંભાળતો નથી, તેમ સંયમી પહું સંસાર ત્યાગી નીકળી ગયા પછી પુનઃ ઘર દારા સંભાળે નાલી.
- (૬) જેમ સર્વ સુંવાળા શરીરને લઈને કંટક કંકરાદિથી સંભાળી ચાલે તેમ મુનિપણ દ્વારાબાવથી સુંવાલા હુદ્દ્યવાલા જીવોની જયથુા પાવતા વિચરે. અર્થાત્ નીચી દખિએ ઈરિયાસમિતિ શોધતા ચાલે.
- (૭) જેમ સર્વને નેઇ ભીજ જીવો જય પામે તેમ મુનિવરને નેઇ પૂર્ણગળોખી પાખંડીએ છેટા રહે તથા મોહુનીયાદ કર્મો પણ શાંત પડી જય. અથવા નાશ પામે.

\*

- (૨) જમણુા કાને ગિરિઇપ કુંદસનું આભૂષણના સાચ લેદ
- (૧) જેમ ગિરિરાજ અનેક ઔષધિ સહિત હોય તેમ સંયમી પણ અનેક લખિધાએ ઇપ ઔષધને ધારણું કરનાર હોય.
- (૨) જેમ ગિરિ જંઝાવાતથી પણ ચલાયમાન ન થાય તેમ મુનિશ્રી પણ બાબીશ પરિષહુ આદિ વાતથી ચલાયમાન ન થાય.

- (૩) જેમ ગર્દિ નાના મોટા પ્રાણીઓનો આંધાર સ્થાન હોય છે તેમ સુનિરાજ પણ નાનામોટા પ્રાણીઓનું નિર્ભયઃપ્રાણ આધાર સ્થાન છે.
- (૪) જેમ પર્વતમાંથી નાના મોટા જરણા નીકલે છે, અને તેનાથી ક્ષેત્રે પોખાય છે, તેમ ચોગીઓના મુખમાંથી વાણીઝપ્રાણ જરણાએ વડે ભવિ છુવોના સહ્યાવઝપ્રાણ ક્ષેત્રો પોખાય છે.
- (૫) જેમ ઉંચાઈમાં જિર ચિખરો ઉંચા હોય છે, તેમ સુનિરાનેના શુલ્પ પરીણુમો બહુ ઉંચા હોય છે.
- (૬) જેમ પવતો રત્નાદિની ખાણ મનાય છે, તેમ સુનીશરો પણ શાન-દર્શાન-ચરિત્ર ઝપ્રાણ રત્નોની ખાણ છે.
- (૭) જેમ પર્વતો જમોનનું સીમાસ્થાન માપવામાં ઉપયોગી હોય છે. તેમ સુનીન્દ્રો પણ ધર્મની સીમા નક્કી કરવામાં ઉપયોગી હોય છે.

\*

- (૧) ડાયાકને અન્તિમપ્રાણ કુંડલના આભૂષણના સાત લેદ.
- (૧) જેમ અભિજવાવા ઝપ્રાણ કીરણોથી શોલે છે તેમ સાધુ બાર લેદે તપઝપ્રાણ કોરણોથી શોલે છે.
- (૨) જેમ અભિકાષ્ઠથી વરાતો નથી, તેમ સુનિ પણ શાનદ્યાન-સ્વાધ્યાયથી અતૃપત્ર રહે છે.
- (૩) જેમ અભિ સ્વપ્રકાશ વડે અંધકારનો લાશ કરે છે, અને વસ્તુ-પદાર્થને પ્રગટ કરે છે, તેમ બતિ પણ શાન પ્રકાશ વડે જડ ચેતન પદાર્થને પ્રગટ કરે છે.

- (૪) જેમ અગ્રિ કાઠાડિને બાળીને ખાખ કરે છે, તેમ ચોગી પણ તપુરૂપ અગ્નિવડે શુલાશુલ કર્માનો નાશ કરે છે.
- (૫) જેમ અગ્નિ સુવર્ણાદિ ધાતુઓને શુદ્ધ કરે છે, તેમ સંયમી પણ ઉપહેશ રૂપ અગ્નિ વડે ભવ્ય પ્રાણીઓની શુદ્ધિ કરે છે.
- (૬) જેમ અગ્નિ ખુઅાતી વખતે રખ્યાને મૂકે છે, તેમ સુનિ પણ મોક્ષમાં જતાં ઓહારકાર્દિ શરીરને છોડી જાય છે.
- (૭) જેમ અગ્નિ કાચા વાસણુને પકવે છે, તેમ તપરવી પણ ધર્મેમાં કાચા એવા મુમુક્ષુઓને ઉપહેશ રૂપ અગ્નિવડે પરીપકવ ખુદ્ધિવાળા કરે છે.

\*

- (૧) લલાટમાં તિલકરૂપ રૂપ સમુદ્ર આલુપણુના સાત લેદ.
- (૨) જેમ સસુદ્ર ઊંડામાં ગંલીર હોય છે તેમ યાત પણ જ્ઞાન ગુણુથી ગંલીર હોય છે. “સાગર વર ગંભીરા”
- (૩) જેમ સસુદ્ર રત્નાકર કહેવાય છે તેમ સુનિ પણ જ્ઞાનાદિક રત્નો વડે રત્નાકર કહેવાય છે.
- (૪) જેમ સસુદ્રમાં અનેક નાની મોટી નહીંઓ મળે છે પણ જરાએ છલકાતો નથી તેમ જ્ઞાનીઓ પણ અનેક જ્ઞાન જતાં વિજ્ઞાનના જાણુપણુવાળા હોવાથી જરાએ છલકાતા નથી.
- (૫) જેમ સસુદ્રમાં અનેક જળચર પ્રાણીઓ રહેતાં જતાં પણ સસુદ્ર કોઈને છેહ આપતો નથી, તેમ ચોગીરાજ પણ સંસાર સસુદ્રમાં અનેક પ્રાણીઓ રહેતાં જતાં પણ કોઈનું દીલ, દુલ્ભાવતા નથી અને સસુદ્રના પાણીના જેમ સહાય નિર્મણ રહે છે.

- (૫) જેમ સમુક્રનો લાલ પ્રાણી લઈ શકે છે તેમ મુનિના ગુણોનો લાલ કોઈ પણ જીવાત્મા લઈ શકે છે કોઈને તિરદકારવામાં આવતા નથી.
- (૬) જેમ સમુક્રના પાણીનો તાગ લેવો જામાન્ય માણસને ભૂર્કેલ છે. તેમ મુનિના જાનાદિ ગુણોનો તાગ લેવો ભૂર્કેલ છે
- (૭) જેમ સમુક્રમાં અનેક દ્વારાથી કબરો આવતાં છતાં સદા નિર્મણ રહે છે; તેમ મુનિપણું અનેક સંસારના જંઅવતો કાને પડતાં છતાં સદા નિર્મણ રહે છે.

\*

(૮) ગળા સ્થાનમાં હાર રૂપ આકાશ આલુપણુના  
સાત લેંદ

- (૧) જેમ આકાશ નિર્મણ હોય છે તેમ સાધુનું મન પણ રાગદ્રોષ વિનાનું નિર્મણ હોય છે.
- (૨) જેમ આકાશને કોઈ આવંબન નથી, તેમ મુનિને પણ તત્ત્વથી આવંબન રૂપ પ્રતિબંધ નથી.
- (૩) જેમ આકાશ પાંચ દ્રોઘોનો આધાર છે. તેમ મુનિ પણ દશ વિધ શ્રમણું ધર્મનો આધાર છે.
- (૪) જેમ આકાશ બધા રૂપોને સહે છે તેમ મુનિ પણ નિંદા-સ્તુતિને સમભાવે સહે છે.
- (૫) જેમ આકાશ પાણીથી કુલાતું નથી તેમ મુનિ પણ જાનાદિગુણોના ગર્વથી કુલાતા નથી.

- (૧) જેમ આકાશ દેશાતું લેદાતું નથી, તેમ યત્તિ પણ  
મિથ્યાત્વીઓના વાગબાણોથી શ્રદ્ધાર્થ ગુણુમાં છેદાતા  
લેદાતા નથી.
- (૭) જેમ આકાશ અનન્ત તેમ મુનિના ગુણો પણ અનન્ત છે.

\*

- (૧) જમણા કંડે વૃક્ષરૂપ આલુષણુતા સાતલેદ
- (૧) જેમ આડ રવયં તાપ ટાં સહન કરી અને બીજાને  
કુળ છાયાથી સંતોષે તેમ મુનિજન પણ પોતે ક્ષુધાર્દ  
પરિષહ સહન કરી મેળવેલ અનુભવ જ્ઞાન દાન કરી  
ભંય જીવોને સંતોષ પમાડે છે.
- (૨) જેમ આડને સાચવવાથી કુળ, કુલ, પત્ર, છાલ, કાંઈ  
મૂળ, અને બોલાર્ડ અનેક જરૂરી વસ્તુ આપે, તેમ  
મુનિ મહારાજની સેવા-વિનયાર્થ કરવાથી અનેક ઈહ-  
કૌંકિક પારલોકિક સુખોની પ્રાપ્તિ થાય.
- (૩) જેમ આડ પંખી આર્થ જીવાત્માઓને સ્થાન કર્યું છે  
તેમ મુનિ પણ ભંય આત્માઓને નરકાર્દિકના ફુલથો  
ખચવા માટે ઉપરેશનું સ્થાન છે.
- (૪) જેમ કોઈ આડને છેઢે લેઢે તો પણ તે તેનું હીતજ  
કરે છે. તેમ મુનિને પણ તાડનાર્થ કરે અથવા હુર્ચયન  
કહે તો પણ હુદ્ધયમાં મુનિ ફુલ ન ધરતાં સલાતું  
હિતજ થાણે છે.
- (૫) જેમ આડ બીજાને કુળાર્થ અપી બદલો ચાહતું નથી  
તેમ મુનિ પણ સામાને કલ્યાણકારી ઉપરેશ આપી તેનો  
.બદલો દ્રવ્યાર્થક ચાહતા નથી.

- (૧) જેમ આડને કોઈ પત્થરાદિ મારે અને છાણકળ મેળવે તેમ સુનિને પણ કોઈ આકોયાદિ કરે તો પણ સુનિ પાસેથી મિઠ વાણીની મધુરતાજ મેળવે છે.
- (૭) જેમ આડ વટેમાર્ગચોનું વિશ્વામ સ્થાન છે તેમ સુનિ પણ મોક્ષમાર્ગચોનું સ્થાન છે.

\*

### (૭) દાખાકંડ લભરિપ વિભૂષણના સાત લેણ.

- (૧) જેમ ભ્રમર કૂલનો રસ ચુસતા કૂલને પીડા નથો કરતો તેમ સાધુ મહારાજ પણ ગૃહસ્થ પાસેથી આહારાદિ અહણુ કરતા ગૃહસ્થની દાનવૃત્તિની લાવનાને ચોછી થવા હેતા નથી.
- (૨) જેમ ભ્રમર પુણ્યરસ પુણ્યથી અહણુ કરે પણ પુણ્યમાં આસક્તિ રાખતો નથી, તેમ સુનિવરૈ પણ ગૃહસ્થ પાસેથી આહારાદિક મેળવે પણ ગૃહસ્થ ઉપર વ્યામોહ રાખતા નથી.
- (૩) જેમ ભ્રમર પુણે પુણે ઝર્યા કરે તેમ યતિ પણ ગામો ગામ વિચયર્યા કરે.
- (૪) જેમ ભ્રમરના માટે કુલ આડો કોઈ રૈપતું નથી, તેમ સુનિ પણ ગૃહસ્થે પોતાને માટે બનાવેલા આહાર-વસતિ વસ્ત્ર-પાત્રાદ ગૃહણુ કરે.
- (૫) જેમ ભ્રમર રસનો સંચય કરતો નથી તેમ મહાસુનિ પણ આહારાદિનો સંચય કરતા નથી
- (૬) જેમ ભ્રમર પોતાની મરણ સુજાય પુણ્ય ઉપર જાય તેમ સુનિરાજ પણ પોતાની ઈચ્છા સુજાય ગૃહસ્થને ઘેર

આહારાદિ લેવા જાય પણ કોઈની આમંત્રણની છચ્છાન  
ન કરે.

(૭) જેમ ભ્રમર વિશ્વિષ સુગંધી પુંચોના રસને ચાહે છે,  
તેમ ચોગી પણ ચારિત્રને ગુણુકારક એવી વિશુદ્ધ-હોષ-  
રહિત ભિક્ષાને ગૃહણ કરે.

\*

(૮) કટીસૂત્ર રૂપ ભૂગ વિલુપ્તખના સાત ભેડ.

(૧) જેમ હરણુ હિંસક ખાપદાથી બીચે તેમ મુનિ ઉત્સૂત્ર  
રૂપ પાપથી બીચે તથા અનાચર રૂપ પાપથી પણ  
ભય રાખો.

(૨) જેમ સારંગ રવલાવથી શાંત પ્રકૃતિ વાળો છોય તેમ  
ઘતિ પણ રવલાવથી શાંત પ્રકૃતિએ વતો.

(૩) જેમ કુરંગ એક સ્થાને સ્થાયો રહેતું નથી તેમ મુનિ  
પણ એક સ્થાને સ્થાયી રહેતા નથી. કારણે જ્યષ્ઠાથી  
વતો.

(૪) જેમ ભૂગ રોગાદિની ચિંતા કરતું નથી તેમ મહામુનિ  
પણ રોગાદ કારણે આર્ત ધ્યાન ન કરે પણ જ્યષ્ઠાથી  
નિરવદ્ધ ઉપચાર કરો.

(૫) જેમ હરણ રોગાદ કારણે કોઈની ચાકરી નથી ચાહતું  
તેમ મુનિરાજ પણ રોગાદ કારણે કોઈની સેવા ન ચાહે  
પણ કોઈ સેવા કરે તો એના ભાવ ન તોડો.

(૬) જેમ ભૂગ જાડની છાયામાં એસી વાગોલ્યા કરે તેમ મુનિ  
પણ ઉપાશ્રયમાં એસી સ્વાધ્યાય કર્યો કરો.

(૭) જેમ મૃગ શિકારીઓથી સહા સાવધાન રહે તેમ મુનિરાજ પણ કામ ફોખાડિ શિકારીઓથી અપ્રમત સાવધાન રહે.

\*

(૮) જમણા પગનું કુરતીઝ્ય આલૂષણુના સાત જેઠ.

(૧) જેમ પૃથ્વી વિવિધ પ્રકારની તાડન, તાપન, ઘનનાઈનો વેહનાને સહે તેમ મુનિરાજ પણ બાવીસ પ્રકારના ઉપસર્ગાઈ પરીસહેને સહે.

(૨) જેમ વસુંધરા બહુ રતનાં કહેવાય છે તેમ મુનિરાજ જાનાઈકથી બહુ રતના મનાય છે.

(૩) જેમ પૃથ્વી સર્વ ઔષધિની ઉત્પત્તિનું આધાર સ્થાન છે. તેમ સાધુભગવાનું પણ સર્વ વધ્યાઓની ઉત્પત્તિનું આધાર સ્થાન છે.

(૪) જેમ ભૂતે ભૂમિહેવતાયૈ સ્વાહા કરીને પૂજે અથવા કોડાળી વડે ખણે તો પણ રાગદ્રેષ ન ધરે તેમ થોળીરાજ પણ કોઈ પૂજે વા નિહે તો પણ રાગદ્રેષ ન કરે આર્થિત સુમભાવે રહે.

(૫) જેમ ભૂમિ અનેક વણ્ણવાળી છે તેમ મુનિ પણ ક્ષાયાદ્દિની મંદાના વડે અને જાનના નથ નિષેપાના લેદ વડે અનેક વણ્ણી છે. ગુણી અને ગુણુનો અલેદ સંબંધ હોવાથી.

(૬) જેમ પૃથ્વી પોતા પર પડેલા દુગ્ધવાળા પાણી આઈને પવિત્ર કરી પોતાના ઉદ્રક્ષ્ય કુવામાંથી સ્વરચ્છ પાણી તથા બીજ આઈને આપે તેમ મુનિ પણ અનેક અવિ જીવોને ઉપહેશથી પવિત્ર કરીને સમાજ આગળ ધરે છે તે જીવો સમાજેપથોણી થાય છે.

(૭) જેમ પૃથ્વી પાણી સૃજિતના આધાર છે તેમ યતિ પણ  
સર્વની રક્ષા કરવા રૂપ આધારભૂત છે.

#

- (૧૦) ડાયા પગના કમળ રૂપ આલુચણના સાન બેદ.
- (૧) જેમ પુંડરિક કાદવથી ઉત્પન્ન થયું અને જળ વડે  
પોષણ પાર્થું છતાં પણ કાદવ અને જળથી નિર્બિંદિત  
રહે તેમ મુનિરાજ પણ સંસારુપ કાદવમાંથી ઉત્પન્ન  
થયા અને જળાદિ પૌરુગલિક પદ્ધારોથી પોષણાણું છતાં  
પણ મુનિ સંસારીઓના સંપર્કથી અને આહારાદિમાં  
બ્યામોહ રાખ્યા વિના નિર્બિંદિત રહે છે અને સ્વકાર્ય  
સાધે છે.
- (૨) જેમ પુંડરીકનું પાસુ સેવવાથી સુગધાદિકથી માનવ  
સુખ માને છે, તેમ મુનિરાજના સંપર્ક સાધવાથી  
અથવા એમની નિશ્ચાચે રહેવાથી સંતોષાદિક શુણેં વડે  
આત્મા પોતાને સુખી માને છે.
- (૩) જેમ પુંડરીક સદ્ગ પવિત્ર હોય તેમ મુનિહૃદય પણ  
પવિત્ર હોય.
- (૪) જેમ કમળ જેઠ અમર ખુસી મનાવે તેમ મુનિને જેઠ  
લંઘ લુવો આત્માને આનંદ માને છે.
- (૫) જેમ કમળની કાયા મોટી તેમ મુનિની મર્યાદાઓ મોટી.
- (૬) જેમ કમળ સૂર્યથી વિકાસ પામે તેમ મુનિ પણ  
અરિહંતના ઉપદેશથી આનંદરૂપ ઉદ્દાસને પામૈ.
- (૭) જેમ કમળ સૂર્યની સાથે પ્રાણુંત સંબંધ રાખે તેમ  
મુનિ પણ લનઆજાની સાથે પ્રાણુંત સંબંધ રાખે છે.

- (૧૧) હાથનાચાંગળા ના ધરેખુરુપ સૂર્યનિભૂતાના સાત લેદો.
- (૧) જેમ સૂર્યથી કમળવન વિકાસ પામે તેમ મુનિના ઉપહેશથી ભવ્ય આત્માઓનો વિકાસ થાય.
  - (૨) જેમ સૂર્યના પ્રકાશથી સ્થૂલ પદાર્થો જેઈ શકાય તેમ મુનિના ઉપહેશથી જીવ-અજીવાદિ પદાર્થો જાળી-જેઈ શકાય.
  - (૩) જેમ સૂર્યથી ઝીજ ગૃહેણી પ્રલા નિસ્તેજ થાય તેમ મુનિના તપ તેજથી પાખંડીઓ નિસ્તેજ બને અને ફૂરાઆર ફેલાવતા અટકે.
  - (૪) જેમ સૂર્યથી અંધકાર નાશ પામે તેમ મુનિના ઉપહેશથી અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામે.
  - (૫) જેમ સૂર્યના ઉદ્યથો સનમાર્ગનું લાન થાય તેમ મુનિના સમાગમથી મોક્ષ માર્ગનું લાન થાય.
  - (૬) જેમ સૂર્ય તેજથી દેઢીઘ્યમાન જણ્ણાય તેમ મુનિ તપ તેજથી તેજસ્વી ગણ્ણાય.
  - (૭) જેમ સૂર્ય સહખીરણો વાળો છે તેમ મુનિ પણ અદાર હળાર ચિયલના લેદ રૂપ કોરણોવાલા છે.

\*

- (૧૨) પગના આંગળાના વાખુરુપ આભૂતખના સાત લેદો.
- (૧) જેમ વાયરાને વિચરવામાં કયાંએ પ્રતિબંધ હોય નહિ અથવા તો વાયરે વિચરવામાં કયાંએ સ્થળના પામતો નથી તેમ મહામુનિ પણ મોહના પ્રતિબંધ વિનાના સર્વ ઠેકાણે વિચરે પણ કયાંએ મોહથી સ્થળના પામતા નથી.

- (૨) જેમ પવનનું વજન જણાતું નથી તેમ મુનિ મહારાજમાં પણ મોહ રજનું વજન જણાતું નથી અર્થાત् નિમોહી હોય છે.
- (૩) જેમ પવન સુગંધ હુર્ગંધને સર્વત્ર ફેલાવે છે. તેમ મુનિરાજ પણ પૂણ્યકરણીના ઝળને ઉપહેશ અને પાણ-કરણીના ઝળને ઉપહેશ તથા શુદ્ધ સ્ક્રિટ જેવા આત્મતથના ઉપહેશને સર્વત્ર ફેલાવે છે
- (૪) જેમ પવન ચોતાનું સ્વરૂપ બદલતો નથી તેમ મુનિ પણ ચોતાના શુદ્ધ સ્વભાવને બદલતા નથી.
- (૫) જેમ વાયુ સ્નેહમાં લેપાતો નથી તેમ મુનિવર પણ ધર્મસ્નેહ સ્વભાવ બીજે કોઈ સ્નેહમાં લેપાતા નથી.
- (૬) જેમ વાયુ, ધૂળ, ધૂમાડાને ઉડાડીને સ્થળાંતર કરે છે તેમ મુનિરાજ પણ કર્મરજને ઉડાડી સ્થળાંતર કરે છે અને ચોતે સ્વરૂપ બને છે.
- (૭) જેમ ઠંડો વાયુ ગરમી આઈનો નાશ કરે છે. તેમ યતિજન પણ ચોતાના શીતદેસ્યાહિ ગુણોવડે બીજાના કોધાહિ શરૂઆતો નાશ કરે છે

ધતિ દ્વારથા અગોના સર્પાદિ એક એકના સાત લેદ વડે શ્યાર્યાશી આભૂષણો જેમ નરતારી આભૂષણો વડે પોતાની શોભામાં વધારે કરે છે તેમ મુનિરાજ પણ શુણો-રૂપી આભૂષણો વડે પોતાના ચારિત્રસ્વશોભામાં વધારે કરે છે.

# ભાગ ઉત્તીજો

## કુદૃપના-૧

**લૌકિક :-** લૌકિક મિથ્યાતમાં શુદ્ધન જીવનાર્થ  
શુદ્ધોના પાંચ લેદ.

- (૧) પાપનો હૃદયમાં સથ રાખ્યા વિના રાચી મારી પાણ  
કરણી કરનાર.
- (૨) હૃદયમાં પાપનો સથ છતાં મહામોહના ઉદ્ઘટને લઈ  
પાપ કરણી કરનાર.
- (૩) લોક યા રાજદંડ યોગ્ય પાપનો ત્યાગ કરનાર અથવા  
પોતાનો ધર્મ માની બથાશક્તિ પાપકરણીનો ત્યાગ કારક.
- (૪) રવ ધર છંડી તપ કરવા માટે અગ્નિ વિગેરેનો આરંભ  
સુમારંભ કરનાર.
- (૫) સન્યાસ લઈ ગૃહસ્થને ત્યાં તૈયાર સાદુ લોકન લઈ  
જીવન જીવનાર.

**પ્રશ્ન :-** મિથ્યાનું એટલે શું?

**જવાબ :-** મિથ્યાત્મ એટલે જડ થેતનને જાંપૂણું તરફાં  
રૂપે નહિ જાણુનાર.

## કદમ્પના-૨

દ્રવ્ય જૈન લોકોત્તર મિથ્યાત્માં જીવન-  
જીવનારના પાંચ લેખ.

- (૧) કુલ ધર્મને માન આપતાં છતાં રાચીમાચી તરવ  
સમજયા વિના અદારે પાપસ્થાનક સેવનાર.
- (૨) લોકનિંહે તથા રાજદંડે એવું જીવન નહી જીવનાર  
માગાનુસારી.
- (૩) ભોગફળની ધૂંઢૂએ અંશથી ધર્મ કરણી કરનાર.
- (૪) સંસાર સુખોમાં ઉદાસીનતા આવતી નથી. તેમજ સંસાર  
નૈષબ્દિકી લાલસા રહી છે. છતાં ભાર વૃત્તાદિકનું થફણ  
કરનાર પાલન કરનાર.
- (૫) દ્રવ્યથી સંસાર સુખો ત્યાગી, ભાવથી સંસાર સુખોની-  
ચાહના રાખનાર સંયમી જીવન જીવનાર સાધુ  
સાધ્વીએ.

## કદમ્પના-૩

સર્વયગ્ર દ્રષ્ટ આરાધક જીવન જીવનારના પાંચ લેખ.

- (૧) સર્વયકૃત્વ ગુણુ સહિત અવિરતિ ઉદાસી જીવન જીવનાર.
- (૨) સર્વયકૃત્વ ગુણુ સહિત દેશવિરતિ ધર્મરાગી જીવન  
જીવનાર.
- (૩) સર્વયકૃત્વ ગુણુ સહિત પ્રમત્ત સંયમી.
- (૪) સર્વયકૃત્વ ગુણુ સહિત અપ્રતામ સંયમી.
- (૫) કેવળદર્શિન કેવળજ્ઞાનને ધારણુ કરનાર શ્રી વીતરાગ  
સચોણી ભગવાન् તથા અચોણી સિદ્ધ ભગવાન્.

## કદેપના-૪

માનવ જીવનની ચાર પ્રકૃતિઃ—

(૧) સમલાની. (૨) અહંકારી. (૩) છિદ્રગવેષી. (૪) આશાવાદી.

\*

જીવનમાં ઉતારવાના ત્રણ સુદ્ધાયોઃ—

## મુદ્રો-૧

- (૧) જીવનમાં સાંસારિક સુખો જે ન મહ્યા હોય તેનો એદ કે ચિંતા ન કરવી.
- (૨) જીવનમાં સાંસારિક સુખો મેળવવાની ચાહના ન રાખવી.
- (૩) જીવનમાં જે સાંસારિક સુખો મહ્યા હોય તેને ત્યાગવાની ભાવના રાખવી.

## મુદ્રો-૨

- (૧) કોઈ શુન્હો પોતાથી ન ઘને, એવી કાળજ રૂપવી અર્થાત શુન્હો કરવો નહિ.
- (૨) કોઈએ પોતાનો શુન્હો કર્યો હોય તેને ભાડી આપવી. પછી ખંલારવો નહિ.
- (૩) પ્રસંગોપાત શુન્હોગારતું પણ શહું બાબ એમ કરવું યા વર્તાવું.

## મુદ્રો-૩

- (૧) જીવનમાં વ્યક્તન દાનતું રાખવું.
- (૨) જીવનમાં ધર્માધ્યાલાવની રાખવી.
- (૩) જીવનમાં જીવો સદાચારના વાવવા.

## શ્રી સામાન્યિક દોષ સળજાય

( राग चोपाल )

૭                    ૮                    ૯  
 મેલ ઉતારે ખણુજ ખણ્યાય. ૫ગ ઉપર ચઢાવે પાય;  
 ૧૦                    ૧૧  
 અતિ ઉધાડુ મેલે અંગ, ઢાંકી વહે ત્યમ અંગ ઉપાંગ. ૭  
 ૧૨  
 નિદ્રાએ રસ ફુલ નિર્ગમે, કરહા કંટક તરુંએ ભગે;  
 એ બત્રીસે હોખ નિષાર, સામાયિક કરબો નરનાર. ૮  
 સમતા ધ્યાન ધરા ઉઝ્લી, કેસરી ચોર હુવો કેવલી;  
 શ્રી શુલ વીર વચન પામતી, સ્વર્ગે ગઈ સુલદા રૈવતી ૯

\*

### શ્રી જીવદ્યાની સજાય.

( રાગ ચોપાઈ. )

આદિ જીનેથર પ્રલુભેવ, સરસ્વતી સ્વામીની મનધરેવ; ૧  
 જીવદ્યા પાળો નરનાર, તો તરશ્યો નિશ્ચય સંસાર. ૨  
 પાણી જળતાં જ્યથુા કરે, આટા મીઠા જુડા પરેણ; ૩  
 જેહને મન દ્વા પ્રધાન, તે ધર દીસે બહુ સંતઘણ. ૪  
 મારે જુને ઝાડ લીખ, નર નારીને ઓહીજ ચીખ; ૫  
 તેહને ધરે નહિં સંતાન, દુઃખ ટેણે તે મેરે જાણ ૬  
 પક્ષી ઊંદર માણુસના બાળ, જેહ પાણી મારે ચીર કાળ; ૭  
 તેહને પરશવે ઓહીજ દુઃખ, છોડ તણું ન હોયે સુખ. ૮  
 માણથુ મધ બિલી અથાણું, આઢુ સુરથુ વજો બાણ; ૯  
 આજર મૂર્વા રતાણ જેહ, શુદ્ધ આવક તરછોડે તેહ. ૧૦  
 ઝાગણ કૂલે માણ, કરે, છહે? કેમ તે ભવ સાગર તરે; ૧૧  
 જેહને દેવશુર સુદેખ, સુખ ન પામે તે બવવેશ. ૧૨

બહુ દ્વારાનું લેલું કરી, માખણું તાવે અગિનએ ધરી;  
તે મરીને નરકે જાય, માનવ હોય તો દાહજવર થાય ૭  
દ્વધ તણે વળી લોલે જેહ, પાડા ભૂખે મારે તેહ;  
કૃતા ઢારમાં તે જાય વળી, ભૂખે તરસે મરે ટળવળી. ૮  
આંખ કૂટે દીયે જે ગાળ, પરલવ અંધો થાયે જાણ;  
મારો પીઠો દીયે જે ગાળ, પરલવ સુખ પામે ન બાળ. ૯  
પાછ પાટલાને વસ્ત્રદાન, સવિ સેક્યું વળી રાંધ્યું ધાન;  
મુનિવરને દીયે મન ઉદ્ઘાસ, તસ ધર લક્ષ્મી રહે સ્થિરવાસ. ૧૦  
દેતા દાન વિમાસણું કરે, દેહ દાન મન ચિંતા ધરે;  
સુખ શાંતિ પામે અભિરામ, છેડે ન રહે વસવા ઠામ. ૧૧  
ધન થોડું ને દીયે દાન, મહિયલમાં તેની વાધે વાન;  
રીજીને દાન દ્વારા રંગરોલ, તસ ધરે લક્ષ્મી કરે કદ્વોલ. ૧૨  
સુખ સંપત્તિ ને આવે મળી, ડોસાની દેવા મતિ ટળો;  
ધન ઉપર જેહ રાખે સ્નેહ, પરલવ સાપ તણો ભવ લેહ. ૧૩  
અધિકીં ઓછો આંધી તોળ, દેવા ચાહે નવિ પાળે બોલ;  
તેની લોકમાં ન હોવે ખાંચ, પરલવ તેના ન સરશો કાજ. ૧૪  
શાકો બાળે બોલે જેહ, પરલવ સુરખ થાયે તેહ;  
લણું જાણું હે ચોથો દાન, પરલવ નર થાય વિદ્યાવાન ૧૫  
નારી મોટી જુથમાં રહી, ખાંતે જુઠ લીલા કરી;  
કીધાં કર્મ નવિ છેલાઈ, મરીને નર તે કોઢીયો થાય. ૧૬  
પાંખ પાંખીની કાઢે જેહ, પરલવ કુઠો થાય તેહ;  
પગ કાપે ને કરે ગળગળો, મરી નર તે થાય પાંગળો. ૧૭  
થઈ સાચું વઢે દિન રાત, પરલવ તે ન પામે ચંધાત;  
માર્ત્ર પિતા સુત જૌયર ધર્ણી, પરલવ તેને વઠવાડ ધર્ણી. ૧૮

અણુદીકું અણુસાંલદ્યું કહે જે, પરબ્રહ્મ ખેડો થાય તેહ;  
પારકી નિંદા કરે નર નાર, યથ નહિ પામે તે લગાર. ૧૮  
પરના અવગુણું હાકે તેહ, નર નારી યથ પામે તેહ;  
નિંદા કરે ને હીએ જે ગાળ, પરબ્રહ્મ નર તે પામે આળ. ૧૯  
રાત્રિ લોજન કરે નર નાર, તે પામે ધુવડ અવતાર;  
રાત્રી પણી ન ખાયે ધાન, માણુસ હૈએ ન દિસે સાન. ૨૧  
સૂર્ય સરિએ આથમે દેવ, માણુસને ખાવાની ટેવ;  
ધર્મી લોકો હોયે જેહ, રાત્રી લોજન ટાળે તેહ. ૨૨  
ગૌતમ પૃથ્વિનાને અનુસાર, એ સજાય કરી શ્રીકાર;  
પાઈત હર્ષસાગર શિવસાગર કહે ધર્મ વિચાર. ૨૩

\*

### શ્રી શાંતિનાથજીનું સ્તવન :—

(રામ ભક્તાર) “ ચતુર ચોમાસુ પદ્ધિમી ” એ દેશી.

શાંતિ જિન, એક મુજ વિનતિ

સુષ્ણો ત્રિભુવન રાય રે;

શાંતિ સ્વરૂપ કેમ બાણીએ ?

કહે મન કેમ પરખાય રે શાંતિ૦ ૧

ધન્ય તું આત્મ ! જેહને, એહવો પ્રશ્ન અવકાશ રે,  
ધીરજ મન ધરી સાંલળો, કહુ શાંતિ પ્રતિલાસ રે.

શાંતિ૦ ૨

ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કદ્યા જિનવર દેવ રે,  
તે તેમ અવિતત્વ સફહે, પ્રશ્નમ એ શાંતિ પદ સેવ રે.

શાંતિ૦ ૩

આગમધર શુદ્ધ સમકાળી, કિરિયા સંવર સાર રે,  
સંપ્રદાયીઃ અવંચક સદા, શુચિ અતુભવ ખાર રે.

શાંતિઃ ૪

શુદ્ધ આત્મબન આદરે, તજ અવર જંબળ રે,  
તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી સાત રે.

શાંતિ૦ ૫

ઇતઃવિસંવાદ જેહમાં નહીં, શાષ્ટ તે અર્થ સંબંધી રે,  
સકલ નથ વાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે.

શાંતિ૦ ૬

વિધિ પ્રતિષેધ કરી આતમા, પહારથ અવિરોધ રે,  
અહલુ વિધિ મહાજને પરિશ્રદ્ધો, ઈસ્યો આગમે ઓધ ૬.

શાંતિ૦ ૭

કુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુડ સંતાન રે,  
નોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે.

શાંતિ૦ ૮

માન અયમાન ચિત્ત સમગ્રે, સમગ્રે કનક પાખાણુ રે,  
જંદળ નિંદક સમ જણે, ઈસ્યો હોય તું બાણ રે.

શાંતિ૦ ૯

સર્વ જગત જંતુને સમ ગણે, ગણે તૃષ્ણ મલિ ભાવ રે,  
મુક્તિ સંસાર બેહુ સમ ગણે, મુણે ભવ ન ઉનિધિનાવ રે.

શાંતિ૦ ૧૦

આયણે આતમ ભાવ જે, એક ચેતના ખાર રે,  
અવર સવિ સ્થાય સંચોગણી, એહ નિજ પરિકર સાર રે.

શાંતિ૦ ૧૧

પ્રભુ મુખથી એમ સાંલળી, કહે આતમ રામ રે,  
તાહુરે દરિશણે નિરતયો, મુજ ચિધ્યાં સવિ કામ રે.

શાંતિ૦ ૧૨

આહો ! આહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે,  
અમિત કૃત હાન દાતારની, જેહને લેટ થઈ તુજ રે.

શાંતિ૦ ૧૩

શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજપર ઇપ રે,  
આગમ માંહે વિસ્તાર ધણો, કહ્યો શાંતિ જિન ભૂપ રે.

શાંતિ૦ ૧૪

શાંતિ સ્વરૂપ એમ લાવશે, ધરી શુદ્ધ પ્રશુદ્ધાન રે,  
આનંદધન પ્રે પામશે, તે લહેશે બહુમાન રે.

શાંતિ૦ ૧૫



શ્રીમદ્ આત્મારામજી મહારાજ કૃત અનિતભ  
લાવના સજાય.

યૌવન ધન થીર નહી રહેના રે ॥ આંચલી ॥

પ્રાતઃ સમયને નજરે આવે, મધ્ય દીને નહિ દીસે,  
જે મધ્યાહ્ન સેં નહિ રાતે, કચું વિરથા મન હીસે.

॥ યૌવન ॥ ૧

પવન જર્કોરે બાળ વિષુસે, તખું શરીર તુમ નાસે,  
બરછી જળ તરંગ વત્, ચપળા કચું ખાંધે મન આસે.

॥ યૌવન ॥ ૨

વલ્લલશ સંગ સુપનસી માયા, ઈનમેં રાજાદિ કૈસા,  
છિનમેં ઉડે અર્કો તુલ કખું, યૌવન જગમેં એસા.

॥ યૌવન ॥ ૩

અકી હરી પુરંદર રાજે, અદમાતે રસ મોહિ,  
કેન દેશમેં ભરીને પહુંચે, તીનકી ઘઘર ન કોહિ  
॥ યૌવન ॥ ૪

જગ માયામેં નહીં લોલાવે, આતમરામ સયાને,  
અજર અમર તું સહા નિત્ય હૈ, જિન ધૂની યહ સુની ઠાને.  
॥ યૌવન ॥ ૫

\*

### અથ દુઃખમાધ્યયન સજ્જાય પ્રારંભ :

તે તરીયા લાધ તે તરીયા—એ દેશી

તે મુનિ વંદો તે મુનિ વંદો, ઉપશમ રસનો કંદો રે,  
નિર્મલ જ્ઞાન કિયાનો ચંદો, તપ તેને જેહવે દિષ્ટંદો રે.  
તે૦ ॥ ૧ ॥ એ આંકળી

પંચાશ્રવનો કરી પરિદ્ધાર, પંચ મહાવત ધારો રે,  
ષટલુષ તણો આધાર, કરતો ઉત્ત્ર વિહારો રે.  
તે૦ ॥ ૨ ॥

પંચ સમિતિ ત્રણ ગુસ્સિ, આરાધે ધર્મધ્યાન નિરાબાધે રે.  
પંચમ ગતિનો મારગ સાધે, શુલ્ષ ગુણુ તો ઈમ વાધે રે.  
તે૦ ॥ ૩ ॥

કૃય વિકય ન કરે વ્યાપાર, નિર્મભ નિરહંકાર રે,  
આરિત્ર પાલે નિર તિચાર, ચાલતો અડગની ધાર રે.  
તે૦ ॥ ૪ ॥

ખોગને રોગ કરી જે જણો, આપે પુષ્ય વખાણે રે,  
તપ શ્રુતનો મદ નવિ આણે, જોપણી અંગ ડેકાણે રે.  
તે૦ ॥ ૫ ॥

છાંડી ધન કણુ કંચન ગેહ, થધ નિઃસ્નેહી નિરીહ રે,  
એહ સમાલ્યી જાણી દેહ, નવિ ચોએ પાએ જેહ રે.

તે૦ ॥ ૬ ॥

દોષ રહિત આહાર જે પામે, જે હુએ પરિણામે રે,  
લેતો દેહનું સુખ નવિ કામે, જગતો આઠે જામે રે.

તે૦ ॥ ૭ ॥

રસના રસ રસ્સિયો નવિ થાવે, નિલોલી નિર્માયિ રે,  
સહે પરિસહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાય રે.

તે૦ ॥ ૮ ॥

રાતે કાઉસગું કરી સમશાને, જે તિહાં પરિસહ જાણે રે,  
તો નવિ ચૂકે તે હવે ટાણે, જય મનમાં નવિ આણે રે.

તે૦ ॥ ૯ ॥

કોઈ ઉપર ન ધરે કોધ, દિયે સહુને પ્રતિષોધ રે,  
કર્મ આડ જીંપવા જોધ, કરતો સયમ શોધ રે.

તે૦ ॥ ૧૦ ॥

દશવૈકાલિક દશમાધ્યયને, ઓમ ભાજોં આચાર રે,  
તે શુદ્ધ લાલ વિજયથી પામે, વૂર્જ વિજય જયકાણ રે.

તે૦ ॥ ૧૧ ॥

\*

**“મહારાજ શ્રી ચિદાનંદજી પ્રણીત” સંજાય**  
( આચા ડિરી )

અવધુ નિરપક્ષ વીરલા કોઈ, દેખયા જગ સહુ બેઇ. અવધું  
સમરસ ભાવભલા ચિત્ત બડે, થાય ઉત્થાપ ન હોઈ,  
અવિનાશી કે ધર કી બાતાં, બાનેંગે નર સોઈ.

અવધું ॥ ૧ ॥

રાવરંકમેં લેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે,  
તૃષ્ણા તરણાંથી કો નવિ પરિચય, તો શિવ મંહીર હેબે.

અવધું ॥ ૨ ॥

નિંબ સ્તુતિ શ્રવણ સુષ્ઠીને, હર્ષ શોક નવિ આણે,  
તે જગમેં જોગીધ્ય પુરા, નિત્ય ચઢતે ગુણ ઢાણે

અવધું ॥ ૩ ॥

ચંદ્ર સમાન સૌમ્યતા જાળી, સાગર જેમ ગંભીરા,  
અપ્રમત્ત લારંડ પરે નિત્ય, જૂરગિરિ સુમશૂચી ધીરા.

અવધું ॥ ૪ ॥

પંકજ નામ ધરાય પંકજું રહુત કમલ જેમ ન્યાસા,  
ચિહ્નાનંદ એસા જન ઉત્તમ, સો સાણીસકું ધ્યારા.

અવધું ॥ ૫ ॥

\*

“થતિ ધર્મેના અઠાર પાય સ્થાનક ”

( દશવૈકાલિક છંદું ધ્યયનમાંથી )

પહેલે પ્રાણુાતિપાત, બીજે ભૂતવાદ,

ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચ મે  
પરિગ્રહ, છેઠે રાત્રિ લોજન કર્યું,

સાતમે છ કાયની વિરાધના કરી,  
આઠમે સહોષ આહાર કર્યો,

નવમે ધાતુના વાસણ વાપર્યા, દશમે ગાહી.

માંચીએ બેઠા, અગ્યાર મેં સનારી,

વસતિમાં રહ્યા બારમે ભારી પાસે જેઠા.

તેરમેં ગાહલું વાપર્યું, ચૌદમે પલંગપર જેઠા.

પઞ્ચરમેં સનાનમજજન કર્યું,

કર્તા શ્રી મહામહોપાદખાયજુ શ્રીમદ્ યરોવિજયજુ કૃત  
શ્રી જૈનતત્ત્વ વિષે સજ્જાય

ਪਰਮਗੁੜ ਲੈਨ ਕਿਛੇ ਕਿਥੁੰ ਢਾਵੇ, ਗੁੜ ਉਪਦੇਸ਼ ਵਿਨਾ ਜੈਨ ਮੁਠਾ  
ਦੱਖਿੰਨ ਲੈਨ ਵਿਚੋਵੇ. ਪਰਮ ਗੁੜ ॥ ੧ ॥ ਛਹਤ ਕੁਪਾਨਿਧਿ ਸਮ  
ਵਖ ਜੀਵੇ, ਕੁਮੰ ਮੇਲ ਕੇ ਧੋਵੇ, ਬਹੀਰ ਪਾਪ ਮੇਲ ਅੰਗੇ ਨ  
ਧਾਰੇ; ਸ਼ੁਝ ਸਵੜ੍ਹ ਨਿਜ ਲੇਵੇ ॥ ਪਰਮ ਗੁੜ ॥ ੨ ॥ ਸਵਾਵਾਹ  
ਪੂਰਥੁ ਕੇ ਬਾਣੇ, ਨਥ ਗੱਭਿੰਨ ਜਸ ਬਾਚਾ ਗੁਣਪਰਿਆਖ ਫੁਲ  
ਸੋ ਬਾਣੇ, ਚੋਡੀ ਲੈਨ ਛੁੰ ਆਚਾ; ॥ ਪਰਮ ਗੁੜ ॥ ੩ ॥ ਪਰ  
ਪਰਿਥੁਤੀ ਅਪਨੀ ਕਰੀ ਮਾਨੇ, ਕਿਰਿਆ ਅਰੰਧੇਲੋ, ਛਨਕੇ ਜੈਨ  
ਕਿਛੇ ਕਿਥੁੰ ਕਿਉਂਕੇ, ਚੋਡਿ ਮੂਰਖਮੇ ਪਛੇਲੋ ॥ ਪਰਮ ਗੁੜ  
॥ ੪ ॥ ਕਿਰਿਆ ਮੂਢ ਮਤਿ (ਕੋ) ਅੜਾਨੀ, ਥਾਵੇ ਬਾਵ ਅਪੂਰੀ.  
ਜੈਨ ਅਵਨ ਉਨਮੈਂ ਛਿ ਨਛਿ ਕਿਛੇਸੋ ਸਥ ਹ ਜ੍ਵਾਡਾ ॥ ਪਰਮ  
ਗੁੜ ॥ ੫ ॥ ਜਾਨ ਭਾਵ ਜਾਨੀ ਸਥਮਾਂ ਛਿ, ਥਿਵ ਸਾਖਨ  
ਸਦਹੀਥੇ, ਨਾਮ ਲੈਖਸੇ ਕਾਜ ਨ ਸਿਜ਼ਾਤੇ, ਭਾਵ ਉਦਾਸੀ  
ਰੱਖਿਵੇ ॥ ਪਰਮ ਗੁੜ ॥ ੬ ॥ ਜਾਨ ਸਕਲ ਨਥ ਸਾਖਨ ਸਾਥੋ,  
ਕਿਰਿਆ ਜਾਨਕੀ ਹਾਸੀ, ਕਿਰਿਆ ਕਰਤ ਹੈ ਧਰਤ ਹੈ ਮਮਤਾ,  
ਆਇ ਗਲੇਮੈਂ ਝ੍ਰਾਂਸੀ ॥ ਪਰਮਗੁੜ ॥ ੭ ॥ ਕਿਉਂਕੇ ਜਾਨ ਵਿਤੁ  
ਨਹਿ ਕਿਰਿਆ, ਕਿਉਂਕੇ ਕਿਰਿਆ ਜਾਨ ਵਿਤੁ ਨਾਡੀ; ਜਾਨ ਕਿਵਿਆ

होने। संग भीला है, जय जव रस जलमाहि ॥ परम शुद्ध ॥ ८ ॥ किरिया मगनता खाहिर द्विघत ज्ञाने शक्ति जस लाजे, सहगुड शीख सुते नहि कथहुँ सो जन जैनने लाजे ॥ परम शुद्ध ॥ ९ ॥ तत्व धुद्धि निजकी परीषुटी है, सकल सूत्रकी कुंची; जगज्जस वाद वधे उनहिको। जैन दशा जस उंची ॥ परशुद्ध ॥ १० ॥

\*

### श्री आत्मलावना पद.

हेषो लाई भद्रा विकल संसारी, हुभित अनाहि भोह के कारण रागदेव उरधारी. हेषोलाई. ए टेक छिंसारंस करत सुख समजे, भृषायोद चतुराई. परधन हुरत समरथ कहावे, परिश्रह वधत बडाई; याते होते औरकी और, शुक्ल करण्ही हुःभद्राई. ॥ हेषोलाई ॥ २ ॥ जेगासन करे पवन निरोधे. आत्म द्रष्टि न जागे; कथनी कथन भहंत कहावे, भमता भूत न त्यागे ॥ हेषोलाई ॥ ३ ॥ आगम वेह सिद्धांत पाठ सूखे, हुधि आठमह आखे; जति लाभ कुल बद-तप विद्या प्रलुता इप वधाते ॥ हेषोलाई ॥ ४ ॥ जड शुँ राथे परम पद साथे, आरमशक्ति न सुजे. विनय विवेक विचार दृष्ट्यको, शुषु पर्याय न धुजे ॥ हेषोलाई ॥ ५ ॥ जसवाले जस सुखी जांतोषे, तप वाले तप शोषे: गुनवाला परगुनकुं हाषे, भतवाला भत धोषे: ॥ हेषो लाई ॥ ६ ॥ शुद्ध उपदेश सहज उद्यागत, श्वेषु विकलता छुटे; श्रीनय विजय सुज्जस विलासी, अगव अक्षय निधि लूटे: ॥ हेषो लाई ॥ ७ ॥

### શ્રી સત્ય મારગ લાવના પદ

મારગ સાચા કોણું બતાવે જાકું જય પૃથ્વીએ  
તે તો અપની ગાવે; મારગ ॥ ૧ ॥

મત વારા મત વાદ ધર, થાપન નિજ મંત નીકા,  
સ્વાહુવાદ અનુભવ ધીન તાકા, કથન લાગત મોતે ઝીકા.

મારગ૦ ॥ ૨ ॥

મત વેદાંત અદ્વા પદ ધ્યાવત, નિશ્ચય પખ ઉર ધારી,  
ભિમાંસક તો કર્મ વહે તે, ઉદ્દ્ય લાવ અનુસારી.

મારગ૦ ॥ ૩ ॥

કહત બૌદ્ધ તે બુદ્ધદેવ મમ, ક્ષણિક ઇપ દર્શાવે,  
નૈયાયિક નય પદ અહિતે, કરતા કોઉ ઠરાવે.

મારગ૦ ॥ ૪ ॥

આરવાક નિજમનઃ કદ્મના, શૂન્ય વાદ કોઉ ગણે,  
તિષ્ઠુમે લયે અનેક શેદતે, અપની અપની તાણે.

મારગ ॥ ૫ ॥

નય સરવંગ સાધના જામે, તે સરવંગ કહાવે,  
ચિદાનંદ જૈસા જિન મારગ, ઓળ હોય તે પાવે.

મારગ૦ ॥ ૬ ॥

### શ્રી સમકિત ગ્રામિ વિષે સજાઓ

સમકિત નબ્ય લયું રે, એ તો ઇદ્યો અતુર્ગતિમાણી,  
ત્રસ સ્યાવરની જયથુા ક્રીધી, જીવ ન ઓક વિરાધ્યો.  
તણું કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન સાધ્યો.

સમકિત૦ ॥ ૧ ॥

જુદ બોલન્ડો પ્રતિ લીનોઃ, ચોરીકો પણ ત્યાગી,  
વ્યવહારાદિ મહા નિપુણ લયો પણ, અંતર દર્શિ ન જામી.

સમકિત૦ ॥ ૨ ॥

ઉદ્ધ્વ ભૂજ આહુ ઉંઘ્યા લટકે, લરમ લગા નિજ ધટકે,  
અટાચુટ શિર ઝુંડે જુઠો, વિષુ શ્રદ્ધા લવ લટકે.

સમકિત૦ ॥ ૩ ॥

સ્વપરનાત્રી ત્યાગજ કરકર, અદ્ધ પ્રત ધર લીનોઃ,  
દેવાદિક માકો સુખ પાકે, નિજ કારજ નવિ સિદ્ધો.

સમકિત૦ ॥ ૪ ॥

દ્રોય ફુલા અથ ત્યાગ પરિથષ્ઠ, દ્રોય લિંગ ધરલીનોઃ,  
દેવતો કહે યા વિષ અન્દ મેં, બહોત વાર કર લીનો.

સમકિત૦ ॥ ૫ ॥

#

મત મતાંતરનો ત્યાગ કરી આત્મલાલ વિષે સજાય  
મતિમાન જેમ વિચારો રે, મતિ મતિયન કે ભાવ (જે ચાલ.)

વસ્તુભતે વસ્તુ બહેં રે, વાહ વિવાદ ન કોય;  
સૂરતીયાં પ્રકાશ પીબારે, અંધકાર નવિ હોય.  
॥ મતિમન ॥ ૧.

ઝ્યપરૈખ તીયાં નવિ ધટે રે, સુદ્રા લેક ન હોય;  
લોછ જાન દર્શિ કુલી ચ્યારે, દેખો અંતર જોય  
॥ મતિમાન ॥ ૨.

તનતા મનતા વચનતારે, પર પરિષુતિ પરીવાર;  
જન મજૂ વચનાતીત ચ્યારે, નિજ જર્તા સુખકાર.  
॥ મતિમાન ॥ ૩.

અંતર શુદ્ધ સ્વભાવમાંરે, નહિ વિભાવ લવલેશ;  
ભર્મ આરોપિત લક્ષથી ચ્યારે, હંસા સહત કલેશ;  
॥ મતિમાન ॥ ૪.

અંતર શુદ્ધ નિહિત્યમ અહિ રે, કાયાથી વ્યવહાર;  
બિદાનનંદ ઈમ પામીએ ચ્યારે, લવ સાગર કે પાણ.  
॥ મતિમાન ॥ ૫.

\*

### અષ્ટમંડ ત્યાગ વિષે સજીવાય

લધુના મેરે મન માની લઈ યુર ગમ શાન નિશાની-એ ચાલ.  
મહ અષ્ટ જીનો ધારે, વો હુર્ગંતિ ગયે બિચારે,  
હેઓ જગતે પ્રાણી, હુઃઅ સહત અધિક અસ્થાની.

લધુતા ॥ ૧ ॥

શશી સુરજ બડે કહાવે, વો રાહુ કે ષીય મેં આવે,  
તારા ગણુ લધુતા ધારી, સ્વરભાનુ ભિત્તિ નિવારી.

લધુતા ॥ ૨ ॥

છાટી અતિ જ્ઞેયણુ ગંધી, જેવે ષટરસ સ્વાદ સુગંધી,  
કરટી મોદાઈ ધારે, નિજ ચિર પર છાર ઉઠાડે.

લધુતા ॥ ૩ ॥

જબ બાલથંડ હોઈ આવે, તથ સહુ જગ હેખણુ થાવે.  
પૂનમ ચંડુ બડો કહાવે, તથક્ષીણુ કણા હોઈ જાવે,

લધુતા ॥ ૪ ॥

શુરુ આઈ મનમેં એદે, તથ ભૂપ અવણુ નાસિકા છેદે,  
અંગમાંહિ લધુ કહાવે, તે કારણુ અરણુ પૂળવે.  
લધુતા ॥ ૫ ॥

શિશુ રાજલોકમેં જવે, સખી હિલભિલ ગોદ ખીલાવે,  
હેણ બડા જન ન પાવે, જવે તો શિખ કટાવે,  
લધુતા ॥ ૬ ॥

અંતર મદ ભાવ બહાવે, તથ ત્રિલોક નાથ કહાવે,  
ધમ ચિહ્નાનંદ શુષ્ણ ગાવે, કોઈ રહણી વીરલા પાવે.  
લધુતા ॥ ૭ ॥

\*

### શ્રી અંદ્યાતમ પદ

પરમ પ્રભુ સખ જગ શળહે ધ્યાવે જખલગ અંતર  
લેદ ન જાંજે તખલગ કોઉન પાવે. ॥ પરમ પ્રભુ ॥૧॥  
સકલ અંશ હેઠે જલ જોગી, જોખીણું સમતા આવે,  
મમતા અંધ ન હેઠે હિન્કું, ચિત્ત ચીહું રે ધ્યાવે.  
॥ પરમ પ્રભુ ॥ ૨ ॥

સહજ શક્તિ ઔર શુદ્ધકી ભક્તિ, જે ચિત્ત જોગ જગાવે.  
દૃષ્ટ શુષ્ણ પથથિસે અપને, તો કોઈ લય લગાવે,  
॥ પરમ પ્રભુ ॥ ૩ ॥

ખડત પુરાણ વેદ ઔર ગીતા, મૂરખ અથ્ય ન પાવે,  
ધૃત ઉત શીરત ગૃહિત રસ નાંહિ, જલું પશુ ચરવિત ચાવે.  
॥ પરમ પ્રભુ ॥ ૪ ॥

પૂર્ણગલસે ન્યારો પ્રભુ મેરો, પૂર્ણગલ આપ છીપાવે,  
ઉનસે અંતર નાંહિ હમારો, અથ કહાં ભાગો જવે.  
॥ પરમ પ્રભુ ॥ ૫ ॥

અલખ અજર ઔર અમર નીરંજન, સો પ્રભુ સહજ સુહાવે,  
ગાંતરયામી પૂરણ પ્રગટથો, સેવક યથ શુષ્ણ ગાવે.  
॥ પરમ પ્રભુ ॥ ૬ ॥

### મન સ્થિર કરવા વિશે સ્વાધ્યાય

મનાજુ તુમે, જિન અરણે ચિત્ત લાવો;

તાકો અવસરે, વિત્યો જાય. મનાજુ १

ઉદર ભરણુ કે કારણે રે, ગૌઆ બુનમેં જાય;

ચારે અરે અરુ દેસી પ્રીરે રે,

વાઙું ચિત્તદું ખછસ્તિયા માંહિ. મનાજુ २

આર પાંચ સ્વાહેદી મીલીરે, હિંદુમીલ આણી જાય;

તૃપ્તી દીઓ અઠ અઠ હસે રે,

વાઙું ચિત્તદું ગગરિયા માંહિ. મનાજુ ३

નૃથ્વો નાચે ચ્યાકમાં રે, લખ આવેલખ જાય;

વાંશ અઢે નાટક કરે રે,

વાંશ ચિત્તદું હોરડિયા માંહિ. મનાજુ ४

સોનીડો સોનુ ઘડે રે, ઘડે વળી ઇપાના ઘાટ;

ઘાટ ઘડે કુજન સીજવે રે,

વાંશ ચિત્તદું સોનૈયા માંહિ. મનાજુ ५

જૂગટી કે મન જૂગદુ રે, કામી કે મન કામ;

આનન્દ ધન ઈમ વિનવે રે,

એસો ધરો પ્રભુજુસે ધ્યાન. મનાજુ ६

\*

### નવ પ્રકારે કિયા વિશે સ્વાધ્યાય

(રાગ ચોપાઠ) (સુધારા સાથે)

શ્રવણ १ કીર્તન २ સેવન ઉત્ત તણે, વંદન ४ નિંદન ૫ ધ્યાન

૬ મને; ધારી લધુતા ૭ એગતા ૮ પણે, સમતા

નવમી રહે કને. ૧

ગુણ અનંત જીવ દ્રવ્યના કહ્યા, જાન દર્શન સુખ વીરો લધ્યા;  
તેહ તલુ સાંસળતું કરે, પ્રથમ કિયા પાતિક પરિહ રે. ૨

કીર્તન કથની કરે અતિધારી, જે દ્રોય ગુણ પર્યાય ભાષી;  
વચન યોગી પાતિક પરિહરે, બીજી કિયા સમજુ આદરે. ૩

સેવન કરતો હૃદય મોનાર, ગુણ સંભાળે વારંવાર;  
હુગંતિ કાપે નિશ્ચે સહિ, ત્રિજા બોલથકી એ લહી. ૪

વંદન કરતો સાવથી વળી, ચેતન દ્રવ્યના ગુણ કહે વળી;  
ધણે વીર્ય ઉલ્લાસે જેહ, ચોથી કિયામાં મધરી સંહેહ. ૫

નિંદા કરે વિભાવજ તણો, રાગાદિક હુઃખ દેતા લાણી;  
લઘુ કરમી તોણે નિશ્ચય થાય, પંચમ કિયાએ ગુણ બોલાય. ૬

ધ્યાન ધરતો તેહનો ધણી, થીર કરી થાપે બહુ ગુણ લાણી;  
ધાતિ કર્મનો છેહક તેહ, છીઠી કિયામાં મધરીશ સંહેહ. ૭

લઘુ ગુડ્દાએ ચિંતે ધણું, ધણ્યા મોક્ષ જયા હું સંસારે લમું;  
તો હું હીણ્યા પણ્યાથી બહુ, ગુણ સાતમાં હૃદયે લહુ. ૮

એકલો જ-મી એકલો મરે, પુણ્ય તે સાથે વરે;  
સુખ હુઃખ સરે એકલો સહે, ગુણ આઠમો જાની ઈમ કહે. ૯

રસ સમતા એ નવમો જાણુ, સર્વ જીવ આપ સરખા જાણુ;  
સરખા સ્વભાવ વચન ગુણ કહ્યા,

નવમે ઓલે શિવ સુંદરી વર્યી. ૧૦

એહવા ભાવ ધરે મુણ્યિંદ, કથની કથી એ ગણી મર્યિંદ;  
વિનય કરીને ભષ્યશે જેહ, અવિચળ પદની લેશે તેહ. ૧૧



## આત્મભાવ સ્વાદ્યાખ

કુણા

જે હેણું તે તુઅ નહીં, નવિ હેણું તે તું હી; ધણું ભાવે વર્તો સાંડા સધળો તું હિંજ તું હી. ૧  
જેણે તુઅકું પીછાણીએ, નવી જુએ પારકી લાર; આપ સ્વભાવમેં તે રહ્યો, નવી લીએ મનકી સાર. ૨  
મનેં જે આંખી મેલીએ, આત્મ ગુણુને લાર; મનકું દ્વારે મૂકીને શૂન્ય કરે બ્યાપાર. ૩  
તાલી લાગી આપકું, પરકું હેખત નાંહિ; આપ સ્વભાવમેં જીલતો, જણે સર્વ વસ્તુ યાંહિ. ૪  
ધણી ચેરે જ્યોતિ જગાય કે, ઉઘોત ભયે સબ ઠોર; અંત રંગ પ્રગટી કળા, હુએ ઓર કી ઓર. ૫

દાળ

જીત્યો જીત્યો રે મોટો મોહ રાય કે,  
દીઢા દીડે રે લોકાલોક આજ કે;  
જાણ્યા જાણ્યા રે સ્થુલ સ્થુલ ભાવ કે,  
પાણ્યા પાણ્યા રે આત્મ ગુણ રાજ કે. ૧૪  
ધારી કર્મના ક્ષય થકી આજ કે,  
નામ જૌત ઉદ્યથી પૂજે સૂરરાજ કે;  
વેણી આયુથી વિચરે મહારાજ કે,  
શૈલેસી કરણે મણિચંદ્ર મહારાજ કે ૨૫.



## इति स्वाध्याय विलङ्घा

श्री सीमधर स्वामी स्तुति

महान् डण पुन्न सोवन्न देह, जणाणंदण केवलनाणगेहम् ।  
महान् दलच्छां बहु बुद्धिरायं,  
सुसेवयामि सीमधरं तिथरायम् ॥ १ ॥

पुरा तारगा जेह जीवाणजाया,  
भविस्मति ते सब भव्याण ताया ॥

तहा संपयं जे जीणा बहुणाणा,  
सुहं दिंतु ते मे ति लोयघष्ठाणा ॥ २ ॥

दुरुत्तार संसार कुब्बारतायं,  
कलंकावलीपंक — परकाल — तोयम् ॥

मणो बंछियथे सुमंदारकप्पं  
जिणंदागमं बंदिमो सुमहप्यम् ॥ ३ ॥

विकासे जिणंदाणणंभोजलीणा,  
कलांहवलावन्नसोहगपीणा ॥

बहंतस्स चित्तंपि गिन्छंपि ज्ञाणं,  
सिरिभारई देहि मे सुद्ध नाणम् ॥ ४ ॥

\*

योग साधकस्य साधनम् ।

अध्यात्मं भावना ध्यानं, समता वृत्ति संक्षयः ॥

मोक्षेण योजनाद्योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥ १ ॥

अध्यात्म, भावना, ध्यान, समता, वृत्ति संक्षय;

मोक्षमां ज्ञेते ज्ञेग, आहि अत्य श्रेयस्कर. १

\*

ॐ અહો નમઃ

"આ સજાયોતા પ્રથમ છાપ કામમાં બહુ અશુદ્ધિયો હોવાથી અને અસંબંધ કેટલાક પાછો હોવાથી મારી ભર્તિ અનુસાર સુધારી સંચોજના કરી છે; આના કરતામાં શ્રી આનન્દધનજી મહારાજનું શુલ નામ આવે છે; પણ લાખ શૈષ્યી જેતાં કોઈક વીજ મહાશય હોવા બેધાયે. "આ સજાયોતામાં અધ્યાત્મિક લાવ હોવાથી એં સંપાદન કરવા લાવના કરી છે.

સંપાદક મુનિ ચંપકસાગરજ મહારાજ

• \*

ઇરિયા સમિતિ સજાય

(હંહેણ)

પંચ મહાત્રત આદરી, આતમ કરે વિચાર;  
અહેણ અહેણ હું પરતક્ષા થયો, ધન ધન મુજ અવતાર. ૧

(રાગ ચિતોડા રાજની દેશી.)

ઇરિણે ચાલો રે, વિનતી અવધારો રે;  
શક્તિ સંભાળો રે, આત્મ સુખાવની રે. ઈ. (૧)

ઇરિણ ને કહીએ રે, સુમતિ સંભાળી રે;  
તવ લાગી ર્યારી રે, પુઠવાળી કુમતિ સંગથી રે. ઈ. (૨)

દ્રોયથી સાર રે કિલામણ્ણા ન લગાર રે;  
રખે નવિ ઉપજે રે, હવે પર પ્રાણીને રે. ઈ. (૩)

મુનિ આરગ ચાલો રે, દ્રોય લાખસું મહાલો રે;  
આતમ ઉગારો રે ભવદ ચક્રથી રે. ઈ. (૪)

જે મુનિ ગુણુ પામી રે, પરભાવ વામી રે;  
કહે વીર સ્વામી રે, આનંદ ધન તે થયા રે. ઈ. (૫)

\*

### ભાષા સમિતિ સંજાય

(રાગ રાય કહે રાણી પ્રત્યે સુણો કામિનીળ)

બીજુ સમિતિ સાંલણો જયવંતાજુ,  
ભાષાની જે જાણુ ગુણવંતાજુ;  
ભાષે ભાષણુ સ્વરૂપનું જયવંતાજુ,  
ઝીપી પદારથ ત્યાગ ગુણવંતાજુ. (૧)  
નિજ સ્વરૂપ રમણે ચડયા જયવંતાજુ,  
નર્વિ પરનો પર ચાર ગુણવંતાજુ;  
ભાષા સમિતિથી સુખ થર્યું જયવંતાજુ,  
તે જાણે મુનિરાય ગુણવંતાજુ. (૨)  
સાનવંત નિજ સાનથી જયવંતાજુ,  
અનુભવતા સ્વભાવમાં ગુણવંતાજુ;  
દ્રોયથી પણુ મહામુનિ જયવંતાજુ,  
સાવધ વચન કરે ત્યાગ ગુણવંતાજુ. (૩)  
સાવધ વિરઘ્યા જે મુનિ જયવંતાજુ,  
તે કહિયે મહાભાગ ગુણવંતાજુ;  
સુમતિ સુમતિ સ્વભાવથી જયવંતાજુ,  
સ્વ પર વિવેચન થાય ગુણવંતાજુ. (૪)  
પર ભાષણુ દ્વારે કરી જયવંતાજુ,  
નિજ સ્વરૂપમાં ભાસ ગુણવંતાજુ;  
આનંદ ધન પછ તે લહે જયવંતાજુ,  
નિજ રિદ્ધિ મહારાજ ગુણવંતાજુ. (૫)

\*

## અષાઢા સમિતિ સંજ્ઞાય

( સમ પંગાળાની દેશી )

ત્રોજુણું સમિતિ અષાઢા નામ,  
તેણે હીડા આનન્દધન સામ ચેતન સાંખણો;  
જબ હીડા આનન્દ ધન વીર,  
સે'જ સ્વભાવ થયો છે ધીર ગયો આમળો. (૧)  
વીર થઈને અરિ પુઠે ધાય,  
અરિ તે તો નાડો જાય ચેતન સાંખણો;  
વીરની સનમુખ કોઈ ન થાય,  
રત્ન વચિસું ભળજા જાય જયો આમળો. (૨)  
અરિનું બળ હવે નથી કંઈ લેશ,  
નિજ સ્વભાવમાં આલો સવેષ ચેતન સાંખણો;  
નિરખણું લાગો નિજ ધર-માંહિ,  
તર વિસામો લીધો ત્યાંહિ જયો આમળો. (૩)  
હવે પર ધર કદી ન જાઉ,  
પરને સનમુખ કદી ન થાઉ ચેતન સાંખણો;  
એમ વિચારી થયો સલગ,  
તર પર પરખુતિમાં લાગી આગ ગયો આમળો. (૪)  
સુનિવર કદ્દાં રસ લંડાર,  
હાથ રહીત લેવે છે આહાર ચેતન સાંખણો;  
દ્રવ્ય થકી ચાલે છે એમ.  
પર પરખુતિનો લીધો નેમ ગયો આમળો. (૫)  
દ્રવ્ય લાવસું જે મુનિરાય,  
સુમતિ સ્વભાવમાં આદ્યા જાય ચેતન સાંખણો;  
આનન્દધન પ્રખુ કહીયે તેહ,  
કુદ્દ વિશાવને હીધો છેહ અયો આમળો. (૬)

## આદાન નિક્ષેપના સમિતિ સંજાય

(રાગ જગતચુર હીરળદેશી)

ચાથી સમિતિ આદરો રે, આદાન નિક્ષેપ ઈષુ નામ,  
આદાનજો જે આદર કરે રે, નિજ સ્વરૂપને....તામ.  
સ્વરૂપ શુણુ ધારને રે,

ધારને અક્ષય અનન્ત લવિક હુંખ વારને રે. (૧)

નિક્ષેપણ નીવારવું રે, પર વરસુ કળી જેહ,  
તેહ થકી ચિત્ત વાળિયે રે, કરવા ધર્મસું નેહ. સ્વરૂપ (૨)  
ધર્મ નેહ જખ લાગીએ રે, તવ આનન્દ અપાર,  
પ્રગટો સ્વરૂપ વિષે હવે રે. આતાં ઘેખર થાર. સ્વરૂપ (૩)  
અંજાન તિમિરને નષ્ટ કરી રે, જાન સુધારસ જેહ,  
આસ્વાહન સુનિવર કરે રે, ત્રિયદી શુણુ ગેહ. સ્વરૂપ (૪)  
સ્વરૂપમાં જે સુનિવરા રે, સુમિતિ સુધારસ જેહ,  
સ્વસુમતિ પ્રગઢાવીને રે, હીધો કુર્મતને છેહ. સ્વરૂપ (૫)  
કાળ અનાદિ અનન્તનો રે, હતો સેંદળન સ્વભાવ,  
તે પર પુદુગળમાં હવે રે, ન રહે સુનિના ભાવ. સ્વરૂપ (૬)  
ક્રિય ભાવ હો લેદથી રે, સુનિવર સમિતિ ધાર,  
આનન્દધન પદ પામસે રે, તે સુનિ શુણુ ભંડાર. સ્વરૂપ (૭)

\*

## પારિઠાવણિયા સમિતિ સંજાય

(દેશી રાગ રાજવી રે)

પંચમી સમિતિ હો સુનિવર આદર જો રે,  
પર છોડી સ્વભાવને સુધારુણ,  
સુનિ મારગ હો ઇડી પરે ધારને રે,  
ઓ મારગનો પરિઠાર સુસાધુણ. સુનિ (૧)

પારિકાવણ્યા હો નામ વળી ને કહું રે,  
 તે તો પરહરવો પરલાવ સુસાધુલ,  
 આદર કરવો હો નિજ સ્વભાવનો રે,  
 તે તો અકળ સ્વરૂપ કહેવાય સુસાધુલ. મુનિ (૨)

પર પુદ્રગળ હો મુનિવર પરઠવે રે,  
 વિચાર કરી ધર્માંહિ સુસાધુલ,  
 લોક સંજા હો ને મુનિ પરિહરે રે,  
 ચાર ગતિ પછી વોસરાવ સુસાધુલ. મુનિ (૩)

અનાદિનો હો સંગ વળી ને હતો રે,  
 તેનો હવે મુનિ કરે ત્યાગ સુસાધુલ,  
 વિકલ્પને હો સંકલ્પ હવે ટાળવા રે,  
 ને મુનિ થયા ઉજમાલ સુસાધુલ. મુનિ (૪)

પર કણુ હો મુનિ વળી પરઠવે રે,  
 તે જાણી ને અનાચાર સુસાધુલ,  
 આચારને હો વળી મુનિ આદરે રે,  
 કરતા કાર્ય સ્વરૂપી થાય સુસાધુલ. મુનિ (૫)

પર દ્રોયનો હો જાણુ પણ ને કહ્યો રે,  
 તેણે જાણ્યો ઓાપ સ્વભાવ સુસાધુલ,  
 સ્વભાવનો હો કરતા વળી ને થયો રે,  
 તે તો અણુ અવધારી કહેવાય સુસાધુલ. મુનિ (૬)

સુમતિસું હો મુનિ મહાવતા રે,  
 બાલતા સુમતિ સ્વભાવ સુસાધુલ,  
 કુમતિસું હો દ્રષ્ટિ નવિ નોડતા રે,  
 વળી તોડતા તસ અલિમાન સુસાધુલ. મુનિ (૭)

પર પરણુતિ હોએ કહે સુણુ સાહેબા રે,  
તમે મને મુકી કેમ સુસાધુજ,  
કહેએ મુનિ હોએ કવણુ અપરાધથી રે,  
તમે મને છોડીને જાવ સુસાધુજ. મુનિ (૮)

મે મારો હોએ સ્વભાવ નવિ છંડિયો રે,  
નથી મારો વિભાવ સુસાધુજ,  
પંચ રંગી હોએ માર્દં જે સ્વરૂપ છે રે,  
તેને આદર છું સદા કાળ સુસાધુજ. મુનિ (૯)

વણુ ગંધને હોએ સ્પર્શો છંડુ નહિ રે,  
સડણુ પડણુ વિધ્યંસ સુસાધુજ,  
ઝ્યારા રસ હોએ રસ થઈ રહ્યા રે,  
તો સ્યો અવગુણ કહેવાય સુસાધુજ. મુનિ (૧૦)

સંદૃ જીવથી હોએ અનન્ત ગુણુ કહ્યા રે,  
મારા ધરમાં ચેતન રાય સુસાધુજ,  
તે સધળા મારે હોએ વસ થઈ રહ્યા રે,  
તમે છોડીને કિમ જાઓ સુસાધુજ. મુનિ (૧૧)

તવ મુનિવર હોએ કહેએ કુમતિ સુણો રે,  
તાર્દં સ્વરૂપ સુણુાવું કુડી કુમતિ,  
નવિ બોલ હોએ બોલ તારા સ્વરૂપમાં રે,  
જેમ તું તારામાં છે મગન કુડી કુમતિ. તવ (૧૨)

મારા સ્વરૂપમાં હોએ થયો હું મગન આજ રે,  
નવિ ચલું સ્વસ્વભાવથી કુડી કુમતિ,  
માર્દં સ્વરૂપ અનન્ત મેં જાણીઓ રે,  
તેતો અચળ અવખ કહેવાય કુડી કુમતિ. તવ (૧૩)

સુમતિથી હો સ્વભાવમાં હું રમું રે,  
 તારા સામું જેયું કેમ જાય કુડી કુમતિ,  
 તારે મારે હો હવે નહી બને રે,  
 તુમ તુમારે ધર જાઓ કુડી કુમતિ, તવ (૧૪)

આટલા દીહો હું બાળક હતો રે,  
 હવે પંડિત વીર્ય ગ્રગયાય કુડી કુમતિ,  
 સુમતિનો હો આદર હવે મે કર્યો રે,  
 તે તો મહાગુણવંતી કહેવાય કુડી કુમતિ. તવ (૧૫)

સુમતિના હો ગુણુ પ્રગટ પણે રે,  
 મે લીધા ઉપયોગ તે જાણુ કુડી કુમતિ,  
 જાંખળ જો હો સમતાના ગુણુ કહું રે,  
 જે અમળ અંખડ કહેવાય કુડી કુમતિ. તવ (૧૬)

સ્થિરતા પણુ હો સમતામાં ધણું રે,  
 તુજમાં અસ્થિરતા સમાય કુડી કુમતિ,  
 તારા સુખનો હો મે જાણીયો રે,  
 શષ્ઠ, ઇપ, રસ, ગંધ, રૂપર્થ કુડી કુમતિ. તવ (૧૭)

તારું સુખતો હો વિભાવ કહેવાય રે,  
 તે તો પુણ્ય પાપનો જ્યાબ કુડી કુમતિ,  
 જાની તો હો એહને સુખ નવિ કહે રે,  
 સુખ તો એક નિજ સ્વભાવ કુડી કુમતિ તવ (૧૮)

તારી પાછળ હો પડિયા તે આંધલા રે,  
 અજાની તેને જાણુ કુડી કુમતિ,  
 તારું સ્વરૂપ તો હો મે ધણું જાણીઓ રે,  
 પણ તું તો જડ કહેવાય કુડી કુમતિ તવ (૧૯)

ताः जड़पथु हो मेहूप्रगट जाणीउ रे,  
हु तो परपुद्गणनोऽथेष्ठ कुडी कुमति,  
तेनु विवरथु हो प्रगट हवे सांखणो रे,  
संसार समुद्र अधाद कुडी कुमति. तव (२०)

तृष्णा दृप हो जण तेमां धाणु रे,  
पथु पीधे तृतीन थाय कुडी कुमति.  
ते समुद्रनो हो अधिष्टायक वणी रे,  
ते भाड नामे भूपाण कुडी कुमति. तव (२१)

तेना भित्रो हो प्रधान वणी पांच छे रे,  
वणी त्रेवीस छडीदार कुडी कुमति,  
राजधानी हो त्रेवीसने लक्षावीने रे,  
तेनी खबर राखे पांच कुडी कुमति. तव (२२)

राजधानी हो एवो भेणवी रे,  
धर्म राजनु धन लुटी आय कुडी कुमति,  
आद्य धर्मी हो एने आहरे रे,  
तेने भोणवे छडीदार कुडी कुमति. तव (२३)

वस करीने हो सोंपे भाहरायने रे,  
भाह करावे प्रभाद कुडी कुमति,  
पछे नांपे हो नरग निघोडमां रे,  
तिहां काण अनन्तो जय कुडी कुमति. तव (२४)

हु धर्मी हो एहथी नवि चले रे,  
जे भे कीधेा क्षायक लाव कुडी कुमति,  
परभादीने हो भाड पीड धाणु रे,  
अप्रभादी रघो नवि जय कुडी कुमति. तव (२५)

જેણુ મોયા હો મહાત્મત આદર્યા રે,  
વળી છોટ્યા અનાચાર કુડી કુમતિ,  
આચારથી હો હવે હું નવિ ચલું રે,  
સુષુ મારા ચિત્તના અલિપ્રાય કુડી કુમતિ. તવ (૨૬)

કુમતણ હો તને કહું એટલું રે,  
મારા સાધર્મી છે અનન્ત કુડી કુમતિ,  
તે સર્વેને હો તે દાસ કર્યા રે,  
તે સાવે છે સુજ ચિત્તમાં હિ કુડી કુમતિ. તવ (૨૭)

શું કથેં હો પુઠ નવિ ઝેરવે રે,  
તો પણ સુજ મન દ્યા થાય કુડી કુમતિ,  
તો હે દેશના હો હું તો બહુ કરું રે,  
બે આવે મારો લાગ કુડી કુમતિ. તવ (૨૮)

તો ચૈતનણને હો બહુ ચેરે પ્રીષ્ઠલું રે,  
તેહને બતાવું સ્થિર વાસ કુડી કુમતિ,  
તે તો તારે હો ફરીવાર વસ નવિ પડે રે,  
તને વોસરાવી શિવ જાય કુડી કુમતિ. તવ (૨૯)

ધર્મ રાયની હો જે આણ્યા અનુસરે રે,  
તિહાં તુજ નહિ પ્રચાર કુડી કુમતિ,  
આનન્દ ધન હો પછ તે વરે રે,  
થાય શિવ સુંદરી ભરતાર કુડી કુમતિ. તવ (૩૦)

\*

નમો પણોડિય-મોહ-જાલસ્સ, ગુણગાહિઅસ્સ  
સિરિ બદ્ધમાણસામિસ્સ સંસાર-પાર-ગામિઅસ્સ

અદ્ભુત ચંરણુ કમળ નભી, સરસ્વતી સ્મરી માત,  
પાંત્રીસ બોલ પ્રેમે ધરો, મારગ સુખ વિખ્યાત. ૧

૧ નીતિથી ધન સંશેષો, ૨ શિષ્ટાચાર મન લાવ,  
 ૩ સમકુલ અન્ય જૌત્રની, સાથે વિવાહ ઠાવ. ૨  
 ૪ વત્તો દેશા—આરથી, ૫ પાય કર્મ લય ધાર,  
 ૬ અવર્ધુ—વાદને ટાળવા ઉધમ કરેા સુખકાર. ૩  
 ૭ પાડોસી પ્રેમી જનો, ધણ્ણા દ્વાર ધર વાર,  
 અતિ ગુમ અતિ પ્રગટ પણું, ધર ભલું નહિ સાર. ૪  
 ૮ સદાચારી સોખત ભળી, ૯ માત તાત મન ધાર,  
 વિનય કરેા માત તાતનો, શુણ લળો મનોહાર. ૫  
 ૧૦ ઉપદ્રવ સ્થાનક ટાળીને, વાસ કરેા ગુણુ-કાર,  
 ૧૧ નિંહિત કાર્ય કરવું નહિ, ગુણુ ભળો એ સાર. ૬  
 ૧૨ આવક હેખી વ્યય કરેા, ૧૩ ધન અનુસ રે વેષ,  
 ૧૪-(૧) આડ ગુણુ યુદ્ધ તણું ૧૫ ધર્મ સાંભળ વિશેષ. ૭  
 ૧૬ પ્રથમ ઓરાક પચ્ચા પછી, લોજન કરને લાઈ,  
 ૧૭ ભૂખ ભળેરી લાગતા, લોજનની ન મનાઈ. ૮  
 ૧૮ ધર્મ અર્થ કામ સાધવા, ઉધમ કર નિત્યમેવ,  
 ૧૯ અતિથિનો આદર કરી, દીનની કરને સેવ. ૯  
 ૨૦(૨) અલિ-નિવેષ રહિત થલું, ૨૧ ગુણી જનનો પક્ષકાર,  
 ૨૨ નિષિદ્ધ દેશ-કાળ ટાળીને, ૨૩ શક્તિ સમ કાર્ય ધાર ૧૦  
 ૨૪ ચોષણુ ચોષણે ચોષને, ૨૫ વૃદ્ધજન વિનય સાંભળ.  
 ૨૬ દીર્ઘ-દર્શીર૭-૩ અધિકજાનધર, ૨૮ કૃતજ્ઞઅનન્દોભાળ ૧૧

(૧) ૧સાંભળવાના ઈચ્છા, ૨ સાંભળવું, ઉસાંભળેલું યાદ રાખવું,  
 ૪ અર્થ સાંભળવો, 'પશ' કા કરવી, ૬ સમાધાન મેલવવું, ૭ સમાધાનથી  
 નિઃશંક બનવું, ૮ નિશ્ચય કરવો. (૨) કોઈને પરાલવ પમાડવાની  
 યુદ્ધએ અનીતિ આચરવી નહિ (૩) વિશેષજ્ઞ

૨૬ લોછપ્રિય ૩૦ લજાલજુતા, ૩૧ દ્યાળુ હુઃખ નિવાર,  
૩૨ સુંદર આકૃતિ સૌભ્યગુણ, ૩૩ પરેપકાર મન ધાર. ૧૨  
૩૪ અંતરંગ શરૂ જય કરી, ૩૫ વશકરો ધંદ્રિય આમ,  
પાંત્રીસ ગુણ પ્રેમે વરી, અનન્તે શુષ્ટું ધામ. ૧૩  
અલ્યાસ અથે આઈં, હુહા ચઉદ બહુ-માન,  
સરખાનન્દ વરવા લણી, કૃપા કરો લગવાન. ૧૪

\*

## સ્નૂકંત અઠકમુ કુહાડાનો લખ

કુહાડાનું ગાડુ જોઇ જાડ સહુ કર્યા ધખા,  
વૃદ્ધ વૃદ્ધે કંધું સહુને કેમ થાએ છો દ્વારાખા;  
તમારામાંથી જો ન થાએ હાથો શું કરશો કુર્જના,  
શાંતિ પકડી મૌન સેવો જાંચ એ ખાતા ચખા. ૧

## કુર્જન સંજગન ન થાય

કુર્જનને સંજગન કરવા સમરથ ન કો જગતમાં,  
કુર્જન જો સંજગન થાએ આકાશ પુણિત વિગતમાં;  
પુઠને સો વાર ધોએ પવિત્ર ન થાએ કઢા,  
કુર્જનને સંજગન કર જો મહિમા વાધે જગે તદા. ૨

## ચંડાળ કોણુ કહેવાય

દ્વરથી આવેલ મહેમાન માર્ગ ચાલી થાકેલ જે,  
ધર આંગણુ આવેલ કોઇ અલ્યાગત અતિથિ જે;  
આવેલનું સંમાન કરી જમતો ગૃહસ્થાચારી એ,  
સંમાન કર્યા વિના જો જમે ચંડાળ શાસ્ત્રે કથી તે. ૩

આતમજ્ઞાન વિનાનું ખંડુ જ્ઞાન ફોક છે  
થારે વેહો સુખાષુ તો તે પંડિત પંડિત જગ કહે,  
ધર્મ શાસ્ત્ર જાણ્યા સધળા તત્ત્વજ્ઞાન ન હૃદિ લહે;  
આત્માને જાણ્યા વિનાનું સર્વે જાહેરું ફોક એ,  
પાક ધંટમાં ડાયો રહેતો સ્વાદ પામે કહો કેમ તે. ૩

### ખર્દં સુખ કયું ?

તન મન ને ધન ભર્યાં વળી પુત્ર પરિવાર જે,  
અથ લાવ કરતી સામી ઢારા ઘોલે મીળ ઘોલ તે;  
પુરુગલાનની સુખ માને જાણે ઉત્તરું સ્વર્ગ એ,  
પણ સતોપામૃત સુખ વિના જાહેરું સર્વે દુઃખ તે. ૪

### નરકે શાથી જવાય ?

નોંધી જર્તિને ક્રબ્ય દેતાં તાંખુલ અદ્ધ્યારિને,  
ચોરને જે અભય દ્ધયે જાએ નરકે નિર્ધારિને;  
વ્યવહાર ને રાજનીતિ કહે છે કહે શાસ્ત્રો પાકારીને,  
નોંધી જર્તિ જે થાએ પ્રમાણી અદ્ધ્ય ચોર રહે વંઠીને. ૫

### જૈન ધર્મ શાથી કહેવાય ?

સ્યાદ્વાહે વસ્તુસ્થાનિ વિચારે પક્ષપાતની નહિ વાત રે,  
પરપીડા કદી મને ન ધારે જૈન ધર્મ ગુણ વિખ્યાત રે,  
ધ્યામય ખરો ધર્મ માની ધરતો ધ્યાનું ધ્યાન રે,  
જન્તુ ધતના કરતો નિતનિત એ આગમ કેરે જ્ઞાન રે. ૬

### કેણુ હાસ્યપાત્ર ગણ્યાય ?

શક્તિ વિનાનો થાએ સાધુ રહે ન તેની લાજ રે,  
નારી ન મળતાં થથા અદ્ધ્યારી એ પણ એવું જ કાજ રે;  
શરીર થાકે બતી પતિત્રતા લોક કેની લાજે રે,  
વ્યાધિ પીડિત દેવ પૂજે ખુટ્યું ખરે અનાજ રે. ૮

સ્થયિતા-મુની ચંપકુસાગરણી મહારાજ.

ઇતિ સ્વાધ્યાય વિલાય.

ॐ अर्हनमः

“ॐ हौं श्रीं श्रीं शांखेश्वरं पार्वताथाय नमः”  
आत्म साधनामां उपयोगी एकत्रीश (उ१)  
બोक्तुं वर्णन.

મંગળ

પ્રશાન્ત શક્તિ પોતાય, પ્રકાંડ જ્ઞાન ધારિણે ।  
નમોસ્તુ તે ભજાવીર, જા-ગુણ-ગાણ હેતવે ॥ ૧ ॥  
દીક્ષાં શિક્ષાં પ્રદાતારાં, ગુણનિધિં ગણુનિંપમ ।  
નમસ્કૃત્ય પ્રવલ્લયામિ, સિદ્ધ સંખ્યા ગુણકમમ ॥ ૨ ॥

પહેલે બોલે પાંચ સુખોનો વિચાર :- મનનિઅહ-  
નિરોગી દેહ નિરૂપાધિક જીવન-જન્મરહિત પણું - મરણરહિત  
પણું. મનનો નિયંત્ર બહુ હુંકર છે પણું એક વિષયમાં  
વારંવાર મન ચોંટાડયાથી ધીરે ધીરે મનનો નિયંત્ર થાય  
છે. પણું જે વિષયમાં મન ચોંટાડવું હોય છે તે વિષય  
પ્રશાન્ત કર્યાણુકૃત હોવે. જેઠાં નહિતર અલામાંથી બદામાં  
પડવા જેવું થશે. નિરોગી દેહ-રોગીઓની સેવા અને પદ્ય  
આહાર તથા ઋતુ અનુકૃત ચર્ચા રાખવાથી પ્રાપ્ત થાય  
છે. ‘નિરૂપાધિક જીવન’ - જેટલા અંશો ત્યાગ માર્ગ સ્વીકા-  
રાશો તેટલા અંશો ઉપાધિ એછી થશે. નિશ્ચયથી જ્ઞાનપૂર્વકને.  
ત્યાગ એજ નિરૂપાધિક જીવન છે. ‘જન્મરહિત પણું’ - તદુ  
ભવ મોક્ષગામી અથવા સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે.  
તે પણું સર્વજ્ઞ લગવંતોએ કીધેલા માર્ગનું હોવું જેઠાં  
નહિતર લૌકિક સિદ્ધ અવસ્થા પુનઃ જન્મનું કારણ બને છે.  
‘મરણરહિત પણું’ - સિદ્ધપ્રદમાં પ્રાપ્ત થાય છે. એ પાંચે  
સુખોનો અનુભવ કરનારજ ઈહિલોક અને પરલોકમાં સુખી છે.

ખીજા બોલે પાંચ હુઃઘોનો વિચાર :—આધિ—વ્યાધિ—  
ઉપાધિ—જન્મ અને મરણ. ‘આધિ—માનસિક ચિન્તા ને  
આતો રૌદ્રધ્યાન રૂપે હોય છે. પણ કલ્યાણુત્મક ચિન્તા એ  
આધિઝીપે ગણુંતી નથી. “વ્યાધિ—શરીર સંબંધી જવરાદિક  
રોગો, તે અળણુંદિના કારણુંથી અથવા કર્મજન્ય પણ હોય  
છે. અળણુંદિથી ઉત્પન્ન થયેલ રોગ ઔષધાદિકથી મટે છે.  
અને કર્મજન્ય રોગ—તપ—પ્રાયશ્ક્રિતાદિકથી મટે છે. ‘ઉપાધિ’  
“બહુ વણું બહુ બેઠીયાં, દોનારી લરતાર, ઉનકું કયા તો  
મારનાં, માર દીયા કીરતાર.” આ ઉપરથી સમજશે કે—ધર—  
વ્યાપાર—દારા—પુત્ર—પુત્રી—સગા—સનેહી વિગેરે ઉપાધિ ઇપ છે.  
એકના લગ્નમાં જઈ આયા તો ખીજાની મેડાણે જવાનું  
તેડુ આંધું છે તે પતાંધું તો માંદાને જેવા જવાનું ઉલ્લુ  
છે. તે પતાંધું તો ધરમાં કન્યા મોટી થઈ છે કયાં  
આપીશું. આજે મુરતીયા બહુ મોંધા થયા છે. હે પ્રલો  
હવે શું કરું. આ ઉપાધિ કયાં મૂકું પ્રલુ કહે છે ઉપાધિ  
ત્યાગીને સંયમી બન્યા છે તે સુખી થયા છે. અને ઉપાધિ  
ત્યાગી સંયમી બને છે તે સુખી થાય છે. ‘જન્મદૃપ હુઃખ  
કેવળી થયા પછી ફરી જન્મ લેવો પડતો નથી માટે સદાએ  
જાન આરાધના કરવી. “મરણ હુઃખ—ચરમ—છેવટના મરણ  
પછી સિદ્ધ વધુ વરે છે. પછી મરણનું હુઃખ હોતું નથી.  
માટે નમો સિદ્ધાણુંનો વિશેષ વિશેષ જાપ કરવો..

ત્રીજા બોલે ઉપરોક્ત પાંચ હુઃઘો આવવાના  
કારણું ભતાવાય છે :—“મજજ વિસય કસાયા, નિદા  
વિગહા પંચમી ભળિયા ॥ એ એ પંચ પમાયા, જોવ પાડંતિ  
સંસારે. ॥ મહ—વિષય—કષાય—નિદ્રા અને વિકથા એ પાંચે  
પ્રમાદો જીવને સંસારમાં હુઃખ ઢેનારા છે. મહના આઠ

પ્રકાર છે. તે આ પ્રમાણે-જતિ-વાલ-કુલ-ખત-તપ-વિધા-  
એંસ્થીય્ અને તૃપ એ આઠે જૌતિક સુખોની પ્રાપ્તિથી જીવ  
અભિમાન કરે તો તેનાથી ઉત્તરોત્તર હીનતાને પામે છે.  
વળી પાંચ પ્રકારના પંચનિર્દ્યોના પાંચ વિષયોના ઉત્તર બેદ  
ત્રૈવીશ થાય છે તેમાં આત્મા લીન બની જય અને પરો-  
પ્રકારાદિક ધર્મ કાર્યો ન કરે તો જવાંતરમાં જીવ નરકાદિ  
ગતિમાં મહા હુઃખ પામે છે. વળી ફોધાદિ ચાર કષાયો-  
તેના ઉત્તર બેદ સોલ અને નવ નોકષાયને આધીન થઇને  
જીવ આ જરૂર પરલખમાં મહાહુઃખ પામે છે. વળી ચાર  
વિકથા-હેશકથા-રાજકથા-લોજનકથા અને સ્વીકથા કરે,  
હેશ કથામાં હેશનું વર્ણન, રાજકથામાં રાજ્યનું કે રાજનું  
વર્ણન અને લોજન કથામાં લોજનનું વર્ણન અને સ્વી  
કથામાં સ્વીઓનું વર્ણન કરે, એવી રીતે વિકથા કરતાં  
પોતાના આત્મ સાધનનો સમય નકામો જતો હોવાથી જીવ  
આત્મ સાંચના કર્યા વિનાનો સંસારમાં રજો છે. વળી  
નિદ્રા-મોક્ષ માર્ગની અર્ગલા છે. નિદ્રાને આધીન થએકો  
જીવ ઈહ લોકમાં અને પરલોકમાં પોતાનું સુખનું સાધન  
જીવનધન તથા દ્રોયધન ગુમાવી હુઃખી હુઃખી થાય છે. એ  
પાંચે પ્રમાણે હુઃખના કારણું જાણી જીવે પ્રમાણોને છોડવા  
ઉધમ કરવો જોઈએ. તોજ જવ સંતતિનો અંત લાવી શકાય.

ચોથા બોડે માર્ગનુસારીના પાંત્રીસ ગુણોનું  
વર્ણન કરાય છે :-(૧) ન્યાયથી ધનની પ્રાપ્તિ કરવી.  
(૨) સદાયારીની પ્રશંસા કરવી. (૩) સરખા શીલ-કુલવાળા  
એવા અન્ય ગોત્રીની સાથે લગ્ન વ્યવહાર કરવો. (૪)  
પાપનો જય રાખવો, (૫) સ્વહેશાચાર પ્રમાણે વર્તન રાખવું.  
(૬) રાજાદિક કોઈ વ્યક્તિઓની નિંદા ન કરવી. (૭) અતિ-

ગુપ્ત કે અતિ જાહેર તથા ધણ્ણા બારી બારણ્ણાવાળું અને ખરાખ પાડેશીઓવાળું ધર રાખવું નહિ. (૮) સદાચારી ઓનો સંગ કરવો. (૯) વડિલ મા બાપ વિગેરેનું કહ્યું કરવું. (બહુમાન કરવું.) (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવો. (૧૧) નિનિદ્રિત કાર્યનો ત્યાગ કરવો. (૧૨) આવક પ્રમાણે ખર્ચ રાખવો. (૧૩) ધ્યન અનુસાર વેષ વિભુષા કરવી. (૧૪) ખુદ્ધિના આઠગુણોનું ધારણું કરવું. (૧૫) નિત્યધર્મ સાંલદાવો. (૧૬) અજ્ઞાનું લોજ્જનનો ત્યાગ કરવો. (૧૭) ખરાખર લૂખ લાગતા સાત્ત્વિક લોજ્જન કરવું. (૧૮) પરસ્પર વિરોધ રહીત ધર્મ-અર્થ અને કામની સાધના કરવી (૧૯) અતિથિ-મુનિ-દીન હુંમી જનનો આદર સત્કાર કરવો. (૨૦) સદા અનલિવેશિતા-અકદાયકી થવું. (૨૧) ગુણી જનનો પક્ષ કરવે. (૨૨) વર્જિત દેશકાળમાં પ્રવૃત્તિ ન કરવી. (૨૩) સ્વશક્તિ અનુસાર કાર્યઆરંભવું. (૨૪) પોષણ યોગ્યને પોષવા. (૨૫) જ્ઞાનવૃદ્ધ-તપોવૃદ્ધ વયવૃદ્ધ-વૃતવૃદ્ધ જનોની સેવા સુશ્રૂષા વિનય કરવો. (૨૬) દીઘદિષ્ટ-ઉંડુ વિચારીને કાર્ય કરવું. (૨૭) વિશેષ જ્ઞાનવાળા થવું. (૨૮) કૃતજ્ઞ થવું. (૨૯) લોક પ્રિય બનવું. (૩૦) લજ્જાળું બનવું. (૩૧) દ્યાળું થવું. (૩૨) સુંદર-સૌભ્ય આકૃતિ રાખવી. (૩૩) યથાશક્તિ પરોપકાર. (૩૪) અંતરંગ શરૂનો જય કરવો. (૩૫) ધર્મન્દ્રય આમને વશ કરવો.

**શ્રીમાર્ગનુસારી દ્વારા સામાન્ય ધર્મ પણ કેને હેવાય ?**

શ્રીમાર્ગનુસારીદ્વારા સામાન્ય ધર્મ પણ યોગ્ય સુપાત્રને હેવાય, કારણુંકે અયોગ્યને હેતાં ઉલટો ધર્મ બજવાય માટે કહ્યું છે કે “**જ્ઞાગજ્ઞિયાણ દાયવતો ધર્મ રસિયાણ**” ધર્મ

રસિક એવા યોગ્ય જીવનેજ આપવો અન્યને નહિ કારણું દ્વારાંતર્થી ભતાવાય છે.

“ ગજલ ” આંભાના અંકુર ખાવાથી, મધુર કેાડિલા લવતી સવાદે જે કાગડો સાકર, મધુરતા નહિ એને ખપતી ૧ યોગ્યને ધર્મ દેવાએ, સક્રિયતા શીખથી પામે, અયોગ્યને ધર્મ જે દેતાં જરૂર તે ધર્મ નિંદાએ. ૨

વળી જળ અને તેલતું લોઢું અને અગિનતું, હુધ અને સિદ્ધરસનું દ્વારાંત દેખાડે છે.

### “ હુણા ”

જળમાં તેલ હુણે નહિ, તરતું દેખે સર્વ;  
લોઢું આગ એક થાય છે, ઠરતા મૂકે ગર્વ. ૧  
પાણી હુધ લેગા મળો, જે ન આવે હંસ,  
આવે જે ત્યાં હંસલો, તો ન રહે હૃદનો વંશ. ૨  
સિદ્ધરસ લોઢું મળો, તો થાચે કંચન યોગ્ય;  
ફરી છુટા પહૃતા નથી, આવે સહુને લોગ્ય; ૩

ઉપરોક્ત પાણીમાં જેમ તેલ હુણતું નથી તેમ અપાત્રમાં ધર્મ ઠરતો નથી. અગિનને લોઢું જેમ એક થઈ જાય છે પણ હવા લાગતા જુદા પડે છે, તેમ અયોગ્ય માનવી જે ધર્મ અહંકૃતું કરે પણ મૌહના ઉદ્યે મૂકી હે છે, પાણીને હુધ એકમેક થઈ જાય છે, પણ અતુર એવા હંસથી જુદા પડે છે, તેમ અદ્રિક જીવમાં ધર્મ લાવના જાગે અને ધર્મ અહંકૃતું પણ કરે, પણ કોઈક ઉંડા ભણુાવનાર મળો તો છોડી પણ હે. સિદ્ધરસ અને લોઢું ભળવાથી સોનું બની જાય પછી કોઈ કાળે લોઢું બને નહિ તેમ યોગ્ય પાત્ર ધર્મ પાર્યા પછી પ્રાણુંતે પણ ધર્મ છોડે નહિ, જેમકે—“રદ્ધુકુલ રીત સહા ચલી આઇ; પ્રાણું જાયે પણ પ્રીત ન જાઇ” વિનિષેર તેમ કાગડા અને કોયલતું પણ સમજવું.

ધર્મ કેટલા પ્રકારનો છે? ઉત્તર. ધર્મ એ પ્રકારનો છે, સામાન્ય અને વિશેષ સામાન્ય માર્ગનુસારીના પાંત્રીસ ગુણ અને વિશેષ. સમ્યકૃતવભૂતાદિક-હેશ વિરતી, અને સર્વ વિરતીઝપ એમ ધર્મ એ પ્રકારે છે 'જેમ ભીતને ઘોષ્યા વિના ચિત્રામણુદિ શોલે નહિ, તેમ સામાન્ય ધર્મ પાણ્યા વિના વિશેષ ધર્મ પાળી શકે નહિ જેથી માર્ગનુસારી ગુણોને સારી રીતે સમજવા જોઈએ પછી યથા શક્તિ આચરણમાં ભૂકવા જોઈએ તો આ આત્મા કંઈક માનવ લવમાં આવીને કંઈક પામી ગયો ગણ્યાય.

૧. ન્યાય સમગ્ર વિભવ :—સ્વામિદ્રોહ-મિત્રદ્રોહ-વિશ્વાસ-ધાત સાત પ્રકારની ચોરી અને નિંદનીય વ્યાપારાદિને ત્યાગીને ધન રળવું જોઈએ વળી અસત્ય બોલી સ્થાપણ ઓળવવી, ઓછું આપવું, વધારે લેવું, પુર માપવું, ઓછું ફાડવું જુની નવી વસ્તુ લોગી કરવી, નમુનો હેખાડવો જુહો માલ આપવો જુહો વ્યાજ વધારે ગણ્યીને લેવું, ઓટા ખત લખવા, દાણ ચોરવું કોઈને લય બતાવી ધન પડાવવું, લાંચ લઈ કાર્ય કરવું વિગેર અન્ય યથી દ્રવ્ય મેળવી માનવી સુખી થવા ચાહે છે; તે જહેર ખાઈને જીવવા છન્હે છે. અથવા ખુદી વધારવા ઢાંનું સેવન કરે છે માટે ઉપરોક્ત કહેલા હોખ વળું દ્રવ્ય મેળવનાર અહિં અને પરલોકમાં સુખી થાય છે. વળી ન્યાયનું દ્રવ્ય સુપાત્રમાં વાપરે તો પુણ્યાનુભંધુ પુણ્ય પ્રાપ્ત કરે છે તેની ચતુર્ભાગી બતાવી છે ૧. ન્યાય દ્રોય સુપાત્રમાં વાપરે, ૨. ન્યાય દ્રોય કુપાત્રમાં વાપરે તુ અન્યાય દ્રવ્ય સુપાત્રમાં વાપરે ૪. અન્યાય દ્રવ્ય કુપાત્રમાં વાપરે પહેલા ભાંગાનું ફળ હેવ મનુષ્યાદિકના સુખો લોગવી કર્મક્ષય કરી મોક્ષે જનાર થાય છે, જીળ

ભાગનું કુળ દેવાહિકના સુખો લોગવી મીહિત બની  
સ સારમાં રજુણે છે

ત્રીજ ભાગનું કુળ સુગુરુનો ચોગ મજબૂતી હોખો જાણી  
ફર કરી સદાચારી બને છે. ચોથા ભાગનું કુળ આસવ-પર-  
ભવમાં હુઃખી થાય છે. એ ઉપર દાંટાંતો નંદિષેષુ સેચનક  
હાથી હેતાક શોઠ આદિ બીજેથી જેઈ દેવા.

તેમજ ન્યાયવંત વ્યક્તિએ દેવદ્રોય ગુરુક્રદ્ય જ્ઞાન દ્રોય  
અને સાધારણુ દ્રોયાદિ વડે વ્યાપાર ખેડવો નહિ તેમ વ્યાજુ  
લેવું નહિ, કોઈને વ્યાજુ આપવું નહિ, આરંભ સમારંભ  
વાળા કામો મજાન બાંધી લાડે આપવા વિગેરેમાં રેકી  
તેનું વલતર લધ વૃદ્ધિ કરવી નહિ પણ યથાશક્તિ સ્વ-  
દ્રોયથી પ્રણાલિકા પ્રમાણે બોલી બોલી અથવા ખરડામાં  
લખાવી વૃદ્ધિ કરવી. ટારણુ કે સમારંભ એ અધર્મ છે.  
અધર્મમાં ધર્મદ્રોયનો ઉપયોગ કરતા આણુ લંગનો હોખ  
આવે અને આજા એજ મોક્ષનું સાધન છે. ધર્મદ્રોયને  
સંલાણી રાખવું અને યથા સ્થાને વાપરવું એજ ધર્મી  
આત્માની કુરજ છે. તેને માટે શાખમાં ગૃહસ્થોને તીથ-  
કરાદિ પદવી વિગેરેનું પુણ્ય બતાઓયું છે. માટે ગૃહસ્થોને  
દ્રોય એ જરૂરી સાધન છે કહું છે કે ગૃહસ્થની પાસે કોડી  
ન હોય તો ગૃહસ્થ કોડીનો અને સાધુ પાસે કોડી હોય  
તો સાધુ કોડીનો માટે દ્રોય સંશ્રહ એ ગૃહસ્થનું ભૂખણુ  
છે તેથી ન્યાયથી દ્રોય સંશ્રહવાળા થવું ઈતિ પ્રથમ ગુણુ.

૨. શિષ્ટાચાર પ્રશંસા-જે શિષ્ટ પુરુષો ઉત્તમ ગુણ-  
વાન પુરુષો તેમનો આત્મા સદાએ આનંદિત હોય છે તેમના  
ખીજાએ આગળ વખાણુ કરે, તેમની નિશ્ચાએ રહી પોતાનું  
આચરણ સુંદર બનાવે; વધારે શું કહીએ તેમની નિનદા

દેખ ઈર્યાથી સદા હર રહે તેજ અહેનિશ સુખી થાય છે.  
ખાકી પાણી વડોવતાં જેમ માખણું ન મળે તેમ તેમના  
અવગુણું ધીજ આગળ ગાવાથી સુર્ય સામી ધુળ ઉડાવવા  
જેવું થાય છે.

૩. કુલશીલથી સમ અન્ય ગોત્રીસહ લગ્ન કરવા-  
જેની સાથે લગ્ન અંથિથી જોડાવું હોય, લારે કન્યાએ વરના  
કુલ શીલ ગોત્ર જેવું અને પુરુષે કન્યાના અથવા ખોના  
કુલ શીલ રૂપ સ્વભાવ ગોત્રાદિ જેવાં કારણું કે ખીથી  
વંશપરંપરા ચાલવાની છે માટે ઘેરી બકરી યા લેંશ પણ  
જેઠ તપાસીને ખરીદ કરીએ છીએ તો પછી જેની સાથે  
જંદગીની જવાબદારી રહી છે ત્યાં જેવામાં ભૂલ કરે તો  
ભૂલના લોગમાં બન્નેનો સંસાર બગડે છે

પુરુષ કેવો હોવો જોઈએ-મધ્ય માંસાદિક ત્યાગવા  
ચોણ્ય, પદાર્થોનો ત્યાગી હોય, નિર્યસની કુલમાં ઉત્પજ્ઞ  
થયેલ હોય, દેવગુરુધર્મનો આરાધક હોય, બુદ્ધિવાન  
નિરાલસુ વિનયવાન વિત્તવાન કાર્ય કુશલાદિ ગુણું ખુક્તા  
અન્યગોત્રી હોય તેવા પુરુષની સાથે કન્યાએ સંબંધ જોડવો  
વળી મીાક્ષાર્થી ઢીક્ષાર્થી શૂરવીર લડવૈયો, હર રહેતો હોય  
તો અને વિકલેનિદ્રય નરનો ત્યાગ કરવો જોઈએ.

કેવા જનના કન્યા ન લેવી-દેવગુરુનો નિનંદક હોય,  
ધર્મને ધતીર્ગ કહેતો હોય, બુગારી હોય, લોક વિરુદ્ધ,  
રાજ વિરુદ્ધ વર્તતો હોય કન્યાના દ્રગ્યથીજ જીવન ગાળવા  
ઇચ્છતો હોય, તેવાની કન્યા લેવાથી પ્રારંધમાં પથરો  
નાંખવા જેવું ખને છે

કન્યા કેવી હોવી જોઈએ-સામુદ્રિક લક્ષણે લક્ષિત  
હોય, વંદ્યાદિ દ્વાર ર્વિક્ત હોય, ચોતાથી એ નણું વખેં

નાની હોય, વિનયવતી, લજણનું. પ્રસત્ત મનવાળી, વિધાન્યસની. કાર્યદક્ષા, પ્રિયબોલી અને પ્રીતિદાલિજીગોત્રી એવી કૃયા સાથે સંબંધ બાંધવાથી નર નાગરિક-સુખી બને છે.

**૪. પાપનો ડરઃ-** ધૂત (જુગાર રમણું) માંસ ખાવું-સુરા પીવી, વેશ્યાગમન, શિકાર જેલવો, ચારી કરવી, પરસ્તીગમનાંદ કુત્થોથી ઘોર એવા નરકમાં જીવ પડે છે. વળી અસત્ય, અતિલોલ, કોધ, માન, માયા, ધર્ષા, નિંદા આળ હેવું વિગેરે પાચોથી માનવ આ લોકમાં પણ હલકો પડે છે. અને પરલોકમાં હૃગ્રત્યાદિ મહા ગર્તમાં પડે છે. જે માનવ પાપથી ઢુંજે છે પોતાના પાપને નિંહે છે તે પાપ કરતો હોવા છતાં અદ્ય કર્મનો બંધ કરે છે અને જે માનવને પાપ કાર્યનો પ્રસંગ જ ન હોવા છતાં પણ પાપ કાયને પ્રશંસે છે તે પાપ કર્મ-અશુલ કર્મથી લેપાય છે. માટે પાપલીર થવું.

**૫. ચોંઘ દેશાચારનું પાલનઃ-** જે દેશમાં રાજ્યે સફાચાર માટે જે નિતિ ધરી હોય તે પ્રમાણે ચાલવું. જે વ્યવહારીઓથી જે દેશમાં નીતિ ચોંઘ જે વ્યવહાર ચાલતો હોય તે રહે ચાલવું. જે દેશના હવા પાણી વિરુદ્ધ ઓરાક પાણી ન વેવા, વિરુદ્ધ વિખાદિક ધારણ ન કરવા જે ચોંઘ દેશાચારનું પાલન કરે છે તે પ્રજા-સુશીલ જણ્યાય છે.

**૬. કૈદીના અવણ્ણીવાદ ન ખોલવાઃ-** “નિંદા પરની જે કરે, કુઠા દેવે આળ; મર્મ પ્રકશે પરતણો, તેથી ભલેા ચંડાળું” પરની નિંદા કરવાથી જીવ પરશવમાં કંઠરોગ, તોતડાપણું, નિભાગીપણું વિગેરે અનેક ફુઃખનો લોકતા થાય છે. જે વળી રાબ્દિકની તો નિંદા કરવાથી ઈહલોકમાં

પણ ધણી કદર્થના થાય છે. જે માનવ કોઈની નિંદા કરતો નથી તે લોકમાં આદરણીય ગણ્યાય છે.

૭. અતિ ગુમ કે અતિ જહેર વાળી જગ્યા કે ધણ્યા દ્વાર વાળું ધર વર્જિનું તથા સારા પાડોશવાળું ધર રાખવું વા કરવું:- અતિ ગુમવાળા ધરમાં રહેવાથી અભિન. અથવા ચૌરાઢિક આદૃત વખતે કોઈ આપણે અવાજ સાંભળે નહિ. તેમજ અતિ પ્રગટ રોડ-માર્ગ પરના ધરમાં રહેવાથી એન, દીકરી, વહુ આદિનું સંયમ સાચવવામાં સુશીબત પડે તથા અતિ માલેતુન હોય તો ચોરધાડ આદિનો પણ લય રહે છે. વળી ધણ્યા દ્વારવાળા ધરમાં પણ જર પુરુષ તથા ચોર આદિનો લય રહે છે વળી ખરાબ પાડોસવાળાની પાસે રહેવાથી આપણે પણ તેના જેવા થવાનો લય રહે છે. તથા કળ્યા-કંકાસવાળા હોય તો જીવને અશાંતિ રહ્યા કરે માટે સરળ અને સમલાખી તથા સાધર્મિક હોય તો વધારે સારું. એવા ધરમાં રહેનારા હુંએ થતા નથી, “કહ્યું છે કે-નાટ લાંડ ને જર્બેયા, નાટ વેશ્યાદિક વળી ચંડાળ માછી ને કસાઈ, વ્યાધ લીલ ને વાધરી, કુકર્મકારી ને જુગારી, વેશધારી બિસુકો, એવો નહિ પડોશ સારો, ત્યાં વસે નહિ ધાર્મિકો.” ૧

૮. સદ્ગારીનો સંગ કરવો:- હશ દણાંતે ફુર્લાલ એવો માનવસવ મહા સુરક્ષેત્રીએ મળ્યો છે. તો સત્સંગ કરી સદ્ગારી જીવન ઉજ્જવલ કરવા પ્રયત્ન કરવો. જે સત્પુરુષ સદાએ હિંસા, જુઠ, ચોરી, વ્યાલિચાર, અતિ પરિશ્રહ, કોધ, માન, માયા, લોલ, રાગ-દ્રેષ, કલહ, આણદેવું. ચાડી ખાવી. હર્ષરોક કરવો, પરનિંદા કરવી, કપૃથી જુઠાને સાચું કરી બતાવવું અને આત્મા વિષેની અજ્ઞાનતારૂપે એ-

આદરે પાપોને ત્યાગવાની નિત્ય લાવના લાવતો હોય છે. તથા યથાશક્તિએ ત્યાગ પણ કરતો હોય એવા સજજનની સોબત કરવી. જેમ ચોપણના એ બચ્ચાઓનું દષ્ટાંત છે કે “સંગનો રંગ લાગ્યો” તેમાંથી એક બચ્ચું લીલ પાસે રહ્યું તે દુર્ઘણી થયું. અને બીજું બચ્ચું મુનિ પાસે રહ્યું તે સદ્ગુણી થયું. માટે જ સત્સંગીની સોબત લલી.

૬. માત, તાત તથા વૃદ્ધજનો વિનય કરવો:-જે માનવો માત પિતાને તથા વૃદ્ધજનોને પ્રાતઃકાળે પગે લાગે છે. તેનો દ્વિવસ ધર્ણો સારો જાય છે. વળી માતા-પિતા ગમે તેટલા હું શીલ હોય તો પણ પુત્ર-સંતાન માટે સદાએ તીર્થિંપ છે. વળી જે માનવ માત-તાતની આશિષ વઈને પગલું લરે છે. તે કોઈ કામમાં પાછો પડતો નથી. કહ્યું છે કે—“અરી જુએ કાંદી લાવતો, પણ મા જુએ સુત આવતો, નિઃસ્વાર્થ પંપાળતો એ, મારી હાથ મન લાવતો, દુનિયા દુર્ઘણી કેતી પુકારે, માત હૈથું હુચમચે, એવી માતના ગુણું ગાએઓ જેટલા હૃદય થૈ થૈ કરી નચે.” ૧

૧૦. નિરૂપદ્રવદાળા સ્થાનકે રહેણું:-જ્યાં પરચકનો વારંવાર ઉપદ્રવ થતો હોય, વળી રાજ ચોતે અતિ લોલી હોય, યા વ્યાલિયારી હોય વળી જે સ્થાનમાં ગામ-મુખી અથવા અમલદાર કે આગેવાન શેઠીયાઓનો રંઝાં-એટલે શોરનેરી કે શુંડાંગીરી કરતા હોય, એવા સ્થાનને શાંતિના અલિલાખુએ વજંતું. જ્યાં રાજ ન્યાયી, નિરોભી, કાર્ય-કાર્યનો બાધુકાર હોય. બાકી વર્ગ પણ હિત સાધક હોય, પરનું બલું ઇચ્છિતો હોય તેવા સ્થાનકે સુખાલિલાખીએ રહેણું.

૧૧. નિર્દિષ્ટ કાર્ય કરવું નહિઃ—રાજનીતિ, વ્યવહાર-નીતિ, ધર્મનીતિ, એ તરણે નીતિથી વિરુદ્ધ વત્તંતું નહિ.

યતઃ “નિંદ્ય પ્રવૃત્તિ આચરે જો, કુળ પછી શા કામતું ? ઉત્તમ પ્રવૃત્તિ આચરે જો, કુળ પછી શા કામતું ? નિંદ્ય પ્રવૃત્તિ જો તજે તો, કુળ રક્ત વખણાય છે, ધર્મપાત્ર થઈ આત્મ, લાલ મોટો લેવાય છે ?”

રાજનીતિ-રાજ્યે કરેલા કાતુનો. વ્યવહારનીતિ-મંડળે અથવા સંસ્કૃતાએ કરેલા કાયદાઓ. ધર્મનીતિ, ગુરુની આજ્ઞા પાણવી. જે માણુસ એ ત્રણે નીતિમાંથી કોઈપણ નીતિનું ઉલ્લંઘન કરે છે, તે માનવતાને નેવે ભૂકે છે. યતઃ “મનુષ્ય હોના મુસ્કેલ હૈ, સાધ કહાં સે હોય; સાધ ભયા તથ સિદ્ધ ભયા; હુઃખ ન રહ્યા કોય. ૧ માટે માનવતા લાવવા જ પ્રયત્ન કરવો તો નિંદ્ય કાર્ય તમારાથી થશે નહિ.

૧૨. આવક હેખી વ્યાખ કરોઃ—જે માણુસ ન્યાયથી ધન મેળવતો થકો દાન લોગતું કામ પડે ત્યારે વિચારે કે મારે આવક કેટલી છે ? ઓછી આવક ધાણું ખર્ચ કરીશ તો માથે હેવું થશે, જે હેવું નહિ દઈશ તો કુરી કોણું ધીરશે; દાન હેવું સારું છે પણ હેવું કરીને દાન કરવું એ વ્યવહાર વિરુદ્ધ છે. તથા હેવું કરીને લોકોના મોં(મુખ) રાખવા એ પણ વ્યાજથી નથી કારણું કે તે જ લોકો પછી એમ બોલશે કે એમને કોણે ઉડા પાણીમાં ઉતાર્યો હતો. કે અમને સારું સારું જમાઠજે. ધર જેયા વિના ખર્ચ કરે તો ભીખ જ માંગેને ? માટે મારે આવક પ્રમાણે ખર્ચ કરવું જોઈએ; પાછળથી પસ્તાવું, એ રાંડયા પછીનું ડહાપણું કહેવાય.

૧૩. ધન અનુસારે વેષભૂપા રાખવીઃ—જે માણુસ ચોતાના ધર અનુસારે વેષ, વસ્ત્ર, પાત્ર, આભૂષણ્ણાદિ રાચ-

રચીલું રાખતો નથી તે બોકમાં અવગણુના પાત્ર થાય છે. જો દ્રવ્યબાન થઈને હલકી વેપલૂષા રાખે તો કંનુસની કોટીમાં મૂકાય છે અને સામાન્ય સ્થિતિવાળે થઈને ઉદ્દસ્ત વેવાદિક રાખે તો નાટકીયાની ઉપમાને પામે છે મારે ધન ચોંય કારબાર ચલાવવો તો તેને મુંઅન્ધુ આવતી નથી. ચતુઃ જે જાતિમાં જે કાળમાં, નર નારીના જે લિંગમાં, જે ચોંય હો જે શૈલિત હો, રહેલું સદા તે વેપમાં, એવાં રીતે રહેનારના, ધરમાં સદા લક્ષ્મી વસે, ઉદ્દસ્ત નરોના સ્થાનથી, લક્ષ્મી સદા ફરે ખસે. ૧

૧૪. આઠ ગુણું બુદ્ધિના ધારણું કરવાઃ—૧ હિત વાળીને સાંભળવાની ઈચ્છા, ૨ સાંભળવું, ૩ સાંભળેલું ચાદ રાખવું, ૪ અર્થ સાંભળવો, ૫ શંકા કરવી, ૬ સમાધાન મેળવવું, ૭ સમાધાનથી નિઃશંક થવું, ૮ તત્ત્વનિક્ષય કરવો. જે માણુસ બુદ્ધિના આઠ ગુણું સહિત શુંતને લખે અવશ્ય બહુસ્થિત તે અને માનવ જીવ સફળ કરે.

૧૫. ધર્મ સાંભળ વિશેષઃ—જે માણુસ રાજક્યા, ભક્તાક્યા, દેશક્યા તથા સ્ત્રીક્યા એ ચારે વિકથાને વળ્ણને કેવળ ધર્મક્યા જ સાંભળે તે ધાર્મિકોમાં આગળ આવે. તેની જ સદ્બુદ્ધ ટકી રહે. તે જ સુખી થાય. આનંદ, કામહેવાદિક શ્રાવકો ધર્મક્યા સાંભળવાથી જ જ્ઞાની થયા છે. અને મોક્ષ જશે

૧૬. પ્રથમ ખોરાક પચ્ચા પછી લોજન કરજે લાઈઃ—જે માનવ અજુષ્ટું છતાં લોજન કરે તો શૂળ, જવર, અતિનિદ્રા, માથાનો દુઃખાવો આવે અનેક રોગોનું લાજન બને છે. અજુષ્ટુંના લક્ષ્મેણો, અગાસા આવવા,

એડકારમાં હુગ્યંધ શરીર લાગે, અધોવાયુ તથા મહમાં હુગ્યંધ, અર્દચિ કેાઈ પણ કાર્યનો અણુગમો વિગેરે વિગેરે પાચનક્કિયાનું ધ્યાન રાખી પચે એવો ઓરાક લે તો હંમેશાં પ્રસત્ત ચિત્તવાળો, ઉદ્ઘભી ને બુદ્ધિવાન માનવ બને છે. તેથી ખુલ્લું જ આઉધરા થવાની ટેવ બીલકુલ રાખવી નહિ

૧૭. ભૂખનું હુઃખ સહન ન થાય તો ભૂખ લાગે ત્યારે લોજન કરવુંઃ—જે માનવ હેઠળ, ઇન્દ્રિયબળ સ્વાધ્યાય તથા પરોપકારના કાર્યો માટે જ લોજન કરતા હોય છે તેઓએ માનવ જીવન જીવી જાણ્યું છે. કેવળ જીવા ઇન્દ્રિયને રાજ રાખવા જે લોજન કરતું હોય અથવા શરીરને રાતુ માતુ રાખવા જ લોજન લે તો મનુષ્ય ઇપેણ ભણિષા ખલુ ઝૈય-સુજોએ શરીરકુષ્ઠ ગુમાસ્તાને પગાર જેટલું જ લોજન આપવાનું છે. જેમ ગુમાસ્તાને દીવાળીએ ભોનસ અપાય છે તેમ આ શરીરને પણ વારે તહેવારે મિષાનન આપીએ છીએ. તે અચોષ્ય નથી પણ રોજ રોજ સ્વાહુ લોજન ચખાડ્યા જ કરીએ તો જેમ ગુમાસ્તો અધિક આવકથી વકી જાય તેમ શરીરની પણ એ જ દશા થાય છે. માટે હિતેચ્છુએ ઓરાક પણ સમજીને લેવો. છેતે લોજને લોજન ત્યાગના કારણો—૧ રોગ ઉત્પત્તિમાં, ૨ મોહના ઉદ્યમાં, ૩ ઉપસર્ગથતે, ૪ જીવોની દ્યાના માટે, ૫ કર્મ અપાવવા, ૬ લૌટિક દેહના ત્યાગ વખતે લોજન ત્યાગવું.

૧૮. ધ્રમ્, અર્થ્, કામ સાધવા ઉદ્ઘમ કરવોઃ—હરહંમેશાં વહેલા ઉઠી ધર્મસાધના ઈશ્વર પ્રબિલુધાન કરવું “શ્રાવક ઉઠ નીત પરલાત, એ ધરી લે પાછલી રાત” પણી ન્યાયથી ધન ઉપાજીન કરવું. રાત્રિએ સંતાન સ્વી

પરિચય કરવો એ પ્રમાણે અતુક્રમે નિવર્ગને લે માનવ સાથે છે તે સદાયે યશસ્વાગી થાય છે.

૧૯. અતિથિનો આદર કરી દીનના કરને સેવઃ-  
અતિથિનું લક્ષણું-નિધિપરોત્તતવા સર્વે, ત્યકૃતા યેન મહાત્મના ।  
અતિથિં તં વિજાનીયાચ્છેષેમભ્યાગત વિદુઃ ॥ અર્થઃ જેણે  
તિથિ, પર્વ, ઉત્સવ વિગેરને ત્યાગ્યા છે તે જ અતિથિ  
જાણુવા બાકીના બંધા મહેમાન-પરોણા જાણુવા. એવા  
આતિથિનો આદર-સત્કાર કરીને લે લોજન કરે છે, વળી  
દીન હુંખીયાની દ્વારા લાવે છે તેજ આદર્શ માનવ  
કહેવાય છે.

૨૦. અસ્તि-નિષેષ રહિત થવું:-કોઈનો પરાલવ  
કરવાની બુદ્ધિ રાખવી નહિ. કોઈની સાથે ભાયા કપટથી  
વર્તવું નહિ, વળી ખોટો કદાચિતું કરવો નહિ. રાવણું તથા  
હુદેધિન ખોટા કદાચિત્થો સાચી શિખામણું કાને ન ધરતા  
દોકોમાં અવહેલનાને પાત્ર થયા માટે સુશાનોએ સમજુને  
પછ્ચડ કરવી.

૨૧. ગુણીજનનો પક્ષ કરવોઃ-જેમ કે શ્રી રામનો પક્ષ,  
રાવણું સહોદરને લાજ વિલીખણે કર્યો; વળી શ્રી કૃષ્ણું  
પાંડવો ન્યાર્યી હોવાર્થી તેમના પક્ષમાં ડેઠ લગે રહ્યા. એવી  
રીતે અન્ય માનવે પણ ન્યાયવાન ધૈર્યવાન ઔદ્યાર્યાદિ ગુણો  
વાળાના પક્ષમાં રહેવું કે જેથી પશ્ચાત્તાપ કરવાનો  
વખત ન આવે.

૨૨. નિષિદ્ધ દેશકાળને વિષે પ્રલૂચિ કરવી નહિઃ-  
ધર્માચથમાં તથા રાજ્ય કાતુનમાં લે સ્થળે જવાનું નિષેધેલ  
હોય તે સ્થળે જવું નહિ-જેમકે નિર્બસની માનવ દાડના

પીડામાં જય અથવા વેશયાવાડે જય તો લોકોમાં તે નિંઘ અણ્યાય છે. વળી ચોરેના સ્થળો વિષે જવ આવ કરે તો રાજ્ય તરફથી જય આવે, તેમ જ કાળને વિષે જેમ એકૂત વર્ષાકાળ વિત્યા પછી વાવેતર કરે તો ભૂટ ગણ્યાય તેમ અકાળે સ્વાધ્યાયાદિ કરે તો પણ ભૂટ અને તેથી દેશકાળ જોઈને પ્રવર્તાવું, યતઃ “વેશ્યા બુગરી ચોરના, પરનારના ભાંડારના, અપમાનના મુતદાહિના, નહી તીરને આરામના નૃપ-દ્રોહ કર આપરાધીના નટ આદિને એકાંતના, સ્થાને જતાં શાસ્ત્રા નહિ, વળી હાનિ જય અપવાદના.” ૧

૨૩. શક્તિ અનુસાર કાર્ય આરંભિતુઃ—ધનખળ, મનોખળ, મિત્રખળ, સહાયખળ, કાળખળ, દેશખળ તથા શરીરખળાહિનો વિચાર કરીને કાર્ય આદરિતું. વળી બધા ખળોમાં જો સ્વભુર્ભ ખળ ન હોય વળી ભવિતોયતા ખળવાન ન હોય તો અદ્યાપણ જો સાક્ષાત્ આવે તો પણ કાર્યસિર્ધ થાય નહિ. માટે ભવિતોયતા ખળને છાડીને બીજી બધા ખળોનો વિચાર કરી પુરુષાર્થ કરવો.

૨૪. પોષણ ચોગને પોષવાઃ—માતા-પિતા, સ્વી, સંતાન, અચક્તા, વૃદ્ધ કુદુંબીજન, નજીદીકના સીદાતા સગા રનેહીઓને જે જન સહકાર આપીને પોષણ કરે છે તો તે જન લોકમાં બહુ માન્ય થાય છે. વળી રાજ્યમાં પણ માનનીય થાય છે.

૨૫. વૃદ્ધજીનો વિનય કરવોઃ—શાનવૃદ્ધ, વ્રતવૃદ્ધ, વયવૃદ્ધ, તપોવૃદ્ધ વિગેરે વૃદ્ધ પુરુષોનો જે જન વિનય બહુમાન કરે છે તે જન ઉત્તરોત્તર વૃદ્ધ પામતો જાય છે. પણ જો લક્ષ્મીવૃદ્ધ હોય અને દાતાર ન હોય તો તેની

એટી ખુશામત કરવાત્ય વિનય ગણ્યાય છે. માટે ત્યાં ઉદાસીન રહેવું.

૨૬. દીર્ઘ દર્શી થવું :—જે જન લાંખી નજરે કાર્ય-કાર્યને વિચાર કરે છે. પછી કાર્યને આચરે છે તે જરૂર કાર્યમાં સફ્ફૂલતા મેળવે છે વળી તેનું કાર્ય દોકમાં શ્રલાઘનીય બને છે. તથા અન્ય જનો દીર્ઘ દર્શીની સલાહ લઈ કામ કરે છે. પણ દીર્ઘ દર્શીને બદલે જે દીર્ઘસૂત્રી બન્યા તો દોકે માં ધૃષ્ણાપાત્ર ગણ્યાશે, કારણ કે દીર્ઘસૂત્રી પાછત ખુદ્દ હોય છે. જેમ કોઈ એડુ વર્ષી સમયે વરસાદ આવશે કે નહિ આવે? ચર્ચા આવ્યો તો એક આવ્યો. પણ જીને વરસશે કે નહિ આવી રીતે વ્યાપારી પણ ભાવ તાલમાં દીર્ઘસૂત્રી બની પશ્ચાત્ રહે છે. માટે દીર્ઘસૂત્રી બનવું નહિ. પણ દીર્ઘદર્શી બનવું. એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વિગેરે જોઈને કાર્ય કરવું તે સપ્રમાણ છે.

૨૭. અધિક જ્ઞાનધર થવું :—જે કે જ્ઞાન વિશેષ મેળવવું તે પોતાના હાથની વાત નથી તો. પણ જ્ઞાનીની નિશ્ચાચે શિષ્ય પણ પૂજાય, વળી જે વિશેષજ્ઞ હોય તે સામાની અંગીત આકૃતિથી ભાવેને જાણી પોતાના કાર્યમાં કુશળ બને છે

૨૮. કૂતરણ થવું :—કોઈએ અદ્ય પણ આપણું સહ્યકાર્ય કર્યું હોય તો તેને કહી ભૂલવું નહિ. વળી ઉપકારીના વખાણુ કરતી જીબને રોકવી નહિ તેથી પોતે જીબને પ્રીતિપાત્ર બને છે અને પોતાના કાર્યમાં ડખલ આવતી નથી. યતઃ નિજની ઉપર જે કોઈએ, ઉપકાર કીધો હોય તો, તેને કહી ભૂલે નહિ, આભાર અંતર માનતો, શી રીત બદલો વાળુ

એ, ચિત્તો સદ્ગુરી વળી ચિંતવે, મહાપૂરુષથી પામ્યો જતો,  
માર્ગનુસારી ધર્મ એ?

૨૬. લોકપ્રિય બનવું :—આંખમાં અમી, હસતું સુખ,  
ભીડાં ઘોલ, માધ્યસ્થભાવ, કોણતું કર્યો કરી હેવાની ભાવના  
વિનઅતા, ઔદાર્યાદિ ગુણો વડે જન, જનપ્રિય બને છે વળી  
સજ્જનોએ નિષેધેલા કાર્યો ન કરવાથી પણ લોક ચાહના  
મેળવે છે. પણ એટલું જરૂર જાણવું કે કેવળ લોકની વાહવાહ  
મેળવવા ને લોકહિત કાર્યો કરે તો આત્મવંચના થઈ ગણ્યાય  
પણ પોતાની ઝરજ સમજ ને કરે તો પરલોકમાં પણ  
અત્યંત પ્રિયપાત્ર બને છે.

૩૦ લાજજળું બનવું :—શરમ એક એવી વસ્તુ છે કે  
મનરૂપ અસ્થિતી એ લગામ છે જ્યારે આ લગામ હાથમાંથી  
છુટી જાય છે ત્યારે માનવ અકૃત્ય કરતો પાછો પડતો નથી,  
લોકભય, રાજભય એ જુદી ચીજ છે ત્યારે શરમ એ  
આત્માનો મહાન ગુણ છે. આ ગુણને લઈને શ્રી વીર પૂર્વ  
ભવમાં મરીચી સંયમથી પતિત થયા છતાં ઘેર ગયો નહિ.  
શાલિલદે પોતાના બનેવી ધર્માના કહેણુથી જલદી સાથે  
હીક્ષા લીધી, લોક-લાજથી કેટલીક ફેનો વૈધન્યનું પાલન  
કરે છે. શીલવંતી રહે છે. માટે લજન ગુણુથી આત્મા  
હુર્ગાતના ગર્તમાં (આડામાં) પડતો અટકે છે. આજ  
તેનો મહાન પ્રભાવ છે.

૩૧. દ્વાળું થવું :—જ્યારે આત્માને આત્માનું ભાન  
થાય છે ત્યારે બીજા આત્માએ પ્રત્યે આત્મહંદિ જાગે છે.  
પછી બીજે હુઃએ થાય ત્યારે પોતાને હુઃએ થાય છે.  
હૃદયમાં દ્વાળનો સંચાર થાય છે. ત્યારે બીજતું હુઃએ છેદવા  
પ્રયત્ન વિશેષ કરે છે. પછી સામા લુંબને આનન્દિત જોઈને

પોતે આનંદ પામે છે. માટે-દ્વારા દુઃખ વિનાશની એ કહેવત બરાબર છે

૩૨. સુદુર આકૃતિ સૌભ્યતાવાળા થવું :—સૌભ્યતા એ ગુણું પોતા વિષે બીજાનો સહૃદાચ લાવનારો છે જ્યારે બીજાનો તેના પર સહૃદાચ હોય ત્યારે તેને કોઈ સારી શિખામણું આપે. વળી તેની પાસે કોઈ આવીને બેસ ઉઠ કરે, તેની સહાહ શિખામણું માને વિગેરે વિગેરે સ્વપરને લાલ કર્તાં એ ગુણું છે. યતઃ “અહરાજ સુરજ એકલો, આકાશમાં ફરતો ફરે. દેખાયના અહું સાથ એની સૌં ફ્રાનોકે ડરેં તારાપતિ છે ચંદ્ર પણ, અહું સાથમાં દેખાય છે, હોતાં સુધ્યામય સૌભ્યતે, પરથી અહોં સેવાય છે. ૧”

૩૩. પરોપકાર કર્તાં થવું :—જે કે કોઈ પણ માનવ પાસે ત્રણું થોગ હંમેશાં હોય છે. મનથોગ, વચનથોગ અને શરીરથોગ અને પુણ્ય પ્રબળ હોય તો ધનથોગ પણ હોય છે. એમાં વળી સહૃદ્યુદ્ધિ થૈય હોય તો સોનામાં સુંગધ મળી ગણ્યાય. એ ઉપરેઃકૃત પાંચે મોગથી માનવ પરોપકાર કરી શકે છે, જે ચાર થોગની ક્ષતિવાળો કેવળ મનથી શુલ્ષ ભાવના ભાવે તો પણ સ્વપરનું શુલ્ષ કરી શકે છે. અર્થાત्-જેને જે થોગની પ્રબળતા હોય તેણે તે થોગથી પરોપકાર કરવો બેધાયે. મેદ્દા પરોપકારાર્થે વરસે છે, વૃક્ષો પરોપકારાર્થેં ફળે છે, નદીઓ પરોપકારાર્થેં વહે છે, તેમજ સત્ત પુરુષોની વિભૂતિયો પણ પરોપકાર માટેજ હોય છે. તેથી કોઈ માણુસ જીદ્ગીમાં એક દિવસ પણ પરોપકાર કરે તો તેનો જન્મ સંશળ છે, તો વધારે કરે તેનું તો કહેતું શું ? ઇનું દણાંત જુઓ—ખુણમાં પડે, ચુંટી સહે, ત્રાજવે તોળાઈ નીચે પડે, અરખે પીલાએ, વળી પીજણુંથી પીનાય

પછી પુણી પણુને પામે છે. પછી ત્રાકે કંતાય, કંઠલે અથડાય, પછી વસ્ત્રપણુને પામી, ઘણું કષ્ટો સહી બીજાનાં શુદ્ધ લાગે નાંકનાડ થાય છે માટે આ દૃષ્ટાંતથી માનવે પણ પરેપકારમાં પડતા કષ્ટોથી ભય પામવો જોઈએ નહિ.

**૩૪. છ અંતરંગ શત્રુઓને જીતવા :—** અંતરંગ કહેતા અંતરમાં રહેલા કામ, કોધ, માન, મદ, લોલ અને હુંદ્રા એ છએ હૈત્યો આત્મહેવને વારંવાર હેરાન કરે છે, વળી મનરૂપ સારથી પણ શત્રુઓ સાથે મળી જઈ આત્મહેવની હુંદ્રાંશા કરે છે તેથી માનસીએ જ્ઞાનીઓના વયન પર શ્રદ્ધારૂપ ચાખખા વડે તંચોને મારી હડાવી મનસ્વાધિન કરી આત્મ કદ્વયાણું સાધવું જોઈએ યતઃ એ કામ આદિ દુઃખનોનિજ આત્મની હાનિ કરે, એ પડું વિરેકી લોકમાં, અતિ નિંદને દુઃખીય ખરે, અજજન રહ્યા તેથી હરે થશાંતિર્તિ આ લોકે વરે, પરલોકમાં ચુરુંકૌણ્ય સાધી મોંકની પદવી ધરે. ૧.

**૩૫. દુનિદ્રય ગાળુનો જ્યથ કરવો :—** પાંચ જ્ઞાનેનિદ્રય, પાંચ કર્મેનિદ્રય અને અગ્યારમું મન એ અગ્યારે આત્મહેવના સદાના સેવકો છે. સેવકો સદાએ ચીહ્નીના ચાકર ગણ્યાય છે. માટે એ ભૂલો કરે તો તે આત્મહેવનીજ ભૂલ કહેવાય, માટે આત્મહેવ જ્યાંસુધી લવિતવ્યતાના યોગે સ્વધરમાં સમાધિસ્થ ન થાય ત્યાંસુધી આત્મહેવે પરમાત્મહેવની આજા અનુસાર પોતાનો કારલાર ચલાવવો, જે પરમાત્મા મહાવીર હેવની આજા અનુસાર નહિ વર્તે તો આ અગ્યાર સેવકો સ્વચ્છાચારી થઈ જઈ પોતાની મેળવેલી મુડીને ઇના કરી દુર્ગતિમાં ધસડી જશે. માટે અગ્યાર સેવકોને પોતાને વશ રાખવા. ગ્રલુ મહાવીરના આજાપત્ર પ્રમાણે વર્તવા કહેવું. તેથી ભય રહેશે નહિ. સ્વપાલ અગ્યાર

સેવકોનાં નામ શું? જવાબ આમડી, અલ, નાક, આંખ, અને કાન એ પાંચે જાનેન્દ્રિયો છે. હાથ, ચરણ, મુખ, તિંગ ને ગુદા એ પાંચે કર્મન્દ્રિયો છે અને અગ્યારમું નોઈન્દ્રિય મળ છે. એ અગ્યારે ઓછ ખાંપણું વિનાના મહા પુણ્ય ચોગે સેવકો મળે છે માટે પુણ્ય કર્મ કરતા રહેવું જોઈએ; યતઃ એ રીત સર્વ ઈન્દ્રિયાને, વશ કરે કે જે જનો, તે માની-એને પણ થતા, અતિ માન્ય નિશ્ચય સજજનો, આણુંટોક આદરથી લર્યા, વરધમને લાયક થતાં, આ લોકને પર-લોકમાં, યશ પામી મોક્ષે જતાં. ૧.

ઇતિ ચાથા ઓદે માર્ગનુસારી ગુણ વર્ણને સામાન્ય વિવેચનં સમાપ્ત અં શાન્તિ: શાન્તિ: શાન્તિ:

બેહજર સત્તરના ભાદરવા વહી ૮ ને સોમવાર.

સંઅાહક તથ વિવેચક ચંપકસાગર,

\* \* \*

### ધનનો સદ્ગુપથોગ

લેખક :—મુનિશ્રી ચંપકસાગરાલ

ધન ધન જે નરા, જે સુપાત્રે ધન ખરચે  
ધિક ધિક તે નરા, જે ભૂમિમાં ધન ઢાટે.

સૂર્યપુરી નામા નગરી હતી. તે સમૃદ્ધિએ કરી શોલાય-માન હતી. ત્યાં અનેક શેષોગૃહો લખુહીમગિરિ સમ શોલતા હતાં ત્યાં જિન તથા શિવમંદિરો ગુરુ હીમગિરિ તુલ્ય ભાષતાં હતા, નગરકોટ તો નજરને રમણીય લાગતો હતો. તેની પરિભા તો પતિપ્રતા ખીની માઝક સદા સાનિધ્યમાંજ વસતી હતી. એ નગરના અગ્નિચામાં અનેક જાતના વૃક્ષો વક્ષાદારી સેવકોની માઝક શોભા આપતાં હતાં. સીતાઙળ,

રામકૃણ, જામકૃણ, નારંગી વૃક્ષોની ધરાજ ઓર હતી. ત્યાં એક દ્રાક્ષમંડપને તો જેઠને તો નજરજ હરી જતી હતી. ત્યાં એક શીયાળ ભાઈ આવ્યા. દ્રાક્ષ જેઠ અન તો એવું ગલગલુ થઈ ગયું કે એકજ કુદકે બધીજ દ્રાક્ષો ખાઈ જઉં પણ કરે શાં? દ્રાક્ષમંડપ ખૂબ ઉચ્ચો હતો, કુદકા બે ત્રણું માર્યા પણ એક દ્રાક્ષ મેંમાન પડી. હારીને બીજે જવા માંડયું ત્યાં તો તેમના જુગરણન દોસ્ત કાગડાભાઈ સીતાકૃણ ઉપર બેઠા હતા. આ શિયાળભાઈનો તાલ જેઠ રહ્યા હતા. હસીને કાગલાઈ બોલ્યા: કાં શિયાળભાઈ! દ્રાક્ષ કેવી મીઠી છે? શિયાળ બોલ્યું: અરે ભલા ભાઈ, આવી આવી દ્રાક્ષ કોણું આય? કાગલાઈ ખૂબ ખૂબ હુસ્યા.

આજ શહેરમાં વ્યાપાર ઉદ્ઘોગોનું ધામ હતું, ત્યાં અનેક જાતના સટ્ટા પણ ચાલતા હતા તેમાં ગુરુવાણીના સત્યાસત્યનો પણ સટ્ટો ચાલતો હતો તેનાં પણ લોકો ધોમ પૈસા મારતા હતા. વિશેષ કરીને સટ્ટાને ચોખાણું આપવા ત્યાં જ્યોતિષીઓનો પણ એક સંધ હતો તેમાં કોઈ જૈન જ્યોતિષોનો દાવા ધરાવતા હતા તો કોઈ પ્રકાર જ્યોતિષીનો દાવા ધરાવતા હતા. ધર્મરથાનકમાં લોકો કીડીયારીની માફક જતા આવતા હતા. દાનશાળામાં તો આ ચુંગની રેશનીંગની હુકાનની માફક દરોડા પડતો હતો આવા સુંદર શહેરમાં શું શું ન હોય? અર્થાત, બધુંજ હોય વેશ્યાવાડ, જુગારખાતું, દારૂખબાર, કલલખાતું વિગેરે અનેક અનિષ્ટ તત્વો ધરાવતા સ્થાનો પણ હતા. જ્યાં ધર્મપહેશ સુંદર ચાલતો હોય ત્યાં અનિષ્ટ તત્વોના ધામોમાં હુકાણનો જ દમ જેંચાયને? વેશ્યાઓ ગૃહિણી બની, દારૂદીયાઓ દુખ પીતા થયા જુગારીઓ વ્યાપારી જન્યા, માંસાહારમાર્કેટ શાકાહાર બજાર

બન્ધું. ધૂર્તાગારે ધર્મિઅગરે બન્યા. કોધી પ્રાણીએ સભતાશીલ બન્યા વિગેરે.

ત્યાં એક સુમુક્ષુ લાઇને તિથિનિર્ધૂય કરવા માટે જિજાસા જગતા જ્યોતિષીના જાણુકાર જ્યોતિર્વિદ્યાને ત્યાં ગયો. અમો પુનમની પાખી ને પાંચમની સંવત્સરી કરનારા છીએ અને એ માન્યતામાં મજબુત છીએ.

જી-મહારાજ ! ગઈ સાલમાં ચોથની સંવત્સરી કેમ કરી હતી.

મ-લાગ્યશાલી ગધ સાલ તો પાંચમની ઘડીયો ચોથમાં આવતી હતી તેથી ચોથની સંવત્સરી કરી હતી. અમારા પરંપરાના પૂજાનો તેવો આદેશ છે તેથી જ એ રીતે અમો પુનમની ઘડીયો ચઉદસમાં આવતી હોય તો અમો ચઉદસની પાખી પણ કરીએ છીએ.

જી જ્યારે આરાધના પુનમની જાણ્યાય કે ચઉદસની ? આપ ઉપવાસનું પચ્ચખાણું ચઉદસની તિથિની ઘડીયોમાં આપો છો ને આરાધના પુનમની મનાવો છો તો સાહેબ ! મૃષાવાદ ન વાગે ? આવી રીતે ચોય અને પાંચમમાં પણ બને છે.

મ-એમાં અમે કંઈ ન જાણીએ. એ- અમારા શુરુની પરંપરા છે તે મુજબ વતીએ છીએ.

જી-અહું સાહું સાહેબ, જય જય.

જિજાસુનું મન ન સંતોષાતા બીજુ દુકાને જય છે. અમો શાસ્ત્રાધારે બાર પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ ન કરતાં અપર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરી પાખી અને સંવત્સરી પદિક્ષમીએ છીએ.

જી-મહારાજ, આમાં તો ખરી તિથિ મારી જય ને જોઈ પર્વતિથિની આરાધના થાય છે.

મહારાજ-ભાઈ, જયારે ચઉદ્દસનો ક્ષય હોય છે અને ઉદ્યમાં તેરસ હોય છે ત્યારે તેરસને ચઉદ્દશ માનવી પડે છે, ન ?

જી-એમાં તો સાહેબ ન છુટકે કરવું પડે છે.

મહારાજ-ત્યારે ભાઈ જોડકાં પર્વ આરાધવા માટે તથા ખાળજુવો ભ્રાંતિમાં ન પડે જુદે જુદે ડેકાણે જુદી જુદી આરાધના ન થાય તે માટે ગીતાર્થેની પરપરા એમજ ચાલી આવી છે. ભાઈ ત્યાગવામાં ને માર્ગી માગવા પાપાશ્રવ લાગે ખરાં ?

જી-ના સાહેબ, પુણ્યાશ્રવની જગ્યાએ પાપાશ્રવ ને પાપશ્રવની જગાએ પુણ્યાશ્રવ હોય જ નહિ તો પછી આરાધનામાં વિરાધના હોય જ નહિ.

જીજાસુને હજુ પુછવાની જીજાસા રહેતાં એક ત્રીજુ હુકાને જય છે ત્યાં અમે શાખાનુસાર તથા પંચાગાનુસાર પર્વતિથિની આરાધના કરીએ છીએ ને મફ્ફિમતાની અમારી માન્યતા પણ છે.

જી-મહારાજ એ પર્વતિથિઓ જેડે આવે ત્યારે શું કરવું?

મ-ભાઈ ? એમાં શું વાંધો ? બન્ને જેડે કરવી.

જી-સાહેબ એ પુનમ અથવા અમાવાસ્યા આવે ત્યારે ચઉદ્દસ પુનમની આરાધના શી રીતે કરવી !

ભાઈ, ઉદ્યમાં ચઉદ્દસ હોય ત્યારે ચઉદ્દસની આરાધના ચઉદ્દસની કરવી અને પુનમની આરાધના બીજુ પુનમે કરવી.

જી-સાહેબ ! છુટુના પંચકખાણુ કરવા હોય તો ચઉદ્દસ પુનમનો છુટુ શી રીતે કરવો ?

ગલ્લાંતલ્લાં કરતાં પંડિતજી બોધ્યા કે ભાઈ, એ તો છુટા છુટા ઉપવાસ કરીએ તો એ વાંધો નથી. કયાં રેસરેઝ આવું આવે છે. પણ આપણે જે ઉદ્દ્ય તિથિમાં આર ધના ન કરીએ તો મૃષાવાદનો દોષ લાગે અને જુટું બોલનારની જેવું બીજું મોટું પાપ કર્યું છે ?

જી-સાહેબ ત્યારે તો ચઉદ્દસ તુટે ત્યારે ઉદ્દ્યમાં તેરસ હોય અને તેને આપણે ચઉદ્દસ મનાવીએ ત્યારે શું મૃષાવાદ નથી લાગતું ?

મ-તેમાં તો આરાધનારૂપ ભાવ સત્ય રહેલું છે. અને ન છુટકે કરવું પડે છે

જી-ત્યારે સાહેબ ! જેઠે પર્વ આરાધનામાં ભાવ સત્ય શું ન આવે :

મ-જે તમને એમ ઢીક ન લાગે તો એમ કરો અમારો કંઈ વાંધો નથી. અમારે અમારા ખુડજી કહી ગયા તેમ કરવું પડે છે

જી-સાહેબ તકલીફ માફ કરજે, વયે જ્ય જ્ય.

જ્ઞાસુનું મન હજુ થાંત ન થતાં પેતા દ્રાક્ષના મંડપમાં જઈ એડો અને પ્રલુ મહાવીરની મીઠી વાણીનું મનન કરવા લગ્યો. ત્યારે દ્રાક્ષનો જેવી પ્રલુની મીઠી વાણીનું સ્મરણ થતાં લગવાને તો સકલ સંધને અતિથિસંવિલાગને પ્રતમાં અતિથિ સામાયકધર્મ આધારક કહ્યો છે. માટે આપણે તિથિની તડક્ઝોડમાં ન પડતાં અતિથિ થધ ખુખ ત્યાગ અને સમતા ક્ષમા વીરસ્ય હસ્તૌ ક્ષમાધર્મનો આરાધના કરવી એજ ઉચ્ચીત છે.

ઉપરેણું સૂર્યભૂરી ધર્મી અને દાની નગરીમાં નેમ  
મગમાં એક કર્કશ મગ (કોઈડુ) રહી જાય છે તેમ એક  
રતનાક્રિયા નામા કંજુસ શેડ રહેતાં હતાં. એક વખત દાનશાળા  
તરફ થઈને જતો ત્યારે યાચકોને દાન લેતાં જોઈ અને  
દાતારને આપતાં જોઈ કલુંબિત મનવાલા થઈ ઘેર આવ્યા  
ત્યારે સ્વીચ્છે કહ્યું.

નારી પુછત સૂર્યમકું, કાંસે બદન મલીન;  
કાં ગાંઠસે ગીર પડયો, કાં ગાંઠસે દીન.  
નહિ ગાંઠસે ગીર પડયો, નહિ ગાંઠસે દીન,  
દેતે દેખા ઓરકું, ચુંહિ સુખ મલીન.

લાઈયો કંજુસોના હુયા કેવા કઠીન હોય તે આ ઉપરથી  
સમજાય છે પછી એમ વિચારતો હતો કે મારો પાસે રતનો  
ધણું છે અને બીજું પણ ધન ધણું છે, માટે છોકરાને સાથે  
લઈ શૂન્યવનમાં વધારાનું ધન દાટી આવું તેથી અપ પડશો  
ત્યારે કાઢી લાવશું. એમ વિચારી છોકરાને સાથે લઈ ધન  
દાટવા શૂન્યવનમાં શેડ આવ્યો ત્યાં આડો એહી ધન દાટતા  
વિચાર આવ્યો કે રાખેને કોઈ ધુર્તિ ધનાકંક્ષી આ વનમાં  
વિચરતો હોય અથવા સંતાણો હોય માટે છોકરા પાસે  
તપાસ કરાવી પછી દાટવાની વિધિ કરું.

હે વત્સ, જી આ વનમાં કોઈ માણુસ વિગેરે તો છે  
નહિને? મને શાંકા આવે છે જોઈ આપ.

છોકરો સાઝું વન કરીને આવીને કહે છે કે બાપુ  
એક મૃતક (મુડહું) પડેલ છે. બીજું કોઈ દેખાયું નહિ.

શેડ-નાણી કોઈ ધુર્તિ શ્વાસ રોધ કરી મુડહું થઈને પડયો  
હશે, માટે વિશ્વાસ મુડદાનો પણ કરવો ન જોઈએ એમ

વિચારી પુત્રને કહેતો હતો કે મને વિશ્વાસ આવતો નર્થી આ મૃતકના તું કાન કાપી લાવ પછી ખાત્રી કરને કે એ મુદ્દું છે કે જીવે છે.”

પુત્રે તેમ કરતાં પણ શેડને વિશ્વાસ ન આવતાં ઝરી કહ્યું કે હે પુત્ર, મને સંતોષવા માટે એનું નાક પણ કાપી લાવ પુત્રે તેમ કરતાં શેડને સંતોષ થતાં ધન દાટીને પિતા પુત્ર ઘેર ગયા.

પછી ધૂર્ત ઉડીને વિચારવા લાગ્યો કે અહો ! અગ્યારમા પ્રાણુધન આગળ નાક, કાન અને દશ પ્રાણો પણ કયા હિસાબમાં છે ? માટે નાક કાન ગયા તો લલે ગયા પણ આ ધનથી વેશ્યાચ્યો સાથે જે વિલાસ કરીશ તે તો આ જનમભાં ઓરજ હશે. એમ વિચારી ધૂર્ત ધન લઈ વેશ્યાને ત્યાં જઈ વિલાસ કરવા લાગ્યો.

જ્યારે શેડને ધનની જરૂર પડતાં ત્યાં જઈ ખાડો જોઈ જુએ છે તો ખાડો ખાલી જોઈ શેડ મૂર્ચીત થઈ ગયો. પછી શુદ્ધ આવતાં વિચારવા લાગ્યો કે નક્કી ચેલો ધૂર્ત નાક કાન કપાવીને પણ ધનલોલી ધન લઈ ગયો. હશે. માટે એને હું નગરમાં જઈ તથા પ્રકારનો (નાક કાન વિનાનો) જોઈ પકડાવી લઈ, અને રાજ આગળ ઝરીયાદ કરી ધન પાછું મેળવું. એમ વિચારી નગરમાં તપાસ કરતાં વેશ્યાને ત્યાં આ ધૂર્તને જોતાં રાજસેવકને ખાલાવી તેને પકડવામાં આવ્યો. પછી રાજ આગળ લઈ જવામાં આવ્યો અને શેડ વિનાનું પોતાની ઝરીયાદ કરીને કહ્યું કે હે પ્રલો ! આ ધૂર્તે માર્દ વનમાં દાટેલું સધળું ધન લઈ લીધું છે તે દયા કરી મને પાછું અપાવવા કૃપા કરો.

રાજન-(ધૂર્તું સામું જેઠ) અરે ધૂર્તું! આ શોઠનું ધન લીધું હોય તો પાછું આપી હે, નહિતો યુના તરીકે અજ થશે.

ધૂર્તું-(જરા હસીને) રાજન! મેં ધન મફત લીધું નથી પણ મારા આ કાન અને નાક આપીને લીધું છે જુચો મારા નાક અને કાન.

રાજન-(આ વાત સાંભળી કાઈક હાસ્યમાં ને કાઈક કોધાતુર થઈને શોઠને હપકો આપતાં કહ્યું કે) એના નાક કાન લઈને એને ધન આપ્યું છે ને અહીં ફરીયાદ લઈને આવ્યા છો? જ હવે ચાહ્યો જ.

શોઠ વીલે માઢ ઘેર ગયો.

ભાઈઓ કંબુસીઆઓની કમનસીઓં, અને ધર્માઓને ધન્યવાદ માટે એક કવિએ સાચુંજ કહ્યું છે કે-કીડી સંચે ઓર તીતર ખાય, પાપીઠા ધન પર લે જાય.

### તાઈક શક્તિની દુર્કી વાર્તાઓ.

૧. કોઈક ગામમાં એક પ્રભાણે વૃદ્ધ અવસ્થામાં એક યુવતી સાથે લગ્ન કર્યા તે યુવાચ્ચવસ્થામાં તન્મનાટ વાળી હોવાથી તેના હૃદમાં તે વૃદ્ધ પ્રાણીણ ગમતો ન હતો, તેથી તે કોઈક વિટ પુરુષ સાથે સબંધ જોડયે. “વૃદ્ધાનાં તરણી વિષમ્ભ” પછી તે વિટ પુરુષની સાથે હરવા ફરવા લાગી. જ્યારે પ્રાણીણે આ વાત જાણી અને ન્યાય આપનાર આગળ ફરીયાદ કરી ત્યારે ધૂર્તાં કહે મારી સ્વી છે અને પ્રાણીણું કહે એ મારી સ્વી છે, અને સ્વી કહે હું ધૂર્તાંની છું. ન્યાય આપનાર ત્રણેની વાત સાંભળી વિચાર કર્યો કે જેની સાથે રહેતી હ્યે તેની સાથે ખારી પણ હરો. તેથી ત્રણેને ગઢ કાલનો ઓરાક સંબંધી પ્રશ્ન કર્યો, ત્યારે પ્રાણીણે કહ્યું કે

અમે બનનેએ ગર્ભ કાલે સુખડીનોજ ઇક્તા ઓરાક લીધો છે. ત્યારે ધૂતોં ગદ્વાતદ્વા કરી ઉત્તર આપ્યો છતાં વિશેષ શુદ્ધ ન્યાય કરવા માટે એ ત્રણેને વિરેચન આપ્યું અને મળની તપાસ કરી પ્રાહ્લાદુને પ્રાહ્લાદીનો એક મળ જોઈ કી પ્રહ્લાદુને સાપી આ પ્રમાણે તાર્કિક શક્તિ ક્ષયોપશમ ચોગે મળે છે

૨. એક ગામમાં એક વાણીયાને એવી ટેવ પડી કે જ્યારે મળોતસર્ગ કરવો હોય ત્યારે જંતુઓના દર પર જઈને કરે. એકદા એવું બન્યું કે જ્યારે લાઇ વડી નીતિ કરવા એઠા હતા ત્યારે એ કાચંડા લડતા હેખાણા. નજર ચુક્થી એક કાચંડા નાસી ગયો અને બીજે એનો પુકે પૂછું અડાડી દરમાં પેસી ગયો, વાણીયાલાઇ વિચારવા લાગ્યા કે બનનેમાંથી એક તો દરમાં પેઠો અને બીજે કયાં ગયો? નજી હેખાણો નહીં એટલે મારા મળદ્વાર વડે મારા પેટમાં ગર્દી ગયો તેથી શાંકાશીલ થઈ બીમાર પડ્યો પછી દિવસે દિવસે માંદગો વધવા લાગી ધણું નૌંધો આગળ વાત કરી ત્યારે સૌઅં હસી કાઢો અને કલ્યું કે વહેમનું ઔષધ ન હોય ત્યારે એક વિચારવંત નૌંધો એલાબ્યો તેણે વાત સાંસળી વિચાર્યું કે વહેમ કાઢ્યા વિના માણુસ સારો થાય નહીં તેથી તેણે કલ્યું કે તમારી વાત બરાબર છે બનવા જોગ છે કે કાચંડા પેટમાં ગર્દીગયો હશે. ઇપિયા એકસેને એક સિવાય હું કેસ હાથમાં લેતો નથો. વાણીયાલાઇને હુઃખ ન ખમાવાથી બધું કલ્યુલ કલ્યું ત્યારે વૈધરાને એક કાચંડા લાલ રંગથી રંગી એક ઘડામાં મૂક્યો, પછી તે દરદીને વિરેચન આપી ઘડામાંજ મળોતસર્ગ કરાબ્યો અને કાચંડા કુદીને બહાર નાડો તે જોઈ હાશ હવે રોગગયો કોધ મારી

સાચી વાત માનતું જ નહેતું? પછી તો વાણીયાભાઈ સાજા  
તાજા થઈ ગયા, એ દિશાન્તનો ઉપનય એ છે કે લિન્ન લિન્ન  
પ્રવૃત્તિ લોક માટે તાઈક શક્તિથી કામ લેનાર સુખી થાય  
છે તે શક્તિ જ્ઞાનના ક્ષયોપશમ ચેાગે મળે છે.

કૈક ગયા ને જય છે, જશે થશે એ હાલ;  
સુકૃત સાથે આવશે, કોણે દીઠી કાલ? ૧  
પવન શીરે બાદળ શીરે, શીરે નહીના પૂર;  
ઉત્તામ ઓહ્યા નવિ શીરે, પશ્ચિમ જોગે સૂર. ૨  
વહેતાં પાણી નિર્મલા, પડ્યા સો ગંધાય;  
સાધુ જન લમતા લલા, હાગ ન લાગે કોય. ૩  
નિજ આતમ ગુણુ રમણુતા, દુદ્રિય તળ વિકાર;  
શિર સમાધિ સંતોષમેં, ભવ ફુઃખ લંજનહાર. ૪  
પદ્ધ્યીશ બીડી રોજની, સો વર્ષે નવ લાખ;  
ધર્મ ધારુ ધન હણે, છાતી થાયે આખ. ૫  
શીરે પુરી લાપસી, ઔર કાકડી આદિ;  
કહેણુકીતો એકાદશી, ચે દ્વાદશીકી દાદી. ૬  
નીરખીને નવ ધૌવના, લેશ ન વિષય નિદાન;  
ગણે કાણની પુતળા, તે લગવાન સમાન. ૭

### પરમાત્માને પ્રાર્થના

બઢ પીંપળકી છાંયકે, સોખત હેં બઢાંકી;  
રગડ કસુંખા ઘોળકે, મુડી ભર ચણોડી. ૮  
બાખડી લેંસકા હુધ, સકર સંધ ઘોળણા;  
ઇતના દે કીરતારતો, શીર કચુ નહીં ઓલણા. ૯

ઇત દોહરા અષ્ટક.

# આત્મહિત શિક્ષાની સજાય

( પ્રાણી ધરીએ સંખેગ રંગ-એ દેશી )

જ્ઞાન ધ્યાન ચારિત્રને રે, જો દુદુ કરવા ચાહ; તો એકાકી વિહૃતતા રે, જિન કલ્પાદિ સહાયરે. પ્રાણી એકત્વ ભાવના ભાવ, સિવ મારગ સાંચન દાવ રે. પ્રા. (૧) સાધુ ભાણી ગૃહ વાસની રે, છુટી મમતા તેહ; તો પણ ગુચ્છવાસી પણ્ણા રે, 'ગણુ ગુરુ પર છે નહેરે. પ્રાણી. (૨) વન મૃગની પરે તેહથી રે, છાડી સકળ પ્રતિઅંધ; તું એકાકી અનાદિનો રે, કિલુથી તુજ પ્રતિઅંધ રે. પ્રાણી. (૩) શત્રુ ભિત્રતા સર્વથી રે, પામી વાર અતન્ત; ડોણુ સ્વજન હુદમન કિશોરે કાળે સહુનો અંતરે. પ્રા. (૪) બાંધે કર્મ લુચ એકલો રે, લોગવે પણ તે એક; કિલુ ઉપર કિલુ વાતની રે, રાગ દ્રેષની ટેકરે. પ્રા. (૫) જો નિજ એક પણ શહેરે રે, છાડી સકળ પરલાચ; શુદ્ધાતમ જ્ઞાનાદિશું રે, એક રવરૂપે ભાવ રે. પ્રા. (૬) આવ્યો પણ તું એકલો રે, જધશ પણ તું એક; તો એ સર્વ કુદુંઘથી રે, પ્રીત કિશી અવિવેક રે. પ્રા. (૭) વનમાં હે ગજ સિંહાદિથી રે, વિહૃતતાં ન રણે જેહ; જિલુ આસન રવી આખમે રે, તિલુ આસન નિશિ છેહરે. પ્રા. (૮) આહાર શહેર તપ પારણેલ, કરમાં વૈપ વિહીલું; એક વાર પાણી પીવતાં રે, વનચારી ચિત અદીન રે. પ્રા. (૯) એહ દોષ પર શહુલુથી રે, પરસંગે શુલુ છોય;

પરબેન શ્રાહી ચોરતે રે, એક પણે મુખ હોય રે. પ્રા. (૧૦) પર સંલોગથી બંધ છે રે, પર વિયોગથી મોક્ષ; તેણે તજી પર મેલાવડા રે, એક પણેં નિજ પોષ રે આ. (૧૧) જનમ ન પામ્યો સાથ કો રે, સાથ ન મરશે કોય; હુઃખ વહેંચવા કો નહીં રે, ક્ષાણ ભાંગુર સહુ લોય રે, આ. (૧૨) પરિજીત મરતો હેખીને રે, શોક કરે જન મૂઢ; અવસરે વારો આપણો રે, સહુ જનની એ રૂફ રે. પ્રા. (૧૩) સુરપતિ ચક્કી હરિ અલી રે, એકલા પરસવ જાય; તન ધન પરિજીત સહુ મિલી રે, કોઈ ઉસખાય ન થાય રે. પ્રા. (૧૪) જ્ઞાયક રૂપ હું એક છું રે, જ્ઞાનાદિક ગુણવંત; બાધ્ય જોગ સહુ અવર છે રે, પામ્યો વાર અનન્ત રે. પ્રા. (૧૫) કરકું નમિને ગાધએ રે, દુસુંખ પ્રમુખ રૂપિરાય; મુગાપુત્ર હરિકેશનાં રે, વંડું હું નિત્ય પાય રે. પ્રા. (૧૬) સાધુ ચિલાતી સુત જલેં રે વળી અનાથી તેમ; એમ મુનિ શુષુ અનુમોદતાં રે, દેવચંદ્ર સુખ એમરે આ. (૧૭).

૧ ગણુ-સમુદ્ધાય.

૨ વિહરતાં ન ટણે જોક-મુનિને વનમાં સિંદ કાથા આદિ પ્રાણી  
સામા ભલે તો મુનિ ભારગ છોડે નહીં.

૩ સખાય-સાથ હેનાર

## મુનિ ગુણ મહત્વ વિચાર વિભાગનું પરિશાષ-પ્રક્ષોત્તર.

- ૪૦ હે પૂજય ! જે મુનિઓ દ્રવ્ય વહે નવ અંગે પૂળ કરાવે તથા તપના પારણાની બોલી બોલાવે, એ દ્રવ્ય પોતાની નિશાએ સંશ્રષ્ટે યાતો ઇંડ તરીકે રાખે તે મુનિઓ બકુશ-કુશીલમાં ગણ્ય કે પાસ્ત્યા દિકમાં ?
- ૪૧ જે મુનિઓ ઉપરોક્ત પ્રવૃત્તિને મોહના ઉદ્ય જન્ય માને યાતો અનાચાર માને છતાં ત્યાગી શક્તા ન હોય તે મુનિઓ બકુશ-કુશીલમાં ગણ્ય, જે એને આચારોક્ત માને તો પાસ્ત્યા દિકમાં ગણ્ય.
- ૪૨ તે શુરૂ દ્રવ્ય તરીકે ગણ્યાવીને મુનિઓ પોતાની વૈયાવચ્ચમાં ઉપયોગ કરાવે, તે ચોઝ્ય છે ?
- ૪૩ આનો ઉત્તર પણ ઉપર પ્રમાણે જાણુંબો.
- ૪૪ શાન દ્રવ્ય મુનિઓ પોતાની પાસે રાખે તે ચોઝ્ય છે ? વળી સામાન્ય પૈસા પોતાની પાસે રાખે યાતો માણુસ પાસે રખાવે તેઓને બકુશ-કુશીલ ગણ્યા કે પાસ્ત્યા દિક ?
- ૪૫ ઉપરોક્ત પ્રવૃત્તિને અનાચાર માને તો બકુશ-કુશીલ અને એનાથી વિપરીત માનેં તો પાસ્ત્યા દિક.
- ૪૬ હે શગવાન ! જે મુનિ શખલી હોય એટલે કે હસ્ત કર્મ કરે, સુષ્ઠિ વિર્દ્ધ કર્મ કરે, એકાન્તમાં સ્વી સંપર્કમાં આવે, સૂર્ય આથમે ત્યાં સુધી લોજન પાન કરે વિગેરને બકુશ-કુશીલ ગણ્યવા કે પાસ્ત્યા દિક ?

- ૭૦ એનો ઉત્તર પણ ઉપરોક્ત જાણવો.
- ૮૦ હે પૂજ્ય ! જે મુનિઓ અગીતાર્થ છતાં ચોમાસે જય યાતો ચોમાસે ગુરું મેં કલે રાખ કાળમાં વિહારની છુટ આપે યાતો પોતે છુટ કે તેઓને બંકુશ-કુશીલ ગણુવા કે પાસ્ત્થા દિક ?
- ૯૦ એનો ઉત્તર પણ ઉપર પ્રમાણે જાણવો.
- ૧૦ જે. અગીતાર્થ છતાં એકદો વિચરે, અને જે મુનિઓ ગીતાર્થ એકેત્વ પડિમા ધારી હોય તથા ગીતાર્થ એકેત્વ વિહારી હોય તેમની ટીકા કરે અપભ્રાણના કરે તો તેઓને કેવા ગણુવા ?
- ૧૧ જે મુનિ અગીતાર્થ વિહારની પુષ્ટિ કરે તેને યથાછ દો ગણુવો, અને ગીતાર્થના વિહારની ટીકા કરે તે પણ યથાછ દો ગણુવો.
- ૧૨ જે મુનિઓ પોટલાં રાખતા નથી અને સાથે મળુર લેતા નથી અને ગૃહદસ્થો પાસે રૈલ્વે યા મોટર દ્વારા પોટલાં મંગાવે તેઓને કેવા ગણુવા ?
- ૧૩ પોતાની પ્રવૃત્તિને અનાચાર માને તે બંકુશ-કુશીલ એને આચાર માને તે પાસ્ત્થાદિક. આ બાબતોમાં સહુએ પોત પોતાના ભાવોનો વિચાર કરવાનો છે, બીજના ભાવ જાણુવાની શક્તિ નથી તો નિંદા કે ટીકા કરવાનો પણ કોઈને અધિકાર નથી. મારે પારકાની પંચાત છોડીને પોતામાં સમાઈ જવું એ જ હિતાવહ છે.
- સં. ૨૦૧૮ના પોષ શુદ્ધી ૧૦ મહુવા બંદર.

## ફુ શ્રી ગૌતમાષ્ટક છંદ ફુ

વીર જિનેશ્વર કેરો શિષ્ય ગૌતમ નામ જપો નિરા દશ ॥  
 જે કુને ગૌતમનું ધ્યાન તો ધર વિલસે નવે નિધાન ॥ ૧ ॥  
 ગૌતમ નામે ગિરિશ્વર ચહે, મન વાંછિત હેલા સંપન્ને ॥  
 ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ ચંલેગ ॥ ૨ ॥  
 એ વેરી વર્ણા વંકડા તસ નામે નાવે હુંકડા ભૂત પ્રેત નવિ  
 મંડે પ્રાણ તે ગૌતમના કરું વખાણુ ॥ ૩ ॥ ગૌતમ નામે  
 નિર્મણ કાય, ગૌતમ નામે વાધે આય ॥ ગૌતમ જિન શાસન  
 શાણુગાર ગૌતમ નામે જથ જથકાર ॥ ૪ ॥ શાલ દાઢ સુરહા  
 ઘૃતગોળ, મનવાંછિત કાપઠ તંબોલ ધરે સુધરણી નિર્મણ  
 ચિત્ત ગૌતમ નામે પુત્ર વિનીત ॥ ૫ ॥ ગૌતમ ઉઘો અવિચળ  
 લાણ ગૌતમ નામ જપો જગ જાણુ ॥ મોટાં મહિર મેડ  
 સમાન ગૌતમ નામે સકુળ વિહાણુ ॥ ૬ ॥ ધર મયગલ  
 ઘોડાની બેઠ વાડ પહેંચે વાંછિત કોડ ॥ મહિયલ માને  
 મહોટા રાય જે તુઠે ગૌતમના પાય ગૌતમ પ્રાણુભ્યા પાતક  
 ટળે, ઉત્તમ નરની સંગત મળે ॥ ગૌતમ નામે નિર્મણ જાન,  
 ગૌતમ નામે વાધે કાન ॥ ૮ ॥ પુણ્યવંત અવધારો સહુ,  
 ગુરુ ગૌતમના ગુણુ છે બહુ ॥ કહે લાવણ્ય સમય કર બેઠ  
 ગૌતમ તુઠે સંપર્તિ કોડ ॥ ૯ ॥

\*                    \*                    \*

### —: શ્રી સોણ સતીનો છંદ :—

આહિનાય આદે જુનવર વંદી સકુળ મનોરથ કુણાચે એ ॥  
 પ્રભાતે ડી મંગલિક કામે સોણ સતીનાં નામ લીજુચે એ  
 ॥ ૧ ॥ બાળકુમારી જગ હિતકારી પ્રાણી ભરતની બહેનડી  
 એ; ધટ ધટ વ્યાપક અક્ષર રૂપે સોણ સતી માંહે જેવડી એ  
 ॥ ૨ ॥ બાહુબલ લગિની સતીય શિરોમણી સુંદરી નામે

ઋષભસુતા એ ॥ અંક સ્વરૂપી ત્રિલુચન માંહે જેહ અનુપમ  
 શુણું જુતા એ ॥ ૩ ॥ ચંદ્રનથાલા બાળપણાથી શિયળ વતી  
 શુદ્ધ શ્રાવિકા એ ॥ અહદના બાકુલા વીર પ્રાત લાલ્યા કેવલ  
 લહી વત ભાવિકા એ ॥ ૪ ॥ ઉથસેન ધૂઆ ધારિણી નંહિની  
 રાજુમતી નેમવલ્લભા એ; જેણન વેષે કામને જીત્યો સંજમ  
 લેઈ હેવ હુલ્લભા એ ॥ ૫ ॥ પંચ ભરતારી પાંડવ નારી  
 તનયા વણાણીએ એ ॥ એક સે આડે ચીર પુરાણુા શિયળ  
 મહિમા તસ જાણીએ એ ॥ ૬ ॥ દશરથ નૃપતી નારી નિર-  
 પમ કૌશલ્યા કુલચદ્રિકા એ; શિયલ સલુણી રામજનેતા,  
 પુણ્યતણી પરનાલિકા એ ॥ ૭ ॥ કૌશાંખિક ઠામે શતાનીક  
 નામે રાજ્ય કરે રંગ રાજુઓ એ ॥ તસ ધર ધરણી મૃગપાતી  
 સતી સુર ભુવને જશ ગાણ્યો એ ॥ ૮ ॥ સુલવસા સાચી  
 શિયલે ન કાચી, રાચી નહી વિષયારસે એ; સુખડું જેતાં  
 પાપ પલાએ નામ લેતાં મન ઉલ્લસે એ ॥ ૯ ॥ રામ રધુ-  
 વંશી તેહની કામની જનકસુતા સીતા સતી એ ॥ જગ સહુ  
 જાણે ધીરજ કરતાં અનલ શીતલ થયો શિયલથી એ ॥ ૧૦ ॥  
 કાચે તાંખે ચાલણી ખાંધી કુવાથકી જલ કાઢીયું એ ॥  
 કલંક ઉતારવાં સતી સુલદ્રા ચાંપા બાર ઉધાડિયું એ ॥ ૧૧ ॥  
 મુર-નરવંદિત શિયળ અખંડિત શિવા શિવપદ ગામિની એ;  
 દેહને નામે નિર્મળ થઈએ અલિહારી તસ નામની એ  
 ॥ ૧૨ ॥ હસ્તિનાપુરે પાંડુરાયની કુંતા નામે કામિની એ ॥  
 પાંડવ માતા દરો દશાર્ણુંની ખેન પતિમતા પદ્ધિની એ ॥ ૧૩ ॥  
 શીલવતી નામે શીલવત ધારિણી ત્રિવિઘે તેહને વંદીએ એ ॥  
 નામ જ્યુંતા પાતક જચે દરિશાણું હુરિત નિકંદીએ એ ॥ ૧૪ ॥  
 નિષીધા નગરી નલહ નરિંદની દમયંતી તસ જેહિની એ ॥  
 સંકટ પહતાં શિયલ જ રાજ્યું, ત્રિલુચન કીર્તિ જેહની એ  
 ॥ ૧૫ ॥ અનંગઅજીતા જગ જન પૂજિતા પુણ્યચુલ્લા ને

પ્રભાવતી એ ॥ વિશ્વ વિષ્ણ્વાતા કામિતદાતા સોળમી સતી  
પદ્મવતી એ ॥ ૧૬ ॥ વીરે ભાઈ શાસ્ત્રે સાઈ ઉદ્યર્તન  
લાએ સુદ્ધા એ: વહૃણું વાતાં જે નર લાણુશે તે લહેશે સુખ  
સંપદા એ ॥ ૧૭ ॥

\* \* \*

## ફં શ્રી માણિલદ્રજીનો છંદ ફં

( રાગ-ચોચાઈ )

શ્રી માણિલદ્ર સદા સમરો, ઉર ખીચમે ધ્યાન અખંડ ધરો;  
જીપીયાં સહુ જ્ય જ્યકાર કરે, ભજીયા સહુ નિત્ય લંડાર  
લરે ॥ ૧ ॥ જે કુશલ કરે નામ લીયાં, આણુંદ કરે હેવ  
આશકીયાં; સૌલાગ્ય વધે જગ સહસ ગુણો, દિવ સેવ્યાં પ્રભુ  
હે જસ હુણો. ॥ ૨ ॥ અરિયણુ સહુ અળગા લાગે, વિરુચા  
વેરી જન પાય લગે; સંકટ સોગ વિશોગ હુરે, ઉણવેલા  
આય સહાય કરે ॥ ૩ ॥ ભૂત અયંકર સિંહ લાગે, જલ્થ  
ઝેગણુ સાયણુ નવિ લાગે; વાય ચોરાસી જય વહિલા,  
લખમી સહુ આય મિલે પહેલી ॥ ૪ ॥ ગુડ પાપડીયા ગુરુ-  
વાર દિને, લાપસીયા લાડુ દીઓ ઈણુને; ધૂપ દીપ અખંડ  
નૈવેદ્ય ધરો, આડમ દિન પૂજ અવક્ષ્ય કરો ॥ ૫ ॥ જેને  
દિન પ્રતિ જપ સદા, તસ સુપનાંતરે પ્રત્યક્ષ તદા; જીપીયાં  
સહુ જવે આપદા, કોઈ મણુ ધરે રહે ન કદા ॥ ૬ ॥ મેં  
મત સાર્દ મોજ મૈજ કીયો, ગુણ સિંહુ જિસ્યો તુમ ગુણુ  
ભર્યો; દીનાનાય સુદ્ધયાજ કરો, શિર ઉપર હાથ દીયાં જ  
પરો ॥ ૭ ॥ ભવિયણુ જે લાવે ભજસી, કારજ સિદ્ધ સહી  
કરસી; પૂજ્ય પુત્રવધે હૂણું, કીણુ વાતે કહિ નહિ રહૈ ઉણું  
॥ ૮ ॥ શ્રી માણિલદ્રજી મનમે ધ્યાવો, સુખ સંપત્તિ બહુ  
વેગે પાવે; લક્ષ્મી કીર્તિ વળી આપ લહે, શિવ કીર્તિ મુન  
ઇમ સુજસ કહે ॥ ૯ ॥

## સ્વાર્થાય પદ (સજાય)

( રાગ-બૈષણ જન તા )

જૈન જીવન તેહને કહીએ, વિશ્વ મૈત્રી ધરતા રે  
 શિવં અસ્તુ સર્વ જગતઃ શાસ્ત્રે વાડય વહેત્તા રે. જૈન ૧  
 થાવર જીવની યતના પાલે, ત્રસની રક્ષા કરતા રે,  
 ન્યાત જીતનો લેદ મૂકીને, માંહાની માવજત વરતા રે. જૈન ૨  
 અપંગ માનવ પશુ પંખીની, હ્યા દીલમાં ધરતા રે,  
 પરદુઃખ દેખી દુઃખી થાતા, ન મૂકે દીલની ધીરતા રે. જૈન ૩  
 સત્ય સંગાથે સંભંધ રાખી, વહે વાણી નીરદલી રે,  
 સાત પ્રકારે ચોરી ના ત્યાગી, ન ત્યાગે તે નીરલાગી રે. જૈન ૪  
 પરનારીને અગિની માને, સ્વનારી સંતોષી રે,  
 ને પરનારીથી રાચેમાચે, ધ્યાન જીવનના દોષી રે. જૈન ૫  
 પરધુરુષને બંધુ માનતી, પતીની સેવા કરતી રે,  
 ટાપ ટીપને કટાક્ષ વાહો, પતીને ચરણે ધરતી રે. જૈન ૬  
 રાજ્ય નીતિ ને વ્યવહાર નીતિ, ધર્મ નીતના ઘોરી રે,  
 ન કરે કોઈનો વિશ્વાસધાત, ન કરે દાણુની ચોરી રે. જૈન ૭  
 એ ત્રણે નીતિ લક્ષમાં રાખી, કરે વેપાર કુલ ચોષ્ય રે,  
 દ્રવ્યનું પ્રમાણ ઉરીને, ન રાખે અધિકું લોગ્ય રે. જૈન ૮  
 આણુપ્રત શ્રાવકના લઈ, પાલે સહ્ય આચાર રે,  
 ધ્યાન ધન્ય એ માનવ જીવન, સત્યાનંદ સુખકા રરે. જૈન ૯

## ધર્મજીજન લક્ષ્મા સ્વર્ગયાત્રા

(રાગ વંષ્ણવ જન તો....)

ધર્મજીજન તો તેને કહોએ, સુખી સહુને ચાહે રૈ;  
 હુઃખી હેખી દ્વયા દિલની, મનથી કદી ન જાયે રૈ. ધ. ૧  
 પાપી ઉપર પ્રેમ લાવીને, પોતાનો કરી માને રૈ;  
 અવસર નેઈ ઉપહેશ કરી. ચઢાવે ગુણુના સ્થાને રૈ. ધ. ૨  
 પરપીડા કહી મને ન ધારૈ, ચહે જીવોની શાતા રૈ;  
 પરધન પત્થર સમાન માને, પરનાર જેની માતા રૈ. ધ. ૩  
 નિંદા નરકની ખાણુ જ માને, ૧ શંશા પુષ્યનું ધામ રૈ;  
 સોખત સંતની સહા ચાહતો, ઝુદ્ધે ન રાખે કામ રૈ. ધ. ૪  
 વીતરાગ સાથે ઠંડાલજ કરતો, ધરતો સોડહં ધ્યાન રૈ;  
 સાડહં સોડહં રઠના જોહને, પામી આતમ જાન રૈ. ધ. ૫  
 જન્મ જરા ને મૃત્યુ મારગ, ટાળતો આતમજ્ઞાની રૈ,  
 ધર્મ ઢાંગ તજીને ચાલે, કર્મે પાધી પાની રૈ. ધ. ૬  
 ન્યાત જતનો લેછ ભૂવીને, મત પન્થે ન રાચે રૈ;  
 આતમ ધિશ્વર એકજ સમજ, દ્વયા દિલમાં યાચે રૈ. ધ. ૭  
 દ્વયા જગતની જનની જાણી, દ્વયા મોક્ષની વાટ રૈ  
 દ્વયા દિલમાં રાખી જેને. કરી કર્મની ઝાડ રૈ. ધ. ૮  
 ચંપક સાગર દ્વયા ભાવમાં. સહા રમણુતા રાખે રૈ;  
 તર્યા જીવો તરતા જીવો, તરશો દ્વયાની સાખે રૈ. ધ. ૯

૧ શંશા-પ્રથંસા

## शुद्ध पत्रकः

१४	पंक्ति	अशुद्ध	शुद्ध
३	६	जीवो	जीवः
३	७	सयम्	संयम
३	१६	धर्मः	धर्मः
३	१६	योगस्तं कथितं बुधैः योगः स कथितो बुधैः	
३	१७	निर्वृत्तिं गुणः	निर्वृत्तिं गुणम्
३	१७	सुखी	सुखी
४	५	पुज्य	पूज्य
४	६	पटालङ्कार	पट्टालङ्कार
४	९	पुज्यानां	पूज्यानां
४	१०	विचारं पुस्तिका रूपा	विचारं रूपा पुस्तिका
४	१४	संवत्सरे	संवत्सरे
४	१८	धर्मे	धर्मे
४	२१	दाम्भिकानां	दाम्भिकानां
४	२३	सहासकृतः	सहासःकृतः
४	२३	तथापि	तथाऽपि
५	१	यत्सुशज्ज्य	यत्सुराज्ज्य
५	९	शैथिल्य	शैथिल्य
५	२	भारतदेवताः	भारतदेवताः

પૂર્ણ	ફંક્શન	અશુદ્ધ	શુદ્ધ
૬	૪	પ્રાણય	પ્રાણીન
૭	૪	આશ્રયમલમેહન	આશ્રયમલમેરન
૮	૫	ભાગ	ભાગ
૯	૧૫	પુજા	પુજા
૯	૧૪	સુતજ્ય	સુતજ્ય
૯	૧૬	ગૌહવ	ગૌરવ
૯	૧૬	દૂર્દ્ય	દુર્દ્ય
૯	૧૮	પ્રવૃત્તિ	પ્રવૃત્તિ:
૯	૨૦	કથાશ્રિત	કથાશ્રિત
૯	૨૦	મહાદુષ્કર	મહાદુષ્કર
૯	૨૪	પુસ્તકસ્ય	પુસ્તકસ્ય
૧૦	૧	ઝ્યો	ઝ્યો
૧૦	૨	દૂરીકરણે	દૂરીકરણે
૧૦	૬	ઘકુશા	ઘકુશા
૧૦	૬	નિરીક્ષણોવ	નિરીક્ષણીય:
૧૦	૯	મે	મે
૧૦	૭	અસ્યાકૃતે:	અસ્ય કૃતે:
૧૦	૧૩	સંશોધન	સંશોધન
૧૦	૧૪	પ્રસેદ્ધ	પ્રસેદ
૧૦	૧૮	લછુ	લબુ
૧૧	૧૧	આ દરી	આદરી
૧૧	૧૧	ઓકદિશ્યે	ઓકાદશ્યે
૧૨	૧૭	ગણુ	ગણુ

આ પુસ્તકનો ઉપયોગ કરનાર મુમુક્ષુએ શુદ્ધિ  
પત્રકથી સુધ્ધારીને ઉપયોગ કરવો.

-: શુદ્ધિ પત્રક :-

પૃષ્ઠ	પંક્તિ	અશુદ્ધ	શુદ્ધ
૧	૨	નામોનમઃ	નમોનમઃ
૧	૧૩	મુનિયોનાં	મુનિઓના
૧	૧૭	સંયભિયો	સંયભિયો
૧	૧૮	"	"
૨	૧૪	દર્શનમા	દર્શનાં
૨	૧૫	"	"
૩	૧૬	પ્રતકુશલ	પ્રતકુશાલ
૪	૧૫	કર	કરે
૪	૧૮	વિનયના	વિનયની
૪	૨૫	નિર્દ્દંભયણે	નિર્દ્દંભપણે
૫	૨૩	મેક્ષ	મેક્ષ
૬	૫	પુષ્યકૃતાર્થ	પુષ્યકૃતારથ
૬	૭	વિતિગંધાએ	વિતિગંધાએ
૬	૧૨	ભવ	ભાવ
૬	૨૦	પૂર્વક	પૂર્વક
૭	૧૨	છીમેષ	છીષ
૭	૧૫	અગ્નિથા	અગ્નિથા
૮	૧	વેષે	વિષે
૮	૨	શિષ્યો	શિષ્યા
૮	૪	દર્શન	દર્શન
૮	૪	ચારિત્રના	ચારિત્રના

ફુલ	પાંકડ	અશુદ્ધ	શુદ્ધ
૬	૫	ખાતર જ	ખાતર જ
૬	૬	અજવતો	અજવતો
૬	૬	સતી	સતી
૬	૧૧	ગેળી	ગેળી
૬	૧૬	સવથા	સવથા
૬	૧૭	પારસી	પારસી
૬	૧૮	નિષેખણી	નિષેખણી
૧૩	૧૪	પાળવાનો	પાળવાનો
૧૦	૧૫	અન તાતુઅધી	અનંતાતુઅધી
૧૦	૨૪	ડાંડાંડિક	ડાંડાંડિક
૧૧	૧૮	પાટલા	પોટલા
૧૧	૧૨	કહેવાય	કહેવાય
૧૧	૨૧	નવ	નૈવ
૧૨	૨	અધારામા	અંધારામા
૧૨	૩	સભવ	સંભવણ
૧૨	૬	અકૃ	એક
૧૨	૧૨	મોહકીયા	મોદ્કીયા
૧૨	૧૪	દસવાળી	દાસવાળી
૧૨	૧૬	સર્વથી	સર્વથી
૧૨	૨૪	પરપરીવાદિ	પરપરિવાદાદિ
૧૩	૩	લોક	લોકો
૧૩	૨૦	વિષેધ	નિષેધ
૧૪	૨	અન્યાતરથી	અન્યાંતરથી
૧૪	૩	શિષ્યા	શિષ્ય !
૧૪	૧૮	અષ્ટ	અષ્ટ

પૂર્ણ	પંક્તિ	અશુદ્ધ	શુદ્ધ
૧૪	૧૮	વિલમ્મ	વિલમ્મ
૧૪	૧૯	પરમપ્યાણ'	પરમપ્યાણ'
૧૫	૫	સીમંધર	સીમંધરા
૧૬	૬	દાક્તે	દ્રાક્તે
૧૬	૬	શૂલ	શૂલ
૧૬	૨૪	ગૃહી	ગૃહી
૧૬	૨૪.	માચિકા	માચિયા
૧૬	૨૪	કુગુરૂપદ	કુગુરૂમદ
૧૭	૪	શાસનથી	શાસનની
૧૭	૭	બેન્ડ	બેન્ડ
૧૭	૮	છે	છે કે
૧૭	૧૫	પોતાને	પોત
૧૮	૬	સર્થ	સર્પ
૧૮	૬	અથ્રિ	અભિ
૨૦	૪	સ્વશરીને	સ્વશરીરને
૨૦	૧૬	કુંડળનું	કુંડળના
૨૦	૧૬	સાન	સાત
૨૧	૫	ક્ષેત્રે	ક્ષેત્રો
૨૧	૧૦	પવતો	પર્વતો
૨૧	૧૬	અથ્રિ	અભિ
૨૨	૧૨	૩૫	X
૨૨	૧૮	અતાં	અને
૨૩	૮	અંઝાવતો	અંઝાવતો
૨૪	૨	વાગ	વાગ્
૨૪	૬	આભૂષણુતા	આભૂષણના

પૃષ્ઠ	પંક્તિ	અશુદ્ધ	શુદ્ધ
૨૪	૨૦	હદ્યમાં	હદ્યમાં
૨૫	૫	આકોયાદિ	આકોયાદિ
૨૫	૨૦	પાત્રાદિ	પાત્રાદિ
૨૬	૫	ગૃહણુ	ગૃહણુ
૨૬	૬	અનાચાર	અનાચાર
૨૭	૧૫	નિદે	નિદે
૨૮	૭	સસારઃપ	સસારઃપ
૨૮	૧૨	સુંગધાદિકથી	સુગંધાદિકથી
૨૯	૭	ખીજ	ખીન
૨૯	૧૨	સનમાર્ગ	સનમાર્ગ
૨૯	૨૧	વિરવામાં	વિચરવામાં
૩૦	૨૩	સવ	સવે
૩૦	૧૧	ખીલે	ખીલ
૩૨	૨૦	અપ્રતમ	અપ્રમતા
૩૪	૪	ધરતી	ધરતો
૩૪	૧૪	થાંબે	થાંબે
૩૫	૬	ખારા	ખારા
૩૫	૨૦	દેવગુરુ	દેવગુરુઃસુ
૩૫	૨૦	સુદેષ	દેષ
૩૬	૨૪	ધણી	ધણી
૩૭	૬	પખી	પંખી
૩૭	૨૧	અવિતત્વ	અવિતથ
૪૧	૧૪	સયમ	સંયમ
૪૧	૨૩	થાય	થાય
૪૨	૧૦	ધરાય	ધરાયો

પૃષ્ઠ	પાંકન	અશુદ્ધિ	શુદ્ધિ
૪૨	૧૧	સાહીસ	સાહીય
૪૨	૧૬	મૃતવાદ	મૃત્યાવાદ
૪૩	૪	સેવ	સેવ-
૪૩	૫	અનુમોદ્યું	અનુમોદ્યું
૪૩	૧૫	ગર્ભિન	ગર્ભિન
૪૩	૨૦	જુઠા	જુઠી
૪૩	૨૨	થેખસે	થેખસે
૪૪	૩	સદગુર	સદગુર
૪૪	૧૨	દેખ્યે બાઈ. ૧ બચન રાખે કાય દ્વારા રાખે મિટે ન મન અપલાઈ	
૪૪	૧૪	કથન	કથન
૪૪	૧૭	વખાતે	વખાણું
૪૪	૧૮	સાથે	સાધે
૪૫	૫	મોતે	મોહે
૪૫	૭	ઘન	ઘન
૪૫	૧૧	ગહિતે	ગહિને
૪૫	૨૦	નવ	નવિ
૪૫	૨૧	સ્થાવરની	સ્થાવરની
૪૬	૨	નામી	નાગી
૪૬	૧૧	દેવતો છલે યા વિધ અંન્દ મે	દેવચન્દ છલે યા વિધતોમે
૪૬	૧૬	ભવ	ભવ
૪૮	૧૧	જલ	જલ
૪૮	૧૨	ઉનકું	યાકાં
૪૮	૧૨	ધ્યાવે	ધાવે

૧૧૧:

પ્રદ્રિક્ત	પદ્ધતિ	અશુદ્ધિ	શુદ્ધિ
૪૮	૧૫	પથયિસે	પર્વાયસ
૪૮	૧૮	જરૂર	જરૂર
૫૦	૧૦	તણે	તાણે
૫૦	૧૨	છડી	છઢી
૫૦	૧૬	સરે	સરે
૫૦	૧૭	આપ	આપ
૫૧	૩	હું હી	હું હી
૫૧	૪	હું હોજ	હું હોજ
૫૧	૭	મને	મને
૫૧	૧૫	દીઠે	દીઠો
૫૨	૩	મહામણ્ડળ	મહીમણ્ડળ
૫૨	૪	લચ્છા	લચ્છો
૫૨	૧૦	તાયં	તોયં
૫૨	૧૩	સુમહષ્યં	સુમહષ્યં
૫૨	૨૩	અત્યત	અત્યંત
૫૩	૬	શૈથ્યી	શૈથી
૬૧	૩	હા	હો
૬૧	૧૬	ધન	ધન
૬૨	૨૦	રાનધર	રાનધર
૬૪	૫	ધંટમાં	ધૂમા
૬૫	૧૪	ચોંટડરું	ચોંટડરું
૬૫	૧૬	પૂર્વકને	પૂર્વકને
૬૫	૨૫	ધહિલોક	ધહિલોક
૬૭	૧૩	ખ	ખી
૬૭	૨૩	સદાયારી	સદાયારી

પ્રથ	પંક્તિ	આશુદ્ધિ	શુદ્ધિ
૬૮	૧૩	કરવે	કરવો
૬૯	૩	લવતી	લવતી
૭૦	૩	પામે;	પામે;
૭૧	૧૭	અન્યાયથા	અન્યાયથી
૭૧	૨	સસારમાં	સંસારમાં
૭૧	૪	ભાંગતું	ભાંગાતું
૭૩	૧૧	બંધ	બંધ
૭૩	૧૮	રહે	રહે
૭૪	૧૬	ભાડ	ભાડ
૭૪	૨૨	સત્પુષ્પ	સત્પુર્પ
૭૫	૧૩	ઘેરી	ઘૈરી
૭૬	૧૬	એમને	એને
૭૬	૨૫	વસ્ત	વસ્ત્ર
૭૭	૧૫	અને	અને
૭૮	૨	દુર્ગંધ	દુર્ગંધ
૭૮	૨૬	સંતાન	સંતાનાથી
૭૯	૧૧	નિરેખ	નિરેખ
૮૦	૭	ભાડારના	ભાડારના
૮૪	૧૬	ક્રમેન્દ્રિય	ક્રમેન્દ્રિય
૮૫	૧૩	તથ	તથા
૮૬	૧૪	તેમાં	તેમાં
૮૨	૧૮	સંબંધ	સંબંધ
૮૩	૨	ધૂતે	ધૂતો
૮૩	૫	ઓલષુને	ઓલષુને
૮૩	૫	સંપી	સાંપી

આનંદ માન સદાતું, ચંપકની સુગંધ લેવામાં;

અહું ત્યાગી હુજુને આદેખ, ખરો ગુણું રખુની સેવામાં .૧

મહુપુરી (મહુવા) શ્રી મહાવીર

